



श्रीनिनायनमः

श्री

# तिर्थवर्णन भक्तिभाषा.

रथनार

भगवनलाल इक्कीरथं ह शाहु.

स्वेशन—अमलसाड.



छपावी प्रसिद्ध करनार

श्रावक लीभसिंह भाष्णेक.

प्रसिद्ध करनारे सर्वं हक्क स्वाधीन राख्या छे.

संयोजक


श्री जैन भित्र भांडा—अमलसाड.

संवत् १८७८

सने १९२३

માંડવી શાકગલીમાં આવેલ ધી ન્યુ લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસમાં  
૩૩. લક્ષ્મીચંદ હુરિરજલાલ લોડાયાએ છાયું  
મુંખથ. પોસ્ટ નં. ૩

# ଓପୋଦ୍ଧାତ



તିର୍ଥ୍ୟାତ୍ମା ଵର୍ଣ୍ଣନା ପୁସ୍ତକେ ଧାଣ୍ୟାଚେ ବାହାର ପତ୍ୟା ହଶେ ଅନେ ପତ୍ୟା, ପରଂତୁ ଆ ପୁରୁଷଙ୍କରୀ ଅଂଦର ବଧାରାମା ଫଳତ ଏଟଲୁଙ୍ଗ ଛେ କେ ଅନୁଭବେଳୀ ଅଜ୍ଞାଣେ ଅନେ ଜାତ୍ରାଗୁରୁଙ୍କେ ସୁଗଭତା ଦର୍ଶାବେଳୀ ଛେ. ଵଣୀ ଆ ପୁସ୍ତକଙ୍କରୀ ଅଂଦର ଯେ ଭାଗେ ପାଡ଼ିବାମା ଆବ୍ୟା ଛେ. ପ୍ରଥମ ଭାଗନୀ ଅଂଦର ଲୁଭିକା (ଡାଣୁ ଡାଣୁ ଗୃହସ୍ଥ କଥ ତାରିଖେ ଜାତ୍ରାର୍ଥୀ ନିକେଳା.ତେ ), ତିର୍ଥୀନୁ ଵର୍ଣ୍ଣନ, ପଞ୍ଚତିର୍ଥନୀ ନଗରୀଆ, ରେଖନା ଭାଇଙ୍କେ ଅନେ ଗାଡ଼ାନା ତଥା ପଗରସତାନା ମାଧ୍ୟମେ, ତଥା ମୋଟା ତିର୍ଥୀନା ସରନାମା ବିଗେରେ ବାପତୋ ଜଣ୍ମବେଳୀ ଛେ. ଭିନ୍ନ ଭାଗନୀ ଅଂଦର ଏକ ମନୁଷ୍ୟ ସାଧାରେୟ ଧାର୍ମିକ ନିତ୍ୟକର୍ମ କରି ଶକେ ଏବନୀ ବାପତୋ ଆପି ଛେ. ଏନୀ ଅଂଦର ଦର୍ଶନ ଭାବନା, ପୂଜା ପ୍ରକରଣ, ସାମାଯକ ଲେଖାନୀ ତଥା ପାରିବାନୀ ବିଧି, ଚୈତ୍ୟବନ୍ଦନୋ, ସ୍ତଵନ, ଆରତୀଆ, ବିଗେରେ ବାପତୋନୋ ସମାବେଶ କରିବାମା ଆବ୍ୟା ଛେ.

ଆ ଲଧୁ ପୁରୁଷଙ୍କ ବାହାର ପାଡ଼ିବାରୀ ଦରେକ ଲୈନ ଅନ୍ଧୁଙ୍କେ ଅହର୍ଯ୍ୟ ଶିଵାୟ ସୁଗଭତାରୀ ତିର୍ଥୀନୀ ମୁସାଫିରୀ କରି ଆତମାନେ ଫୁଲାର୍ଥ କରେ ଏମଜ ଆଶା.

ଲୁଭିକାମା ଦର୍ଶାବେଳା ଗୃହସ୍ଥୀନୀ ଅଂଦର ଦରେକ ରୀତନୋ ରଂଗ ସମାଧେଲୋ ହିତୋ, ଏଟିକେ ସଂଧନୀ ଅଂଦର ଡୋଢ଼ ଜୁହୋଜ ଆନନ୍ଦ ଇକ୍ଷାୟ ରହେଲୋ. ଵଣୀ ୩୧୦ ଫଳିରଚ୍ୟାଙ୍କ ଲାଲଚ୍ୟଙ୍କ ତରକ୍ଷିତୀ ସଂଧନୋ ହିସାବ ତଥା ଲେନ୍ଦ ଦେବତନୁ କାମ ସଚନାତୁ ହିତୁ, ଜ୍ୟାରେ ୩୧୧. ହୀରାଚ୍ୟଙ୍କ ଧୁଲଚ୍ୟଙ୍କ ତରକ୍ଷିତୀ ରେଖେନୀ ଅଂଦର ସବୁ ଜାମ କରିବାନୁ ତେମ ଶ୍ରୀକୋଟୀ ଭରିବାନୁ କାମ ସଚନାତୁ ହିତୁ. ଖରେଖର ସଂଧନୀ ସେବା ଅନ୍ତରବାନୁ କାମ ଏହୋନେଇ ଧରେ ଛେ.

આ પુસ્તકની અંદર કેટલીક ખાયત અનુભવેલી છે, તેમ કેટલીક ખાયતો બીજા અંથની સહાયથી લેવામાં આવેલી છે, અને લખવામાં જે કે ખનતી કોશેશ રાખવા છતાં પ્રિય વાંચક વર્ગને તેમાં થયેલી હસ્તદોપની ભુલો નજર આવશે તો આશા છે કે સુજા ગૃહસ્થો ક્ષમા અક્ષી સુધારી વાંચશે.

લીઠ મગનલાલ ઇં. શાહુ



# અનુક્રમાંકિકા.

## મુખ્યમ અંડ

નંબર વિષય

- ૧ ટાઈટલ
- ૨ અનુક્રમાંકિકા
- ૩ પ્રસ્તાવના
- ૪ મંગલાચરણ

નંબર	વિષય	પૃષ્ઠ	નંબર	વિષય	પૃષ્ઠ
૧	ભૂમિકા	૧	૧૮	નાથનગર	૨૨
૨	ભુસાવળ	૩	૧૯	લખેસરાધ	૨૨
૩	આંકાલા	૪	૨૦	કાકંડી	૨૩
૪	અંતરીક્ષ પાર્શ્વનાથ	૫	૨૧	લઘવાડ	૨૪
૫	નાગપુર	૮	૨૨	ક્ષત્રીકુંડ	૨૪
૬	રાયપુર	૯	૨૩	કીયુલ	૨૫
૭	ગીરીડી	૧૦	૨૪	ગુણીચાળ	૨૫
૮	મંદુવન	૧૦	૨૫	પાવાપુરી	૨૫
૯	શીખરાલ	૧૨	૨૬	ધીહાર	૨૭
૧૦	કંદકતા	૧૪	૨૭	કુંડલપુર	૨૮
૧૧	અજમગંગ	૧૭	૨૮	રાજબાલી	૨૮
૧૨	મહેમાપુર	૧૮	૨૯	પટના	૩૩
૧૩	કટગોલા	૧૯	૩૦	ગયાળ	૩૪
૧૪	બાદોચર	૧૯	૩૧	કારી (અનારસ)	૩૪
૧૫	મુર્શિદાખાદ	૨૦	૩૨	રીંદુપુરી અને	
૧૬	ભાગલપુર	૨૧		ચંદ્રાવતી	૩૭
૧૭	ચંપાપુરી	૨૧	૩૩	અલાહાદ	૩૮

નંબર	વિષય	પૃષ્ઠ	નંબર	વિષય	પૃષ્ઠ
૩૪	અગોધ્યા	૩૬	૫૬	રાણીગામ	૫૮
૩૫	કુટુંબયાદ	૪૦	૫૭	વરકાણાજ	૫૮
૩૬	નવરાહી (રલપુરી)	૪૧	૫૮	નાંદોલ	૫૮
૩૭	લખનૌ	૪૧	૫૯	નાંદવાધ	૫૮
૩૮	કાનપુર	૪૪	૬૦	ધારો	૫૮
૩૯	કાયમગંજ અને કુપીલાપુરી	૪૫	૬૧	મુશ્વાલા મહાવીર	૬૦
૪૦	શાકોહાયાદ અને સોરીપુરી	૪૬	૬૨	સાદી	૬૦
૪૧	મથુરા	૪૬	૬૩	રાણુકપુર	૬૦
૪૨	વૃંદાવન	૪૭	૬૪	આમનગડા	૬૧
૪૩	દીલ્હી	૪૮	૬૫	નાઈયા	૬૧
૪૪	હસ્તીનાપુર	૪૮	૬૬	આયુરોડ ઘરેરી	૬૩
૪૫	આચા	૫૦	૬૭	માઉન્ટ આયુ	૬૩
૪૬	નેપુર	૫૧	૭૦	કુલારીચાજ	૬૬
૪૭	બીકાનેર	૫૩	૭૧	અમારીયાત્રાનો	
૪૮	કુલોધી	૫૪			અંત.
૪૯	નોધપુર	૫૪	૭૨	મેસાળું	૬૭
૫૦	નેસલમેર	૫૫	૭૩	તારંગાજ	૬૮
૫૧	ઉદ્દેપુર	૫૫	૭૪	લોથણી	૬૮
૫૨	કેશરીચાજ	૫૬	૭૫	શ્રીસંભેશ્વર	૬૯
૫૩	કરેડા પાર્થનાથ	૫૭	૭૬	પાનસર	૧૯૦
૫૪	ચીતોડગઠ	૫૮	૭૭	ઉજનજન	૧૯૦
૫૫	અજમેર	૫૮	૭૮	શ્રી મગરીજ	૭૧
૭૮	શ્રીપંચ તિર્થની નગરીઓ				૭૧

૮૦ જાહેરિતા તિર્થનું ભાડું અને ખીજ નોંધ  
૮૧ મોટા તિર્થના એઉરેસો

૭૧  
૭૩

## દ્વિતીય ખંડ

નંબર	વિષય	પૃષ્ઠ	નંબર	વિષય	પૃષ્ઠ
૮૨	મંગળાચરણ રતુલી	૭૫	૮૬	સામાયક લેવાની	
૮૩	દર્શન ભાવના	૮૦	૮૭	વિધી	૧૧૦
૮૪	પ્રભાતીયું	૮૧	૮૭	સામાયક પારવાની	
૮૫	પુન પ્રકરણ	૮૨	૮૮	વિધી	૧૧૩
૮૬	શ્રી દ્વયપુના	૮૩	૮૮	મુહુરતિના પર્યાશ	
૮૭	શ્રી ભાવપુના	૮૪	૮૯	ઓલ	૧૧૩
૮૮	શ્રીચૈત્યવંદન	૮૪	૯૦	અંગના પર્યાશ	
૮૯	સ્તવનો	૮૭	૯૦	ઓલ	૧૧૩
૯૦	થોળો	૧૦૧	૧૦૦	પર્યાખાણુ	૧૧૪
૯૧	સંજગ્ય	૧૦૪	૧૦૧	આરતીઓ	૧૧૭
૯૨	હોરી	૧૦૫	૧૦૨	વર્તમાન ચોવીસ	
૯૩	લાવણીઓ	૧૦૬	૧૦૨	તીર્થંકરનો કોડો	૧૨૦
૯૪	મહાવીર સ્વામીનું પારણું.	૧૦૭	૧૦૩	ચોવીસ તીર્થંકરનું	
૯૫	ગુરૂવંદન	૧૦૮		ગાયન	૧૨૧



## मंगलअ॑र्थथना

अज्ञानातिभिरान्धानां, ज्ञानांजनश्लाकया ।

नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥१॥

श्रीशज्जुंजयमुख्यतीर्थतिलकं श्रीनाभिराजांगजं ।  
बंदेरवैतशैल मौलिमुकुटं श्रीनेमिनाथं यथा ॥  
तारंगेऽत्यजितं जिनं भृगुपुरे श्री सुवृतं स्तंभने ।  
श्रीपार्श्वं प्रणमामि सत्यनगरे श्रीवर्धमानं त्रिधा ॥ १ ॥

॥ श्री परमात्मने नमः ॥

# श्री तीर्थ वर्णन भक्तिभाषा.

---

## प्रथम अंड.

---

### प्रातःस्मरण.

सर्वारिष्टपणाशाय, सर्वभीष्टार्थद यिने ।  
सर्वलब्धिनिधानाय, गौतमस्त्रामिने नमः ॥

**आवार्थः**—सर्व प्रकारनां पापो अने विद्वेनो नाश करनार तथा सर्व प्रकारना भनोरया सिध्ध करनार अने सर्वे प्रकारनी लक्ष्येनाना भंडार समान श्री गौतम स्वामीने नमस्कार हो.

### भूमिका.

श्री सीभरण्णनी यात्रानु प्रथम पगथीड झारतक वड ११ वार सोअ ता० ६-१२-२० ने दीवसे अमलसाठी शह थतां, साडी अहावीस दीडीटो आंडेलानी भरीटी, जेनी अंदर डोयावावाला शा. डाढ्हाभाई जोवीडण्णनी

દીક્ટ સાડાપાંચ, તથા છાંધાપોરવાદા શા. રમાજ જેચંદ અને ગુલાખચંહ ભાણુજીની દીક્ટ એ, તથા અષ્ટગામવાદા શા. મંધુ ભાણુજીની દીક્ટ વણુ; મદ્વી દીક્ટ સાડાહશ. અમલસાડથી શા. ફૂરીચંહ લાલચંહની દીક્ટ નં. ૬, શા. હિરચંહ દુલચંહની દીક્ટ નં. ૮, આઈધનીની દીક્ટ રૂ તથા શા. કલ્યાણજ દુલભની દીક્ટ નં. ૩ મદ્વી કુલે દીક્ટ સાડીઅણાનીશ હતી. વતી નૈસારીથી શા. અણાલાઇ ખુખ્યચંહ નવાતલાવવાદાની દીક્ટ સાડાપાંચ અને શા. અમીચંહ ભગવાનજ નોગામાવવાદાની દીક્ટ ચાર મળી દીક્ટ સાડાનવ ખીજ સુરત સુધીમાં ઉમેરાઈ. અમલસાડથી આંકાલા સુધીનું ભાડું શા. ૫-૨-૦ થાય છે. સધળાએને સુરત પાંચ કલાક ઘોલનું પણ્યું હતું, કારણું સવારની ગાડી અમલસાડથી સાડાચાઢ વાગે ઉપડી સુરત અગીચાર વાગ્યે ઉતારે છે અને આંકાલા જવા માટે ડી. વી. લાઈનમાં સાંજે સાડાચાર વાગે ગાડી ઉપડે છે. ત્યાર પણી જેઓની સુરત સુધીની દીક્ટટા હતી તેઓની આંકાલાની દીક્ટ અરીદી લધી. સાંજે ગાડીના ડેરેને ભરતાં હમારા સધળાનો ઉષ્મો એક રીજર્વ કંપાર્ટમેન્ટ જેવો થછ રહ્યો હતો.

સાડાચાર વાગતે ગાડી ઉપડી ને વખતે હમારા કંપાર્ટમેન્ટમાં પાર્ચનાથ ભગવાનનો જય જ્યાકાર થતાં અવર ડામના ચહેરા ઉપર એક જાખ્રો ફેરફાર લાગતો હતો. એવીજ રીતે દરેક સ્ટેશને જ્યનાન થતાં ગાડી સાત વાગ્યે આરડોલી સ્ટેશન ઉપર આવી પહોંચી; જ્યાંથી ખીજ સાડાપંહ દીક્ટટાની ભરતી થઈ, જેની અંદર શા. નાનચંહ કષનાજીની દીક્ટ નં. ૪, શા. ચુનીલાલ પનાજીની દીક્ટ નં. ૨, શા. દુલમ ભુધરાજીની દીક્ટ નં. ૪૨ શા. તત્કચંહ માનાજીની દીક્ટ નં. ૩, તથા સરભાખુવાદા શા. પદમાજ નાથાજીની દીક્ટ નં. ૨, મદ્વી કુલે દીક્ટ નં. ૧૫॥ હતી.

ખંડી મદ્વી કુલે એકંદર સાડા ત્રેપન દીકાડો થતાં, એ સંધ દરેક જગ્યાએ “ સુરતનો સંધ તરીક ઓાદખાનો હોનો.” સંધની અંદર માણસો દરેક એક ખીજ સાથે સગપણુંનો સંઅંધ ધારવતા હતા, છતાં દરેક એક

બીજી તરફ એકસત્તા પ્રાપ્તિએ જેનાર હોવાને લીધે અવૈકિક આનંદ હેલાઈ રહેતો હતો.

### ભુસાવળ.

તા. ૭-૧૨-૨૦ ને દીવસે સવારે નવ વાગ્યે ભુસાવળ સ્ટેશને ઉત્તર્યા. આંડોલા સ્ટેશન, ગુ. આઠ. પી. રેલવેમાં હોવાને લીધે, ભુસાવળથી એ વાઈન પકડવી પડે છે; તેમ ટી. વી. રેલવેનું નાકું પણ ભુસાવળજ પુરં થાય છે. કોઈની ધર્મથા થાય તો જલગામથી પણ આંડોલા જઈ શકે છે, કારણું કી. વી. રેલવેના નાકેના એ સ્ટેશનો જલગામ, અને, ભુસાવળ, ગુ. આઠ. પી. રેલવેમાં પણ લાગે છે. હમારામાંથી કેટલાકેની ભુસાવળ જેવાની ઉલ્લંઘને લીધે હમો જલગામ ન ઉત્તરાં આગળનું બીજું સ્ટેશન ભુસાવળ ઉત્તર્યા.

ભુસાવળ હમારે ધાર્ષણ બોગવવું પડ્યું. જેકે સ્ટેશન ઉપર જથું મુસાફરાનું છે, પરંતુ તાં રસોઈ કરવાની સવડ ન હોવાથી, હમો એક આધુનિક ઉપર આવેલી “ મુલયંહ શેડ ( દીગમ્બર ) ની ધર્મશાળા ” માં ઉત્તર્યા; તાં આગાલ દરેક જણુંની સવડ પ્રમાણે રસોઈ કરી જમી પરવારી સાંને ચાર વાગ્યે પાણ સ્ટેશન ઉપર આવી પહોંચ્યા.

ભુસાવળમાં એવી કંઈ જણુંના જેવી બાયત નથી, પરંતુ એક દિગમ્બરી દહુરાસર છે. ગામ સાધારણ છે, તેમ ધર્મશાળામાં જેખાં તેવી સવડ નથી. ઇક્ઝ એક છપરાવાળું મુસાફરાના જેવું મજન છે.

આંડોલા જવા માટે જગગામથી જે તુરત કલાક, દોંડ કલાકે ગાડી અસે તો નીકલી જવું સાઝ છે. અગર ભુસાવળ જવું તો પણ તુરત પહેલી મળતી ગાડીમાં નીકલી જવું સુધડ પડ્યો, કારણું કે જનતાનુંચો વાસ્તે ભુસાવળ એવી કંઈ જેખાં તેવી સવડ નથી. હમો ભુસાવળથી સાંજરે સાડાપાંચ વાગે, મુંબથી ઉપડતી “ નાગપુર પેસેન્ટર ” ટ્રેનમાં એસી રાત્રે દર્શ વાગે આંડોલા ઉત્તર્યા.

## આંકોલા.

આંકોલા સ્ટેશનથી એક માઈલ ઉપર શ્વેતામૃતી ધર્મશાળા છે. અંદર આહેશ્વરણું દહેરાસરજ છે. વાસણું બીજાનાની ઘણી સારી સવડ છે. કુવો તથા પાયઘાનાઓ પણ ધર્મશાળામાં છે. સ્ટેશન ઉપરથી જવા માટે ટાંગાઓ મલે છે નેમાં તણું માણસો બેસાડે છે, તેમ મળુરો પણ મળે છે. શહેરની અંદર વસ્તીના પ્રમાણમાં અજાર ઘણું સારો છે, તેમ શાખ મારકેટ પણ છે. હર રવીવારે એક જાણરો મેળો ભરાય છે, તેમાં તાંયારીતળના વાસણો તેમ દેશી કાપડ વિગેર ઘણી સારી વસ્તુઓ મળે છે; આજુમાં એક જુનો પુરાણો ક્રીલ્સો છે, જેની ફરતી એક સુઝી નહેર છે અને એક તળાવ છે, નેમાંથી આખા શહેરને પાણી પહોંચાડવામાં આવે છે. કુવાઓ છે પરંતુ ખાર પાણીના છે.

હમોએ રાત્રે હશ વાગે ડંતરી સૌસોની સવડ પ્રમાણે ગાડાઓ તથા ટાંગાઓ ભાડે કરી ધર્મશાળામાં જઈ મુકામ નાંખ્યો. આગદા દીવસનો કંઈ ના સંધનો પડાવ હોવાથી સવડ નેમુંચે તેવી સારી મલી નહીં, કારણ કે તેમનામાં પણ લગભગ ૫૦ માણસોની ભરતી હતી. જત્તાજુએ જથારે હુદુ ઉપરાંત થઈ જય ત્યારે સ્વભાવીકર વસ્તુઓની ખામી નડે, પરતું એક દ્રષ્ટિ બિન્હુંચે નેછ પ્રમાણુની સરખામણી કરતાં ધર્મશાળામાં જત્તાજુએ માટે સોઈ ઘણી સારી છે.

હમારા વખતની વાત લખતાં, પાણીની ઘણી સખત તંગી હતી; ચાલુ વરસમાં તળાવમાં ઘણું યોડું પાણી હોવાથી ફેરફાર નણો ઉપર લોકોનો બહુ મારો હતો કારણ કે ચોનીસ કલાકમાં ફક્ત પાંચજ કલાક નણો ખુલ્લા મુક્કામાં આવતા હતા. વળી તેણો લાલ લઈ કેટલાક બદમાશ લોકો મારતોડ કરી નણોથી પાણી ભરી લઈ એક રીતના ઉપાય ઉપર રી. ૦-૩-૦ નો ભાવ રાખી વેચના હતા. કુવાઓ ઘણું ખરા સુડી હતા અને કદાચિત કોઈ કુવામાં

પાણી હેય તો તે મોળું અને મેળું રહેતું હતું. હોમે એક રાત લ્યાં પસાર કરી ( વિસામો લઈ ) ખીજે દીવસે બ્યોરે એ વગ્યે સીરપુરણ જવા ગાડે ગાડાંએ ભાડે કરી નીકળી ગમા.

### ( અંતરીક્ષ પાર્શ્વનાથ ) સિરપુરણ.

આંકોલાથી ૪૦ માધ્યિ ઉપર શારપુરણ કરી ગામ છે, જ્યાં આગણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાળ અંતરીક્ષ હોવાને લીધે દહેરાસર તેમ ગામ “ અંતરીક્ષ પાર્શ્વનાથ ” ને નામે ઓકાખાય છે. આંકોલાથી જવા ભાડે ગાડાએની તેમ લાલમાં મોટરની પણ સવડ મલે છે; મોટરનું ભાડું રી. ૩-૨-૦ નું રીડસ છે, પરંતુ મોટર શારપુરણથી ત્રણ માધ્યિ ઉપર “ ભાગેગામ ” કરી ગામ છે. ત્યાં સુધીજ જઈ શકે છે અને ત્યાંથી ગાડાએ ભાડે કરી જવું પડે છે. ગાડાએ એકજ રસ્તે આંકોલાથી હેઠ સીરપુરણ સુધી જઈ શકે છે. સીરપુરણ જતા આંકોલાથી ૨૦ માધ્યિ ઉપર “પાતુર ” કરી ગામ આવેછે ત્યાં આગત ગાડાએની મુસાફરીવાલાએને એક રાતનો સુકામ કરવો પડે છે. પાતુરમાં ચૈતામંસી ધર્મશાલા છે, અને અંદર એક મહાનીર સ્વામી ભગવાનનું દહેરાસરણ છે. સીધુસામાન ખાનગુમાં જ મસે છે. વાસણે ધર્મશાળામાં મલે છે, પરંતુ એછાનાનું સાધન રાખવામાં આવ્યું નથી. ગામ યોડે છેટે છે જ્યાં આગલ સરકારી ડિસ્પેન્સરી પણ છે.

પાતુર આવતા વચ્ચેમાં ચોકી આવે છે જ્યાં આગળ ભાતું ખાવાનો ધણે ભાગે રીવાજ છે કારણું એ ૪૦ માધ્યિની મુસાફરીમાં પાણી મલવું મુસ્કેલ થઈ પડે છે. ઇકાં આંકોલાથી દશ માધ્યિ ઉપર ચોકીએ, ત્યાંથી દશ માધ્યિ ઉપર પાતુરમાં, ત્યાંથી દશ માધ્યિ ઉપર “ મેડસી ” કરી ગામ આવે છે ત્યાં અને આપરે ભાગેગામ થઈ શારપુરણ. એકલીજ ગણેલી જગ્યાએ પાણી મલે છે; ભાડે જત્રાનુએને ખાસ કરી આ ખાઅત ક્ષયાનમાં રાખી જેગવાઈ પહેંદેથી કરી શેવી.

શ્રીરપુરજીમાં શૈતામ્યર તેમ હિગમ્બરો વાસ્તે કૃત એકજ પણ જરૂરી ધર્મશાળા છે. વાસણુ ખીભાના વિગેરે બણ્ણા સારા પ્રમાણમાં રહે છે. પાર્થ-નાથ ભગવાનનું દહેરાસર ધર્મશાલાની બાળુમાંજ આવેલું છે. જેની અંદર ભગવાનની પ્રતિમાળ અંતરીક્ષ છે; ઇથી જમણ્ણ ઢીચણુંનો અઉધા દીય નેટદો ભાગ જમીને અડેદો છે, અને પાછળ પીડ આગળ એટદોન ભાગ ભીતે અડેદો છે, પરંતુ તેને વાસ્તે કોકવાયક એવી છે કે ભગવાન ઉપરના ફણીધર ચોંટાડવા વાસ્તે લેપ મારવામાં આવ્યો છે તે ભીતે લાગ્યો છે. વહી એને વાસ્તે એવું કહેવાય છે કે “પ્રથમ એ મુર્તિની નીચેના ભાગમાંથી એક ધોડેસ્વાર ભાદા સાથે પસ્તાર થતો હતો. દહેરાસરજીની અંદર જવા માટે ખારજું નથી, પરંતુ એક નાની ખારી છે. ભગવાન ભોંયરાની અંદર ખીરાજ-માન છે. દહેરાસરની અંદર પેસતાં, પ્રથમ શૈતામ્યરની ઓઝીસ, બાળુમાં હિગમ્બરની ઓઝીસ, અને સામે નાની ખારી ઓળંગી સાંકડી સીડીથી ઉત્તરી ભોંયરાના ગર્ભદારમાં જઈ શકાય છે.

અહીંચા ભગવાનની પણાલપુન વાસ્તે ત્રણ ત્રણ કલાકના વારા કરવામાં આવ્યા છે; એટલે એક દીવસ સવારે ૬ વાગ્યાથી હ સુધી હિગમ્બર અને હ થી ૧૨ સુધી શૈતામ્યર, ભીજે હિવસે પ્રથમ હ થી હ શૈતામ્યર તો હ થી ૧૨ હિગમ્બર એમ છેક સાંજ સુધી ત્રણ ત્રણ કલાક દર્શન પૂંજનો લાભ લઈ શકાય છે. હિગમ્બરની પૂંજ વખતે ચક્ષુઓ કાઢી નાંખવામાં આવે છે; કુરેથી કંદેરો પ્રથમથી કાઢી નાંખવામાં આવ્યો છે. વળી તે ઉપરાત નવાધની ખાયત એ છે કે શૈતામ્યર અને હિગમ્બરો વચ્ચે ધર્મ સંબંધી ઝગડો ચાલે છે; કેસ કોરટે ચલ્યાને બાર વરસ થઈ ગયા અને હજ એટલો ટાઈમિ જય તેમ કેટલા પૈભાની ખરાખી થાય તે કંઈ શકાય નહીં. ગામતી અંદર હુકનો તેમ સીદું સામાન સારી રીને ભળી શકે છે. વર્ષીમાં ૫૦) ધરો હિગમ્બરોના, યોડા શૈતામ્યરોના અને ખાડીની અવર ન્યાત વસે છે. ગામતે નકે એક નાનો સરખો અગીયો છે જેમાં પર્થીનાથ ભગવાનના ચર્ચાનું એક દહેરાસરજી છે.

તા. ૮-૧૨-૨૦ ને દીવસે સીરપુરજી જવા માટે હમોએ પ્રત્યેક ગાડા હીડ શ. ૧૨) આપવાના કરી ૧૧ ગાડાઓ ભાડે કરી અપેરે એ વાગે નીકલી, રાતે ૧૧ વાગે પાતુરમાં આવી રાત રહીને ખીને દીવસે તા. ૫ ને દીવસે અપેરે જભી, ત્યાંથી નીકલી રાતે સાડાદસ વાગે શીરપુરજી ( અંતરીક્ષ પાર્વતિનાથ ) આવી પહોંચ્યાં. તા. ૧૦ નો દીવસ ત્યાં રહી તા. ૧૧-૧૨-૨૦ ને દીવસે જમીને અપેરે એ વાગે આંડોલા જવા માટે નીકળી ગયા. તા. ૧૨ ને દીવસે રાતે લગભગ દ્વારે શુભારે આંડોલા આવી પહોંચ્યા. સર સામાન આંડોલા ધર્મશાળામાં મુકવાની સવડ છે. નીકળતી વખતે આંડોલાના સંધ્ય તરફથી ભાતું વહેંચવામાં આવ્યું હતું. પહોલા ગાડાઓ રાતે હંકાતા હતા પણ હાલ દીવસેજ હોકવાનો રીવાજ છે. વલી સીરપુરજીની ધર્મશાળામાં નહાવા ધોવાનું તેમ પીવાનું પાણી, દિગમ્બર અને શૈતાભારોને 'શુદ્ધ' પહોંચાડવામાં આવે છે, નેતે વાસ્તે નોકરો પણ જુદા જુદા રાખવામાં આવ્યા છે. અહીંથી તા. ૧૦-૧૨-૨૦ ને દીવસે અમલસાડવાદી શા. ઇકીરચંદ લાલચંદ તરફથી દોણી કરવામાં આવી હતી; અને આંડોલાથી આવતી વખતે પાતુરનો તા. ૮-૧૨-૨૦ નો જમણુવારનો ખરચ, તેમ સીરપુરજીનો તા. ૧૧-૧૨-૨૦ નો અને વળતી વખતે પાતુરનો તા. ૧૨ નો ખરચ મલી કુલે શ. ૪૧-૪-૦ થથો હતો, ને સંધ્યો ખરચ શા. દુલલ જુદરજી કહેલીઆવવા તરફથી આપવામાં આવ્યો હતો.

તા. ૫.—નેણો સીરપુરજીથી મોટરમા આવવા માંગતા હોય તો તેણોએ ત્યાંથી ગાડામાં સવારે અગોઆર વાગ્યા સુંદીમાં માલેગામ આવી રહેવું, અને માલેગામમાં શેડ મહિમદ તુરમહિમદ કરીને છે તેમને મલવું, કારણું કે ત્યાં ખાતે ઇકત તેમનીજ પાસે મોટર છે; બીજુ મોટરો બાળુમાં ૬ માછલિ ઉપર બાસીમ કરી ગામ છે, ત્યાંથી આવે છે; તો પેસેન્જરોની ભરતી થઈ ગઈ હોય તો માલેગામમાં જગ્યા મંકી શકતી નથી. માટે નેમ બને તેમ ત્યાં જલદી આવી મહિમદ શેઠને ખરચ આપી હેઠી. આંડોલાથી આવવા માટે ધર્મશાળાના મુનીમ તરફથી સવડ કરી આપવામાં આવે છે.

## શ્રી તીર્થ વર્ણન લક્ષ્મિમાળા.

તા. ૧૩-૧૨-૨૦ ને દીવસે આંડાલાથી નાગપુર જવા માટે રાતની ગાડીએ એસી સવારે તા. ૧૪-૧૨-૨૦ ને દીવસે સાડાસાત વાગ્યે નાગપુર સ્ટેશને આવી પહોંચ્યા. ભાડું રા. ૨-૮-૦

### નાગપુર.

સ્ટેશનથી ધર્મશાળા એક માહિલ ઉપર આહિતવારી પેંડમાં આવેલી છે. સેશન ઉપર ટાંગાએં, ગાડાએં વીજેરે મલે છે. ધર્મશાળામાં બીજુ કોઈપણ રીતની સવાર નથી, ફક્ત ચોકમાં નળ છે. ધર્મશાળાની બાળુમાંન 'ઓયાંસનાથ મહારાજ' તું પંચાયતી દહેરાસરજી છે; અંદર એક નાની દહેરીમાં મહાવીરસ્વામીની રલની પ્રતિમાજી છે, તેમ બાળુમાં ચામુખજીની પ્રતિમાજી છે. અંદર જતાં પગથીઆ ઉપર તેમ મંદિરમાં જુના વખતના રીક્ઝાએ ચોડવામાં આવ્યા છે. દહેરાસરજીમાં નહાવા ધોવાની, તેમ પૂજના કપડાં વીજેરેની સારી સોઈ છે. ધર્મશાળાથી યોડે દૂર બીજું એક આહેશ્વર ભગવાનનું દહેરાસરજી છે.

શહેર મહોદું વસ્તીવાનું તેમ દેક વસ્તુઓથી ભરપુર છે. શહેરની અંદર નથું ચાર મીટ્સ પણ છે, તેમ કોઠર પણ નાગપુરમાંન એસે છે. સેશનથી નથું માધ્યમ ઉપર એક "મુદ્રાયિમ" છે તેને અદીયાના લોકો "અહસુત ખાગ" કરીને કહે છે; નેમાં ધણાખરા દેશની કારીગીરીએં, ધર્થીયારે, કાપડ વીજેરે ધણી વસ્તુઓનો સંબંધ છીએ છે. તે ઉપરાંત ખાલાણ કુદુંઅનો જન્મથી મરણ પર્યાંતની કુંઘાનો આખેલું ચીતાર આયો છે; વકી મરેલા જનતરો સાથે જીવતાં દેક જતના જેરી સાચો, અજગર, ભગર વિગેરે સંબંધસ્થાનમાં છે.

આગામી દશ મીનીટ નેટ્લો રસ્તો કાપતાં "મહારાજ ખાગ" કરીને આવે છે. નેની અંદર રાજ સાહેભનો અંગદો છે; સામે ધણી ખરી જતના આડો, વેવાએ વીજેરે એક મહોદું જગતજસ્ત અગીયાના ઇપમાં રાખવામાં

## શ્રી તીર્થ વર્ણન ભક્તિભાગો.

૬

આવ્યા છે. અંદર ટેરડેર રસ્તાએ નલો ઉપરંત, સીઁફ, વાધ, કરણ, વાંદરા, વીગેરે જીવતા જનવરોનું સંબેદરસ્થાન છે. વલી અહીંચા આગલ કાપડની માત્રા પણ જેવા લાયક છે, શહેરની અંદર “મોટર સપ્લાઈ કુંઠ” તરફથી ત્રણ મોટરો રાખવામાં આવી છે, જેની અંદર દરેક જગ્યાએ જઈ શકાય છે. મોટરમાં મોટી મોટર લોડી ૪૦ પેસેન્જરો લઈ રહે છે.

તા. ૧૪-૧૨-૨૦ નો દિવસ શહેરમાં ઇરી હરી તા. ૧૫ ને દીવસે મહુષુર ( ગીરીડી ) જવાને વાસ્તે સાંજે ૬ વાગ્યાની ગાડીએ નીકલ્યા. અખંડ એ દીવસની મુસાફરી કરી તા. ૧૭ માની રાતે મહુષુર થછ ગીરીડી એ વાગ્યે આવી પહોંચ્યા. ગાડીએ ચાર જગ્યાએ બદલવી પડે છે; નાગપુરથી ચક્રધરસુર, અને તાંથી આસનસોલ જંકશન, અને અહીંથી મહુષુર થછ ગીરીડી. દરેક જગ્યાએ કલાક હોટ કલાકને આંતરે તુરત ગાડીએ મલે છે. ગીરીડી સખત થાય છે, પણ ગાડીએ દરેક જંકશનેથી ઉપડતી હોવાથી અગાઉથી સવડ કરવી પડતી હતી. ચક્રધરસુરથી આસનસોલ જંકશન સુંદીમાં વચ્ચાં “ તુરેલીઓ ” કરી સ્ટેશન આવે છે, જ્યાં આગલ કોખંડના હથીઓરે ઘણા સારા મલે છે. નાગપુરથી ચક્રધરસુર થઈ જતાં વચ્ચાં “ રાયપુર ” આવે છે, હમે ત્યાં ઉત્તર્યા ન હતાં.

### રાયપુર.

નાગપુરથી રાયપુર ૧૮૮ માછલિ છે. અનેથીજ ‘ ઐંગાલ નાગપુર ’ રેલવેની લાધનિ શરૂ થાય છે. ધર્મશાળા સ્ટેશનની સામે છે, અને સરકારી છે, જેમાં ૫૦૦ માણસો સમાય એવી સવડ છે. સ્ટેશનથી ગામ ના માછલિ છે, અને ત્યાં ત્રણ દહેરાસર છે જેની વીગત:—

( ૧ ) દાઢાવાનીમાં શ્રી પાર્થનાથ ભગવાનનું દહેરાસર છે, જેઠે મહોયી ધર્મશાળા છે. ( ૨ ) સહર બજરમાં શ્રી રીખવહેવસ્વામીનું મોટું દહેરાસર છે,

ખાનુમાં શ્રી ચંપ્રલુનો અને શ્રી શાંતીનાભનો એમ મળો એ ગભારા છે. (૩) સદર અનન્તરમાં શ્રી ચંપ્રલુનું દહેરાસર છે. અહીંથાથી ગીરીડી જવાને વાસ્તે આસનસેવાથી દસ્ત દંડિયા ગાડી બહુવી પડે છે.

### ગીરીડી.

ધર્મશાળા ( શૈતાભ્યર ) સ્ટેશનની સામેજ નણું મીનીએ કેટલે રસ્તે છે નેમાં લગભગ ૫૦૦ માણુસો સમાધ શકે છે કારખાનું ચંદ્રલ છે; વાસણું બીજાના વીજેરેની સેઈ ધણી સારી છે, અને ધર્મશાળામાં ઓરડાઓ છે. શહેર સાધારણ છે, જોઈતો સામાન શહેરમાં મળો આવે છે. દુકાનો છુટક છુટક છે; એક જગ્યાએ અનન્તરાના ઇપમાં નથી. દર રીતારે મેળો ભરાય છે. નેમાં કોઅંડના હથીયાર વીજેરે સામાન સારો મળે છે. વલી અહીંથાથી થોડે છેટે ડોયલાની ખાણો છે, હરદે પણ અહીં સારી ઉત્તમ મળે છે. ધર્મશાળાની ખાનુમાં શ્રી પાર્શ્વનાથ લગવાનનું દહેરાસર છે. અહીંથાથી ‘મધુભન’ ( શીખરણ ) જવા આટે ગાડાઓ તથા હાલમાં મોટર પણ મળે છે, જેની સવડ કારખાનાવાલા તરફથી કરી આપવામાં આવે છે. મોટરનું ભાડું પ્રત્યેક માણુસ દીડ રા. ૨-૦-૦ નું રીકસ છે.

હોએ તા. ૧૮-૧૨-૨૦ ને દીવસે ઉધા મોટર ભાડે કરી તા. ૧૯ મી ની સાંજ સુધી મધુભનમાં આવી પહોંચ્યા.

### “ મધુભન ”

અહીંથાં ધર્મશાળા નણું છે. ગીરીડીથી આવતાં પહેલાં તેરાપંથી હિગ્ઝરની, વચ્ચમાં શૈતાભ્યરની, અને પછીથી ડુપ્લેલાગે વિશાપંથી. હિગ્ઝરોમાં એ ભાગ રાખવામાં આવ્યાછે; નેચો ફેસર, ફૂલની પૂજન કરે તે વિશાપંથી અને નેચો ફેસે પૂજન કરે છે તે તેરાપંથી હિગ્ઝર કહેવાય છે.

હિગમ્બરી ધર્મશાળાની અંદર દહેરાસરળમાં શિક્કાઓ પાથરવામાં આવ્યા છે. તેમ બગીચાઓ, કુલા વીગેરેનું પણ સારં સાધન રાખ્યું છે. શૈતાભ્રરી ધર્મશાળાની અંદર હજારથી પંદરસો માણુસો સમાઈ શકે એવી મોટી સવડ છે, અને ઓરડાઓ પાડવામાં આવ્યા છે. પાછળના ભાગમાં બગીચો છે, ઉપરાંત ધર્મશાળાનો બીજો ભાગ છે જ્યાં પણ દૂરતા ઓરડાઓ રાખવામાં આવ્યા છે. બાળુમાં કારખાનાની ચેક્ટીસ છે; સામેના ભાગમાં એક વિશાળ કંપાઉન્ડમાં દહેરાસરળ છે. ધર્મશાળાની અંદર એ કુલાઓ છે; તેમ ન્હાવા ઘેવાની ધર્થીનું ઉત્તમ સોધ રાખવામાં આવી છે. વલી ૫૦૦ ઉપરાંત માણુસો જામી શકે એવી પણ ધર્મશાળાની બાળુમાં સોઈ રાખી છે. વાસણું બીજાના વીગેરે ધર્થી સારા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. ધર્મશાળાની પાછળના ભાગમાં એક નાનો સરફો બજાર આવ્યો છે. નેમાં બોધ્યતા સામાન મળી આવે છે. દરડે સારી અને સસ્તી મળી આવે છે, ઉપરાંત વનસ્પતીની ઇવાઓ પણ ધૂઢુક ધૂઢુક વેચાવા આવે છે.

અહીંચાની ધર્મશાળાઓ વિગેરેનું વર્ણન કરતાં પાનાના પાનાઓ ભરાય, પરંતુ કુઠામાં એટલું લખવું યોગ્ય છે, કે જતાળુંઓ વાસ્તે દરેક રીતની સોધ છે, ઉપરાંત કુદરતી તેમ માનસીક શક્તિથી બનાવેલી બીજેની અંદર કોઈ ખામી કાઢી શકે એવું નથી. ગામ ધર્થું નાનું હોવા છતાં જણે ધર્મશાળાનો હેખાવ, એક શહેરના ઇપમાં જણાય છે. વરદોડાની દરેક રીતની સામયો, નેવી કે, રથ, હાથી બોડા વીગેરે રાખવામાં આવી છે. વાળું ગીરીઠીથી એલાવવામાં આવે છે. નેચો વાળનું સહિત જળજાતનો વરદોડા કાઢવા માંગતા હોય તેમને રી. ૮૧) નકરો આપવા પડે છે; વાળનું શીવાય રી. ૮૨) નો નકરો થાગ છે. દરેક ધર્મશાળામાં જતાળુંઓનો પડાવ ધર્થે લાગે અસોથી અદીસો માણુસોનો રહે છે. અહીંચાથી એક માર્છિને આંતરે એક નદી આવેલી છે, વળી ગરીબ લોકોના ટોલેટોણાં જતાળુંઓ પાછળ ફર્યા કરે છે. અનેથી શ્રીમદ્ભુજ પહ્લાડ ઉપર જવાને હોળાઓ મદે છે, તેના

શ. ૩-૮-૦ બેઠે. ડોણિની સવડ કારખાનામંના જણાવ્યાથી કરી આપવામાં આવે છે.

### “ શ્રીભરુ પહોડ ”

મધુયતનની ધર્મશાળાથીજ પહોડની શરચાત થાય છે. તણેરી અહીંથાથી ત્રણુ માધ્યલ છેટે છે, તાં આગલ ભાતું આપવામાં આવે છે. તાં આગળ એક પાણુની વહેણો છે. ત્યાંથી ૦॥ માધ્યલ છેટે એ રસ્તાઓ આવે છે. એક રસ્તેથી જળમંદીર, અને બીજે રસ્તેથી નવદુકે જવાય છે. જળમંદીરે જવા વાસ્તે અહીં સુંધરી પાકી સર્ડક છે, પછી કાચી સર્ડક આવે છે. આગળ જતાં સીતા નાડુ આવે છે, ત્યાંથી થોડે સુંધરી પગથીચાંદો શર થાય છે. પછીથી રસ્તો સાધારણ કહણુ આવે છે. ઉપર ચદ્યા એકદે જોતમ સ્વામીની દહેરી આવે છે, અહીં આગલ એક ચોકી ઐસે છે. ત્યાંથી જળમંદીર આગળ દાદાજ શાગળીઝા પાર્શ્વનાથનું દહેરં છે. બાળુમાં યાદી પાણુની ધોધ છે નહાવાની જેગલાધ સારી છે. ડોળીએ જનારને દાદાજના દહેરાંએ તથા ચોવાસે દુંક ફેરવે છે.

મધુયતનથી ચોવાસે દુંક જવાને આ માધ્યલિપર એ રસ્તા આવે છે. પણ પાકી સર્ડક છે તે રસ્તે જવું, ઉપર જતાં બીજા દુંકા રસ્તા આવે છે, જેથી રસ્તો સહેલથી એઢો થાય છે. આ માધ્યલિને છેટે એક બંગદો આવે છે, જ્યાંથી સર્ડક બંધ થાય છે. એવું કહેવાય છે કે અતે ચરણીનું કારખાનું કાઢવાનું હતું, પણ રાય બદ્ધિહાસ બાયુએ યોગ્ય પગલાં ભરી તે બંધ કરાવ્યું ત્યાં આગલ પદ્ધતરમાં ડેતરેલી નોટીસ છે. ત્યાંથી શ્રી પાર્શ્વનાથની દુંકે જવાનો રસ્તો આવે છે. ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં કેવળજ્ઞાનનાં પગલાંની દહેરી છે, તે ચદ્યાને ૮૪ પગથીઓ છે. ઉપર સાધારણ ધૂમસ પડે છે. ઉત્તરતાં જમણીઝાનુંએ (૨) શ્રીનેમનાથજ્ઞની દહેરી છે. આગળ થોડે છેટે (૩) શ્રી અશ્રતનાથની દહેરી છે. ત્યાંથી નીચે ઉત્તરસું પડે છે. ત્યાંથી પાછા

ચદ્યા એટલે ( ૪ ) શ્રી વિમળનાથની દહેરી છે, તેની સામે ( ૫ ) શ્રી સુપાંખનાથની દહેરી છે, ( ૬ ) શ્રી મહાવીરસ્વામીની દહેરી છે, ( ૭ ) શ્રી શાતીનાથની દહેરી છે, ( ૮ ) શ્રી સુમત્રિનાથની દહેરી, ( ૯ ) શ્રી ધર્મનાથની દહેરી ( ૧૦ ) શ્રી જૈતમ સ્વામીની દહેરી છે, ત્યાંથી જળ મહિરે જવાયછે. આકીની કુડે જેને ખીજે હીવસે જરું હોય તે નીચે ઉત્તરી જાય છે. શ્રીજી-તમસ્વામીની દહેરી સામે ( ૧૧ ) શ્રી કુંયુનાથની દહેરી છે. ( ૧૨ ) શ્રી નેમનાથની, ( ૧૩ ) શ્રી અસનાથની દહેરી છે. પણ યોડે આગળ થઈ ઉપર ચદ્યું પડે છે. ( ૧૪ ) શ્રી મહિનાથની દહેરી છે. ( ૧૫ ) શ્રી અયંસ-નાથની ( ૧૬ ) શ્રી સુવિધિનાથની દહેરી આવે છે. ( ૧૭ ) શ્રી પદ્મપ્રભુની તથા ( ૧૮ ) શ્રી મુનિસુવન સ્વામીની દહેરી આવે છે. ત્યાંથી નીચાખુંાં આગળ જતાં એ રસ્તાઓ આવે છે, એક રસ્તેથી શ્રી ચંદ્રપ્રભુની દહેરીએ જવાય છે, તાં જતાં નીચે ઉત્તરું પડે છે, અને પાછું ચદ્યા પણી ( ૧૯ ) શ્રી ચંદ્રપ્રભુની દહેરી છે. તાં દરશન કરી આવ્યા. તે રસ્તે પાછું જઈ આગળ ( ૨૦ ) શ્રી આહિનાથની દેરી આવે છે, ( ૨૧ ) ટેકરી ઉપર શ્રી શીતલનાથની, ( ૨૨ ) શ્રી સંભવનાથની દેરી આવેછે. ટેકરી નીચે ઉત્તર્યા એટલે ( ૨૩ ) શ્રી વાસુપુજ્યની દહેરી છે, અને ત્યાંથી ઉપર ( ૨૪ ) શ્રી અભિનંદનની દહેરી છે. ત્યાંથી દર્શન કરી જળ મહિરે આવતું. આ પવિત્ર પહાર ઉપર શ્રી આહીશ્વર, વાસુદેવ, નેમિનાથ, અને શ્રી મહાવીર સ્વામી શીવામનાં ૨૦ તિર્થાંકરો હજરો મુનીઓની સાથે સિદ્ધિપદ્ધતે વર્ણા છે. વળી સાગર ચક્રવર્તી છ ખંડની રાજ્યસિદ્ધિ છોડી સંપ્રાણંધ પરિવાર સાથે આજ સ્થળે માસે ગયા છે.

ગીરીડીથી મહુયન જતાં પાંચ ક્રોશ ઉપર બારકડ કરી ગામ આવે છે. તાં દહેરાસર તથા ધર્મશાળા છે. અડીં મહાવીરસ્વામી ભગવાનને કેવળજાન ઉપન્યું હતું આ બારકડ જામને કહે “ રિન્જુ વાલિકા ” નહીં ( બારકડ નહીં ) વહે છે, તે ઉત્તરીને સર્વક રસ્તે મહુયન જતું.

મહુવનમાં હતો તા. ૨૦-૧૨-૨૦ થી તા. ૨૮-૧૨-૨૦ સુધી રહ્યા, હિસે ધણુજ આનંદમાં પસાર થતા હતા. હમારામાંથી કેરવાડોએ આડ, ધણુભરાએ સાત, છ, પાંચ, એવી રીતે જગતો લાભ લીધો હતો, પરંતુ સંઘમાંથી જૈથી વધારે પગે ચાવીને શીખરજીની જગતો લાભ કર્યેલીએ વાકા શા. ઉમા લખાળને વધે છે. તા. ૨૨-૧૨-૨૦ માગશર શુદ્ધ ૧૨ ને યુધવારે શા. હૃદાચંહ હુલાચંહ અમલસાડવાકા તરફથી સંધ કરવામાં આવ્યો હતો. તા. ૨૩મીએ કાચેલીએ વાકા શા. કસ્તુરચંહ લુધરજી તરફથી શા હુલબજી લુધરજી તથા બીજન એ નણ જણ મળીને સંધ કર્યો હતો તા. ૨૪મીએ પણ અમલસાડવાકા શા. કૃકીરચંહ લાલચંહ તથા મહુવાવાકા શા. મંજુ જવેર વિગેરે તરફથી સંધ કરવામાં આવ્યો હતો. તા. ૨૬મી માગશર વહ ૧ ને દીવસે મહુવાવાકા શા. મંજુ જવેર તથા લુધર યુશાલજીની ધણીયાણી બાઇ જમના તરફથી છા. ૮૧ નો નકરો ભરી જળજનતો વરદો કાટવામાં આવ્યો હતો. તથા કાચેલીયાવાકા શા. હુલબજી લુધરજી તરફથી સંધ કરવામાં આવ્યો હતો. અને તા. ૨૭મીને દીવસે નવા તલાવ વાકા શા. ડાઢ્યાલાદુધ યુઅચંહ વિગેરોએ તરફથી સંધ હતો. તે ઉપરાંત ગરીબોને અનાજ, ચણા વિગેરે સંઘમાંથી રીપ કરી વહેંચવામાં આવ્યું હતું. હણેરસરજીમાં પૂજન વિગેરે શેનનું ચાલતું હતું. અદીએ ધીનો ભાવ છા. ૧૬ નો રાખવાયાં આવ્યો છે. સાંજે આરતીએ એ થતી હતી, એક આરતી તથા મંગલદીનો અદીએ, તથા બીજી આરતી, મંગલદીવો. શીખરજીના થતા હતા. વહી અદીએ ધોણીએની સવા પણ સારી છે, કપડાં ચોતીશ કલાકમાં આવી જાય છે. તા. ૨૮ માને હિસે અમે કલકતા જવા આડે “ધસરી” સ્ટેશન સુધીના ગાડાંએ ભાડે કરી સચારે નિકલી અપોરે એ વાગ્યાને સુમારે છસરી સ્ટેશન કિધર આવી પહોંચ્યા.

મહુઅનથી “ધસરી” સ્ટેશન ૧૪ માટ્લિ થાય છે. સ્ટેશન ધણું નાતું છે. ગાડીઓ ક્રિત પાંચ મહિની થોલે છે. સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નથી; તેમ શૈનામરી ધર્મશાળ પણ નથી. ગામ નાતું સરાયું છે. સાંજે ૩ વાદ્યાની

ગાડીએ એરી બીજે દીવસે તા. તા. ૨૮ મીન્દે સવારે ૫ વાગ્યે ( કલકત્તા )  
 “ હાઉરા સ્ટેશન ” ઉત્તર્યા. ધસરીથી કલકત્તાનું ભાડું રૂ. ૩-૧-૦.  
 ગાડીએ આગલથી ઉપરી આવે છે, મારે જન્મિઓએ બને તાં સુધી  
 અગાઉથી સવઠ કરી લેવી.

### કલકત્તા.

હુગલી નહીને કીનારે મહેદું જયરાજસ્ત ઘેણોળી વસ્તીવાળું શહેર છે;  
 દ્વામે, ગાડીએ, વીગેરેની ચોનિસે કલાક પુષ્કળ ધમાલ રહેછે. મહોટા રસ્તાએ  
 ઉપર દ્રામ હોડે છે. અને ચેન્ન રીકોટા પણ મલી શકે છે. શહેર ધણું  
 મહેદું છે પરંતુ વેપાર રોજગારને વાસ્તે મુંબઈ નેટ્રોની જહોનલાલી નથી.  
 અહીંથા રેશમી ઉત્તરાસણ જેને તાંના લેણી “ હવા ચાદર ” કહેછે તે  
 ખાડું સારા મદ્દે છે, ઉપરાંત જીણા ધોતી જેણા, ખમીસો વીગેરે વખણું છે.  
 શૈતામ્યરી ધર્મશાળા એ છે; એક લગભગ હોઢ માધ્યમ ઉપર “ દ્યામા આધુ ”  
 ની ગડીમાં ત્યા બીજી ધર્મશાળા સ્ટેશનથી આસરે ત્રણ માર્દિલ ઉપર  
 “ દાદાવાડીમાં ” આવેલી છે, જ્યાં ૧૦૦ માણુસો સમાચ શકે એટલી જગ્યા  
 છે. વાસણું બીજાના વીગેરે સાધારણ અને ધર્મશાળામાં મલી આવે છે.

સ્યામાઆધુની ગડીમાં ધર્મશાળાથી થોડે દૂર “ શાંતિનાથ ” મહારાજનું  
 દહેરાસર ધણું રમણીય છે. કામ ધણુંખરું આરસના ટાઇટસ્થી લખિયું  
 છે. વર્તાલા સ્ટીટમાં ( ૨ ) માધ્યમલાલ હુગનું બંધાવેલું ધર દહેરાસર છે;  
 મુણનાયકજી પ્રતિમાજી સુમરીનાથ મહારાજની છે. ધર નં ૪૧, ( ૩ ) શેડ  
 પુનાલાલ હીસલાલના ધરની અંહુંધર દહેરાસરજી છે. ( ૪ ) રાય અદ્રીદાસ  
 બાસુને બંધાવેલું ધર દહેરાસર છે, મુણનાયકજી શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી  
 છે. ગલારાનો ભાગ કાચથી જડવામાં આવ્યો છે. તો. રાય અદ્રીદાસ બાસુ,  
 દૂરીસનરોડ બજી અજનર, ધર નં. ૫૨. શહેરથી થોડે છેટે દાદાવાડીમાં ( ૫ )  
 રાય અદ્રીદાસ બાસુને બંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. બાંધકામ ધણું  
 ખરું કાચથીજી લેખામાં આવ્યું છે. કલકત્તામાં આસ જેવા લાયક છે. ( ૬ )

ઉપરા દહેરાસરની આગુમાંજ એક દહેરાસર છે જેમાં યુદ્ધફન્ટાં પગડાં છે. વરી નજીદીક બાંધેદો એક કુંડ છે, તેમ અગીચામાં હોવાથી ડેરેડેર ચાવવાના પાથ અનાવવામાં આવ્યા છે. (૭) શેડ સુખવાલ જરેરીનું બંધાવેનું મહાતીરસ્થાનનું દહેરાસર છે. (૮) શેડ ભુરાણાયુનું બંધાવેનું ચંદ્રપ્રમુનું દહેરાસર છે. વધુંથાં જણાવવાનું કે દાદાવાિમાં ને ચાર દહેરાસરો છે. તે ખાસ જેવા લાયક, ઉત્તમ કારીગારીથી ભરપૂર છે.

(૧) સ્થામાયાઈની ગદીથી લગભગ ૧૦ મીનીટ નેટલે રસ્તે “ રાજેન્દ્ર મલુક આગ ” જેવા લાયક છે; જેની અંદર એક સુશોભીત ઇન્ફિન્ચરેશી શણુગારેદો બંગદો છે. વદી અગીચામાં જોડો ઉપરાંત જીવતા જનવરોનું સંઅઙ્ગસ્થાન કરેનું છે, વદી અંદર શાખરણનો નાનો સરખો પણડ અનાવવામાં આવ્યો છે. (૨) એક ખીને અગીચો ને શહેરથી લગભગ એ માછિ છેટે છે, જેનું નામ “ ચીડીઅયાખાનું ” આપવામાં આવ્યું છે; જેની અંદર પણ જોડો જીવતા જનવરો ધણુ પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. યુદ્ધ અને શુકરસ વારે બંધ હોય છે. તેમ અંગેજ લોકના તહેવારોને દીવસે હ. (૩) શી લેવામાં આવે છે. આડે હિસે રા. ૦-૧-૦ બેઝે. દ્રામમાં પણ જઈ શકાય છે. (૪) “ કાળિકા માતાનું મંદીર ” પણ પૂજનીય ગણણાય છે. (૫) ઓઠની હાઉસ, (૬) ગવર્નમેન્ટ લેવી વાગેરે જેવાને આટે વખણાય છે. કલકત્તાને જુદી જુદી લાઈનિના જંકશન એ કાગે છે. એગોલ નાગપુર રેલેનું જંકશન “ હાઉસ સ્ટેશન ” અને પસ્ટર્ન એગોલ રેલેનું જંકશન ” સીઆદ્દા સ્ટેશન ” કહેવાય છે. અને જંકશનોની વચ્ચે ઇકાં હુગદી નરી આવેદી છે.

અહીંથા તા. ૨૬, તા. ૩૦ તા. ૩૧ તથા તા. ૧-૧-૨૨ નો દીવસ મગી દીન ૪ રહી તા. ૨ જુ એ સવારે આડ વાગ્યાની ગાડીએ હાઉસ સ્ટેશનથી એસી અજુમગંજ ચાર વાગ્યે ઉત્તર્યી.

અજુમગંજ.

“ અજુમગંજ ” ના એ સ્ટેશન છે; “ અજુમગંજ જંકશન ” અને “ અજુમગંજ સીડી ” હાઉસ સ્ટેશનથી છસ્ટ છન્દીઓ રેલવેલાં પ્રેટ્ટેર્ન ઉપરથી એસી જવાળુંઓએ “ જંકશન ” ન ઉત્તરતાં, બીજું સ્ટેશન “ સીડી ” એ ઉત્તરથી, વહી કલકત્તાનું બીજું સ્ટેશન ને “ સીઅલડા ” છસ્ટન્ન એંગાંસ રેલવેનું છે, ત્યાંથી પણ અજુમગંજથી સામે કીનારે એ માધ્યમ ઉપર “ ગુલાગંજ ” કરીને સ્ટેશને ઉત્તરી જઈ શકાય છે. પહેલાં કરતાં બીજે રસ્તે જનારને ભાડું યોડું થાય છે પણ અડચણું વનું વેહવી પડે છે. મારે વધારે માણસો હોય તો હાઉસ સ્ટેશનથી જવું સાછે.

અજુમગંજમાં ધર્મશાળા એક છે, પરંતુ મહુદી બસો માણસો ખુશીથી રહી શકે એવી “ અજુમગંજ સીડી ” સ્ટેશનની સાંમેજ છે. વાસણું બીજાના વીજેરેની પણ ધર્મશાળા સારી સેઈ છે. રાય ઘણાદુર બુદ્ધિસીંગલુંના બંધાવેલી ધર્મશાળા છે; સામે શાકભાજ રીતું સામાન વીજેરે બિંદું મલી શકે છે. આજુમગંજ “ ગંગા નદી ” ને પ્રવાહ વલ્લા જાય છે, જગ્યા ધર્મશીજ રમણીય લાગે છે. વહી અહીંએ “ રાજ વિજયસીંગજી ” ધર્મશાળાથી થાકે હર રહે છે, નેચો ન્યાતે “ વિસાશ્રીમાળી આવક ” છે અને જૈનોની ઉત્તમ લાગણી ધરાવનારા છે. એવણું સાહેખનો અંગસો ગંગા નદીને કીનારે સુશોભિત ફરીચીરેથી સણુગારેદો જેવા નેવો છે. અહીંએના દહેરાસરનું વર્ણન;—( ૧ ) શાન્તિનાથ મહારાજનું દહેરાસર ધર્મશાળાની નજીદીક “ આયુ હરખચંદ જોવેચા ” નું બંધાવેનું છે. સુળનાયકજીની પ્રતિમાણ “ કસેડીની ” છે; વહી રલ, લીલામ, માણેક, વીજેરેની પણ પ્રતિમાણ છે, નેમાં રલની ૨૭ મુર્તિઓ છે. ( ૨ ) આગચ જતાં ધર્મશાળાથી લગભગ દશ મીનિટ નેટ્સે રસ્તે “ આયુ ધનપતિસીંગજી ” નું બંધાવેનું સંભવનાથ મહારાજનું દહેરાસર છે, નેની અંદર એક ઇશ્વરની અંદર સોનાની, તથા ચાંદીની મુર્તિઓ છે; ઉપર માળ ઉપર ચૈમુખજીની પ્રતિમાણ છે, અને

નીચેના ભાગમાં લોઘડં છે, દહેરસર મોહું અને વિશાળ છે, યોડે છેટે એક ખગીયો ચાચુ જમાનાને યોગ્ય જાડો, કુચારા, એન્ડ સ્ટેન્ડ વિગેરેથી શણુગારેદો જેવા લાયક છે; તેમ “બાયુદુ” ને રહેવાનો અંગદો પણ સુશોભીત ફુનીયરેથી શણુગારવામાં આવ્યો છે. (૩) આગલ પાંચ મીનિટે રસ્તે રામ ભાગમાં શામળીઓ પાર્શ્વનાથનું પંચાયતી દહેરસર છે; બાયુમાં આધ્યાપદ્ધતિની પ્રતિમાળ છે. (૪) ઉપચા દહેરસરના પાછકા ભાગમાં દાદાળના પગવાનું એક શિખરબંધી દહેરસર છે, અને સામે બાંધિસો કુંડ છે. (૫) કાલુઆયુનું બંધાવેલું પદમ પ્રલુછુનું દહેરસર છે. બાયુમાં આદેશ્વર ભગવાનના ચરણો છે. દહેરસર મોહું અને ભંગ છે. (૬) બાયુ ધનપતિસીંગળુનું ધર દહેરસર છે. જંગાનદીને કીનારે હોવાથી ધણું રમણીય લાગે છે. સુધાનાયકજી ગોડી પાર્શ્વનાથની પ્રતિમાળ છે. (૭) બાયુ સેનાપચંદુનું બંધાવેલું સુમતિનાથ મધ્યરાજનું દહેરસર છે. અહીંચા રતનની પણ પ્રતિમાળ છે. (૮) રાધ-યુદ્ધિસ્ત્રીંગળના મકાનમાં ધર દહેરસર ચિંતાપણું પાર્શ્વનાથ મહારાજનું છે. મકાનના ડેટ ઉપર કલ્લસો સોનાના જીવિષાલા છે. (૯) પંચાયત તરફથી બંધાવેલું નેમનાથ ભગવાનનું દહેરસર છે. (૧૦) પાછા વળતાં યોડે છેટે રથ યુદ્ધિસ્ત્રીંગળનું બંધાવેલું શાખરબંધી ચિંતામણું પાર્શ્વનાથનું દહેરસર છે. ગલારાનો ભાગ ધણો રમણીય લાગે છે.

૧૧૦. ક.—અહીંચા આગળ ડેઢપણું ફંહેરે નહાવાની સવડ નથી.

શહેર નાનું હોવા છતાં ધણું રમણીય લાગે છે. બાયુમંજ ગંગા નહીનો પ્રવાહ ચાહ્યો જય છે. વર્ષી અહીં આગલ; “ ધનપતિ, લખપતિ ” જેવા બાયુએ વસે છે. જૈતોની અંદર બાયુ પૈસાનો ભંડાર, સાથે રાજ-મહારાજનો ધલિય ધરાવનાર, ફુલ અણમગંજમાંજ છે. એશક, ફુનીયામાં પૈસાદારને તોટો નથી, પરંતુ પૈસાનો ખરો સદૃષ્યપોગ ડરનાર યોડા છે. હિગમ્યર જેવી આખી ડેઅ સાથે, ધાર્મિક આધુનિક લડત ચ્યાચી, ખરં તેજ પ્રગયાવવાની જોતાની, તન, મન, ધનદ્વી શક્તિ આપનાર આપણું શૈતામ્બર ડેઅન

અંદર “ બાયુ બહાદુરસીગળુ ” ની માતૃભૂમી એજ છે, અને એવણું સાહેયનું રહેડાણું પણ અહીંથાજ છે. ખરેખર એ ભૂમિને ખરો ધન્યવાદ ધર્યે છે. બાયુ બહાદુરસીગળ ગંગા નદીને સામે કીનારે “ બાલચર ” (જ્ઞાગંજ) માં રહે છે. અંગદો ધણો સારો અને કીમતી ઇનીચોણી શણુગારેણો છે. વહી અગીચો પણ જેવા જેવો છે. તેમ “ બાયુજુ ” ના દર્શનનો પણ લાભ લઈ શકાય છે.

### મહેમાપુર.

મહેમાપુર, અજમગંજથી ત્રણ માઠલ છેટે ગંગા નદીને કીનારે આવેનું છે; પગ રસ્તે બાલોચર થધ જધ શકાય છે તેમ અજમગંજથી ઢોડીમાં પણ જઈ શકાય છે. દહેરાસર એક છે. વીગત:—મોટા કંપાઉન્ડની અંદર જગત શેનું અંધાવેલું ચિંતામણું પાર્શ્વનાથનું છે. મુળનાયકણું પ્રતિમા તેમ ગર્ભ-ધારની એડીરો, થંબા, અને મંડપની આજુખાજુની ભીતો ઇસેઠીના પથરની કરવામાં આવી છે. વહી અને એક રતનની પણ પ્રતિમાણ છે. પાછળ દાદાળના પગનાં છે. અગીચામાં એક અંગદો પણ છે.

### કટગોલા.

અજમગંજથી મહેમાપુર જધ પાછા વળની વખતે કટગોલા નામનું નદીનું ગામ આવે છે, તાં પણ એક શીખરથંદી દહેરાસર છે જેણી વીગત:— બાયુ લદ્દોપતીનું અંધાવેલું, જાડો પુવારા વીજેરેથી ભરપૂર એવા એક અગીચામાં, આદેશ્વર ભગવાનનું દહેરાસર છે. અંદર ત્રણ રતનની પ્રતિમાણ ઉપરાંત એક પાનાની પણ પ્રતિમા છે. વળી અંદરનું ડેંતરકામ ધણું સારું કરવામાં આવ્યું છે.

### બાલોચર (જ્ઞાગંજ)

કટગોલાથી પાછુ તેજ નાવમાં “ બાલોચર ” આવતું. દાસ્તર્ની એંગોલ રેલેમાં, અહીંચાથી એ માઠલ જ્ઞાગંજનું સ્ટેશન લાગે છે. બજર પણ

મહેદો છે. આહીંચા આગળ રેશમી કાપડ, પીતામ્બરી, મુગયા, તાસા વીગેરે  
ધાથ વણ્ણાટના ધણ્ણા ઉત્તમ ભક્તે છે. બાદોચર શહેર અજુમંજળતી સામેજ  
કીનારે છે. દહેરાસરોની વિગતઃ—

( ૧ ) સંભવનાથ ભગવાનનું ધર દહેરાસર છે. આહીંચા પંચાયતી  
શાખરથંડી દહેરાસર અંધાય છે, પણ તૈયાર થયું નથી. ( ૨ ) તપેગચ્છતું  
આહેશ્વર ભગવાનનું શાખરથંડી દહેરાસર છે. ( ૩ ) લખપતિ આયું  
અંધાવેણું વિમળનાથનું દહેરાસર છે. માણ ઉપર ચૈમુખળતી પ્રતિમાળ છે;  
તેમ ડોટ ઉપર કળશા સોનાના જીવના છે. ( ૪ ) આયુ ધનપતિસીંગળતું  
અંધાવેણું આહેશ્વર ભગવાનનું ધર દહેરાસર છે. ( ૫ ) આયુ ઝારીચંદ  
શેડતું અંધાવેણું શાન્તિનાથ ભગવાનનું ધર દહેરાસર છે. બાદોચરથી લગમગ  
એ માઈં ઉપર “કીર્તિભાગ” જવું. આહીંચા રંગા પણ જઈ શકે છે.  
ભાડુ આવવા જવાનું લગમગ રા ૧) લે છે, દહેરાસર એક છે અને ને એક  
મહોયા અગીયાની અંદર છે. મુળનાયકળતી પ્રતિમા એ છે. એક સામણીચા  
પાર્વિનાથની અને બીજી વાસુપુર્ણ ભગવાનની છે; અને અને પ્રતિમાળ  
કર્ણેઠીની છે. માણ ઉપર ચૈમુખળતી પ્રતિમાળ છે. વકી યોડે છેટે અદ્ભુ-  
યદી દહેરાની અંદર હાદળતા પગદાં છે.

### મુર્શિદાભાદ.

બાદોચરથી લગમગ દ્વારા માઈં ઉપર “મુર્શિદાભાદ” આવેણું છે  
જેનું છસ્ટર્ન એગોલ રેલવેમાં રેલેશન પણ છે. આહીંચા દહેરાસર નથી, પણ  
ગંગા નહીને કીનારે નવાયની ઢોઢી ખાસ જોવા લાયક છે. વેરવો ત્રણ  
માઈંનો ક્રહેચાય છે. અંદર એક નીમાન પદ્ધતો મહેદો હોલ છે, અને  
તેની ઉપર મુકીઅન જોવા જેવું છે; જેની અંદર ઉત્તમ ઝારીગીરીથી શણુગારવામાં ચાચ્યા  
છે. આહીંચાથી વગતી વખતે ૪ માઈં ઉપર “કાર્સીમ બજાર”

જવું. શહેર સાધારણ છે; પણ રેશમો વણુટને વાસ્તે પ્રપ્રથમાત્ર છે. દહેરાસરળ એક છે, અને તે પર્યાયત તરફથી બધાવવામાં આવ્યું છે. મુળનાયકજીની પ્રતિભા નેમનાથ ભગવાનની છે.

તા. ૩-૪-૫-૬. સુધી મલી દીન ૪ અજુમગંજમાં રહ્યા. અહીં ધોયીની પણ સવડ, મલી શકે છે. લલી હેક જૈન યાત્રીઓને અમારી વિતાંતી છે. એને સ્ત્રામું ખહાઇરસીંગળું તથા વિજયસીંગળ વિગેરે નામાંકોત ગૃહસ્થોની મુલાકાત દેવી. તા. ૭-૧-૨૧ ને હિસ્સે સવારે દશ વાગ્યાની ગાડીએ ઐસી સાંજે સાડા છ વાગે. ભાગલપુર ઉત્ત્યો. વચ્ચમાં નલહડી જંકશને ગાડી બદલવી પડે છે.

### ભાગલપુર.

શહેર રાષ્ટ્રેશનથી શરૂ થાય છે. ક્ષેત્રાભ્યર ધર્મશાલા રાષ્ટ્રેશનથી લગ્બગ દશ મીનિટ નેટલો રસ્તો કાપતાં આવે છે, નેમાં દોદસો સમાઈ શકે એવી મેડી જગ્યા છે. ધર્મશાળામાં જોદાં વિગેરેનું સાધન નથી પરંતુ વાસણું વિગેરેનું સાધન સાધારણ છે, વધુ વાસ્તે ચાર માઠલ ઉપર આવેલા ચંપા-નગરીથી સવડ થઈ શકે છે. ધર્મશાલામાં શ્રીવાસુપુન્યસ્વામીનું દહેરાસરળ છે. વળી સાવન્થી તથા મીયુલા નગરીઓમાં શ્રી સંભવનાથ, શ્રી મલ્લનાથ, તથા શ્રી નેત્નીનાથના કલ્યાણદ્રા થયેલાં છે, પણ તે નગરીઓ વિનિષેદ અવાથી અહીં પગલાં પધારવામાં આવ્યા છે. ચ્યબન, જન્મ, હિક્ષા, તથા કેવળજાન મળી આર કલ્યાણદ્રા થયેલાં છે. શહેર મોટું છે. ટાકાની મલ્લમલતું તરેહ તરેહનું કાપડ ધણું સારું મદે છે. અહીંથી ચંપાપુરી ચાર માઠલ થાય છે.

### ચંપાપુરી.

ભાગલપુરથી ચંપાપુરી જવાને ટાંગાએ મદે છે દહેરાસર એક છે અને તે ધર્મશાળામાં છે, ધર્મશાળામાં લગ્બગ ૧૦૦ માણુસો સમાઈ શકે એવી

જગ્યા છે. વાસણુ ગોહડાં વીજેરે મલે છે. સીધુસામાન અડધા ભાઈલ ઉપર આવેલા નાથ નગરમાં મલી શકે છે દહેરાસરની વીગતઃ—પચાયતનું બંધાવેલું શ્રી વાસુપૂજ્યસ્વામીનું દહેરાસર છે, અહીં કારખાતું પણ છે. દહેરાસરમાં ત્રણ ગલારા છે. એકમાં મૂળનાયકજીની પ્રતિમાળી, બીજમાં શ્રી વાસુપૂજ્યના ચવન, જન્મ, દીક્ષા, અને ડેવળજીન મલી ચાર કલ્યાણુકના પગલાં છે. અને ત્રીજ ગલારામાં શ્રી વાસુપૂજ્યનું જીતું દહેરાસર છે. માળ ઉપર ચોમુખજીની પ્રતિમાળી છે. અહીંચા આગલ રેશમનું હાથ વણુટનું કામ સારું થાય છે. અતેથી અડધા ભાઈલ ઉપર નાથ નગર જવું.

### નાથનગર.

ઇટ ધન્દીચા લાઈનમાં ભાગલપુરથી થીજું સ્ટેશન નાથ નગરનું આવે છે. સ્ટેશનની સામેજ બાધું સુખલાલજીનું બંધાવેલું શ્રીવાસુપૂજ્યસ્વામીનું ધાણું રમણીય અને નેવા લાયક એક દહેરાસર છે. અહીંચાથી અડધો ભાઈલ ચંપાપુરી થાય છે, અને ત્રણ ભાઈલ ભાગલપુર થાય છે. અને જગ્યાએ ધર્મશાળાની તેમ સીધું સામાનની સવડ મલી શકે છે, પણ ચંપાપુરીમાં સુકામ કરનારે અચેથી સીધું લાવવું પડે છે.

તા. ૭-૧-૨૧ ને દ્વિસે સાંજે ભાગલપુર આવી તા. ૮ તથા તા. ૯ રહી અપોરે ચાર વાગ્યાની ગાડીમાં એસી રત્ને આઠ વાગે લખેસરાઈ ઉત્તર્યો અને તા. ૮ ને દીવસે શા. નાનચંદ કક્ષાળ કરચેલીચાવાલા તરફથી ટેણી કરવામાં આવી હતી, તથા. તા. ૯ ને દીવસે શા. તલકચંદ માનાળ કરચેલીચાવાલા તરફથી ટેણી કરવામાં આવી હતી. વાસળો ચંપાપુરીથી મંગાવવામાં આવ્યા હતા. તેને વાસ્તે નકરો આપવો પડતો નથી.

### લખેસરાઈ.

સ્ટેશન ધાણું નાનું છે. ગાડી ઇકત ત્રણ મીનીટ ઉભી રહે છે. દહેરાસર નથી. ધર્મશાળા વિષણુ લોકની છે, પરંતુ જૈન મુસાફરોને પણ સવડ પ્રમાણે

જગ્યા ખેલે છે. સ્ટેશનથી પાંચ મીનિટ નેટવો રસ્તો છે. લખેસરાઈથી પાસેતું રટેશન કીયુલ મ્હોડું જંક્શન છે. અને ધર્મશાળા પણ છે. અહીંથી અડવા આનાની રીકીટ થાય છે અને વચ્ચમાં ફૂલ કીયુલનદીજ આવે છે. ધણ્યાભરા જનીઓ ત્યાંથી પણ પંચતીર્થ ફરી શકે છે. અહીંથી ગાડાઓ પણ કીયુલથી જ આવે છે. અહીં સીધુ સામાન તેમ દૂધ વિગેરેની સવડ નેઘયે તેવી મલી શકતી નથી. અને ખેલે છે તો છેદું જવું પડે છે. અવેઠી પંચતીર્થ ફરનાર જનીઓએ કીયુલ ઉત્તરી જવું એવી અમારી ભલામણું છે. તા. ૧૦ નો દીવસ અને રહી તા. ૧૧ ને દીવસે ગાડાઓ ભાડે કરી સવારમાં નીકલી કાકંઢી બપોરે એ વાગ્યે આવી પહોંચ્યા. અહીં ગાડાઓના બળદ સારા હોતા નથી.

### કાકંઢી.

લખેસરાઈથી ૧૨ માછલ થાય છે, સીધુ સામાન ભળતું નથી. ગાડાઓ લગભગ સાત કલાકમાં જધ શકે છે. ધર્મશાળામાં આસરે ૧૫૦ માણુસો સમાઈ શકે છે. ગાડાઓ છેક ધર્મશાળા સુધી જધ શકતા નથી. ત્યાંથી પાંચ સાત ખેતરવા છેટે રહે છે, કારણુકે વચ્ચમાં ખેતરો આવ્યાં છે. ધર્મશાળાની મધ્યમાં શ્રીસુવિધિનાથનું દહેરાસર છે, તથા શ્રીસુવિધિનાથનાં ચાર કલ્યાણુક ચ્યન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાનનાં પગલાં છે. અહીંના દહેરાસરનો વહીવટ લછવાડકાર ખાતે ચાલે છે.

લછવાડ અહીંથી ૨૦ માછલ થાય છે. લખેસરાઈથી નીકલતી વખતે જન્માળુંઓએ એથી ત્રણ દીવસનું સીધુ સામાન સાથે લેવું. કાકંઢીથી લછવાડ જતા વચ્ચમાં જયુગામ કરીને ગામ આવે છે, ત્યાં આગળ નાતુ સરખું ભજાર છે.

### લછવાડ.

ગામ નાતું છે અને બહુદ્યા નહીને કીનારે આવેલું છે. ધર્મશાળા એકદમ નહીને કીનારે છે તેમ અંદરથીમહારી સ્વામીનું દહેરાસર છે.

ગામમાં સીંહ સામાન મળે છે. પણ સારો જેયતા પ્રમાણુમાં ભલતો નથી. ધર્મશાળાથી કૃતીકુંડ નામનો પદ્માંડિ શંક થાય છે.

### કૃતીકુંડ.

ધર્મશાળાથા એ માઈલ ઉપર એક કુંડ આવે છે, તેને કૃતીકુંડ કરી કરું છે. પાણી બારે આસ રહે છે, રસ્તો સીધો છે. અતે એક દઢી છે નેમાં શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાળ છે અને ચ્યવન કલ્યાણુક છે, વળી થાડે છે એ બીજી એક દઢી છે. તેમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતીમાળ અને તાં દિક્ષા કલ્યાણુક છે. અહીંથી આગળ જતાં એં માઈલ સુધી સાધારણુ દોળ આવે છે, પછી પહાડ ઉપર ચટવાનું શરૂ થાય છે, જ્યાં આગળ રસ્તો બાંધેલો નથી પરંતુ ખાડી પથરોજ છે. આગળ તુ માઈલનો સીધો ઉચ્ચો ચટવાન આવે છે. તાં આગળ શિખરઅંધી દહેરાસરળમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાળ છે. પાસેજ પાણીના નાના નાના કુંડ છે. ધર્મશાળાથી અહીં સુધી આવતાં જતાં ૧૨ માઈલ નેટલો રસ્તો ગળાય છે. ડોલીઓના હા. ૧-૬-૦ નો બાંધેલો ભાવ છે. વળી રસ્તો પદ્મારી અને ધણી નહેરો વાળો છે, જંગલી જનવરોની ધાર્તી રહે છે, તેમ અનણ્યને લુકાપડી જવાનો સંભવ હોય છે, માટે સાચે ભાણુસ રાખનું. સવડ કાર-ખાનાવાળા તરફથી કરી આપવામાં આવે છે. પહાડ ઉપર યુટ સાચે જધુર શકાય છે, તેમ ભાથુ પણ ધણી લોક લઈ જાય છે.

તા. ૧૨ ને દીવસે સવારે કાંઈકીથી નીકલી સાંજરે લગભગ આઈને સુમારે લઘવાડ આવી પહોંચ્યા તા. ૧૩ તથા તા. ૧૪ ના દીવસો રહી તા. ૧૫-૧-૨૧ ને દીવસે આગળ ન જતા લખેસરાઈ થઈ કીયુલ અપોરે ચારને સુમારે આવી પહોંચ્યા. લઘવાડથી સીધો કીયુલનો રસ્તો ૨૦ માઈલ નેટલો થ.ય છે. પાછા વળવાનું ખાસ કારણુ ઇંત અણદ નથીના હતા તેમ ગાડી-વાનો પણ તેવાજ હતા.

### કૃષુલ.

સ્ટેશન મહેદું છે અને જંકશન છે. ધર્મશાળા ચારસો માણુસો સમાઈ શકે એવી સ્ટેશનની સામેજ છે. સીધુ સામાન બાળુમાંજ મલે છે. કાકંદી, તથા લઘવાડ વાસ્તે ગાડાઓ અહીંથીજ આવે છે પણ ઉપર કહેલી રિથતિના હોવાથી પહેલેથી બધી બાઅત નક્કી કરી ભાડે કરવા. અમો અનેથી સાંજે આહ વાગ્યાની ગાડીમાં એસી દશ વાગે નવાડા ઉત્થા. અને પ્લેટફોર્મ નથી, ગાડી ઇકા પાંચ મીનીટ ઉલ્લિ રહે છે. અહીં ધર્મશાળા નથી. પણ એમાંથી ઉપર ગુણીયાળમાં ધર્મશાળા છે. ગાડાઓ સ્ટેશન ઉપર તૈયાર રહે છે.

### ગુણીયાળ.

વર્ષી ખીલડુલ નથી, સીધુ સામન વીગેરે મલતું નથી. તેને વાસ્તે કારખાનામાં એક માણુસ રાખવામાં આવ્યો છે, કારણુકે એ માઈલ ઉપર નવાડા કરી ગામ છે ત્યાં સંધળું મલી શકે છે. ધર્મશાળામાં ત્રણુસો માણુસો સમાઈ શકે એટલી જગ્યા છે. મધ્યમાં એક બગીચો છે. પાછળ નોભર-પોંખર નામનો એક તળાવ છે. વચ્ચેમાં શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે. વળી અંદરગૈતમ સ્વામીના મોક્ષ કલ્યાણુકનાં પગલાં છે. અને મહાવીર ભગવાનનું ચૈદું ચોમાસુ થયું હતું. દહેરાસરજીમાં જવાનો રસ્તો એક પૂલના આકારમાં ખાંખવામાં આવ્યો છે. અહીંથી પાવાપુરી માઈલ ૧૪ થાય છે. તા. ૧૬ ને હિસે રાજગીરી સુધીના ગાડાઓ ભાડે કરી બપોરે એ વાગે નીકલી રાતે આહ વાગે પાવાપુરી આવી રહેંચ્યા.

### પાવાપુરી.

ગામ નાનું છે, પરંતુ સીધુ સામાન દૂધ વીગેરે સંધળી ચીજ મળી શકે છે. ધોણીની પણ સત્રડ છે. કંપેંડાં ચોવીસ કલાકની અંદર આવી જય છે. અહીંથી ધર્મશાળા પાંચ છે. વીગતઃ—

૧ રાય સીતાપચંદજી નહાર અહાદુરની બંધાવેલી ફરતે ડોટ સાથે ૫૨, ઓરડીએ વાલી ધર્મશાળા છે.

૨ બાયુ કાલુરામ શ્રીપાલ, તથા હરખચંદ આયુ, તથા દાલચંદજી સંધની ની બંધાવેલી લગભગ ૨૦ ઓરડીએવાળી તથા ઉપર અગારી પણ છે.

૩ જળ મંદીરની સામે રાય મુહિસીંગ અહાદુરની બંધાવેલી લગભગ ૧૫ ઓરડીએ વાલી તથા ઉપર અગારી પણ છે.

૪ ગોલી બાયુની બંધાવેલી છે, જેમાં લગભગ ૪૦૦ માણસો સમાઈ શકે છે.

૫ ગામની અંદરની ધર્મશાળા જ્યાં આગળ એ ધર્મશાળા છે, પહેલીમાં લગભગ ૮૦૦ થી ૯૦૦ માણસો સમાઈ શકે છે. જેના મધ્ય ભાગમાં કુલના અગીવામાં શ્રીમહાવીરસ્વામીનું દહેરાસરજી છે. તેમ બાળુમાં એ કુવાએ છે. નહાવા ધીવાવાની ધણી સારી સવડ છે. કારખાનાં પણ અવેજ રાખ્યું છે. બાળુમાં અંગુષ્ઠ ધર્મશાળા બાયુ નવરતનજીની બંધાવેલી છે.

### અહીંચા ચાર દહેરાસરો છે. વીગતઃ—

૧ “જળ મંદીર” મોટા તળાવના મધ્ય ભાગમાં બંધાવવામાં આવ્યું છે, જ્યાં જવા વાસ્તે પથરનો નાનો સરખો પૂલ બાંધવામાં આવ્યો છે. દેખાવ ધર્ણો રમણીય લાગે છે. મુળનાયકશ્રીની પ્રતિમા શ્રી મહાવીરસ્વામી ભગવાનની છે, તથા શ્રી જીતમસ્વામી તથા ગણુધરના પગલાં છે. અહીં આગળ શ્રી મહાવીર ભગવાનને અનિદાન દેવામાં આવ્યો હતો. વલી આસો ( ૧૮૦ ) ને દ્વિસે અહીંચા આગળ જખર જસ્ત મેળો ભરાય છે. અને કહેવાય છે કે અનિ સંસ્કારના વખતે યોડો વખત ભગવાન ઉપર છત ડેલે છે.

૨ સરખો સરણું દહેરાસર જ્યાં આગળ શિખર બંધી દહેરાસરમાં શ્રી મહાવીર પ્રભુના ચર્ચો છે. અને કહેવાય છે કે અહીં આગળ ભગવાને દેશના ( ઉપદેશ ) કર્યો હતો.

૩ રાય ખુદ્ધિસીંગ બહારનું બંધાવેનું શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરની અંદર ચોમુખ પ્રતિમાળ છે. દહેરાસરની કૃતે બગીચે છે.

૪ “ગામ મંદીર” નું દહેરાસર, અંદર મૂળનાયકજી શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાળ છે, તેમ અંદર ચારે ખુણે દહેરીચોમાં પગલાં છે, તેમ મહાવીર સ્વામીના મોક્ષ કલ્યાણુકના પગલાં છે. દહેરાસર ધર્મશાળાની વચ્ચમાં બગીચામાં છે.

જાત્રાળુચો ધણે ભાગે અહીંનીજ ધર્મશાળામાં ઉત્તરે છે. બધી જગ્યા પુરાયા પઢી બીજ ધર્મશાળા ખોલવામાં આવે છે. વક્તી કારખાનું પણ અહીંન છે, જેમાં ખુદ્ધિસીંગજીના દહેરાસર શીવાય બધા દહેરાસરનો હિસાબ એજ કારખાને રહે છે, તેમ અહીંચાના લંડાર હસ્તક ત્રણ ગમો છે, જેની ઉપર વાર્ષિક રૂ. ૨૫૦૦) ની આવે છે.

તા. ૧૭ ને દિવસે પાવાપુરી રહી તા. ૧૮ ને દિવસે સવારે ૬ વાગે નીકલી બ્યોરે ૧૧ વાગે બીજાર આવી પહોંચ્યા. પાવાપુરીમાં સંધ તરફથી ગરિયેને અનાજ વહેંચવામાં આવ્યું હતું. શા. પદમાળ નાથાજી સરભણવાલા તરફથી ટોળી કરવામાં આવી હતી. અને શા. મંધુ જવેર મહુવાવાલા તરફથી પંચકલ્યાણુકની પૂજન ભણવવામાં આવી હતી.

### બીજાર (વિશાલા નગરી).

પાવાપુરીથી બીજાર ૮ માધ્યમ થાય છે, અતે ધર્મશાળા એક છે, જેમાં આસરે ૧૫૦ માણસો સમાચ શકે છે. ગામ સધારણું છે તેમ અનાર પણું છે. અસલ બીજાર એક મહેનું શહેર ગણાતું પણ હાડમાં ઇકત ખંડીએરોજ જોવામાં આવે છે, વસ્તીમાં હાલ મુસલમાનેની વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. અતે દહેરાસરો ત્રણ છે. વીગત:-

૧ ધર્મશાળાની વચ્ચમાં શ્રી મહાવીરસ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરજીની અંદર એ ગભારા છે. એક ગભારામાં વિમાલનાથ તથા બીજામાં શ્રીશાનિતનાથની પ્રતિમાળ છે.

૨ ધર્મશાળાથી લગભગ ૧૫ મીનિટ જેટલે રસ્તે લાલભાગની અંદર રીખવહેવ ભગવાનનું દહેરાસર છે. ત્યાં આગળ બાગ, ઘગીચો નથી પણ ગામને નાડે છે ત્યાં કુઠ ઘડેરો આજુઆજુ જેવામાં આવે છે. અને મહાવીર પ્રભુએ અગીયાર ચોમાસા કર્યો હતા.

૩ આગળ જતા ૧૪ મીનિટને રસ્તે એક કંપાઉન્ડની અંદર શાખાઓથી દહેરાસર છે, જેમાં હાહાળતા પગલાં છે.

તા. ક.- ઇસ્ટ ઇન્ડિયા રેલ્વેમાં બાહ્યતીચારપુર સ્ટેશનથી રાજ-ગીરી સુધી એક નાની લાઠનિ છે જેમાં બીહુરનું સ્ટેશન આવે છે. અને સ્ટેશનથી ધર્મશાળા એક માછલિ થાય છે.

તા. ૧૬ ને દીવસે સવારે ૬ વાગે નીકલી બ્યોરે દશ વાગે કુંડલપુર આવી પહોંચ્યા.

### કુંડલપુર ( ગોબર નગરી )

ખાહારથી, કુંડલપુર ૬ માછલિ થાય છે. ધર્મશાળાની ૭૫ થી ૧૦૦ માણુસો સમાઈ શકે છે. ધર્મશાળાની વચ્ચમાં શ્રી મહાવીરસ્વામીનું દહેરાસર છે. બહાર શ્રીગૈત્રમસ્વામીના પગલાં છે. અને જૈતમ સ્વામીનો જન્મ થયો હતો. ગામ નાનું છે. સીધું સામાન વીજેરે મલી શક્તું નથી. અનેથી એજ દીવસે બ્યોરે બાર વાગે નીકલી ચાર વાગે રાજઘરી આવી પહોંચ્યા.

### રાજઘરી.

કુંડલપુરથી રાજઘરી ૧૦ માછલિ થાય છે. ધર્મશાળા ગામને નાડે છે અને અહીંચાથી લગભગ ૧૦ માછલ સ્ટેશન થાય છે. સીધું સામાન વીજેરે સધળી સામની મલી શકે છે. વલી અહીંએ ધર્મશાળા, પોરટ એશીસ તથી સ્કુલ પણ છે, તેમ અહીંએની આમોહવા પણ સારી છે. જેને લાંઘણા લેડા હવાને આવે પણ આવે છે.

ધર્મશાળા એ છે. જુની ધર્મશાળામાં લગભગ ૨૦૦ માણસો સમાઈ શકે એટલી જગ્યા છે, તેમ મધ્યમાં એક કુચો છે. જેમાંથી એક નાની ડેડીમાં પાણી એકું કરી લેછે. અને ડેડીએ નણો મુક્તવામાં આવ્યા છે. ખાનુમાં ખીજુ એક નવી ધર્મશાળા બાંધવામાં આવી છે, જેમાં પણ લગભગ ૧૫૦ થી ૨૦૦ માણસો સમાઈ શકે છે. મુનીમની એરીસ પણ એજ ધર્મશાળામાં છે, વાસણું ખીજાના વીજેરે પણ સારા પ્રમાણમાં રહે છે. ધોણી પણ આવે છે. ધર્મશાળાની બાનુમાંજ “ગામ ભંડીર” છે. જેની વીગત:-

દહેરાસર એક છે, મૂળનાયકજીની પ્રતિમા શ્રી પાર્શ્વનાથ લગવાનની છે, એક ખાનુંએ એક નાની દહેરીમાં દાદાજીના પગલાં છે, અને ખીજુ ખાનુમાં દીગમ્બરનો ગલારો છે. સામેના ભાગમાં ખીજ ગલારામાં મુનિસુવૃત્તસ્વામીની પ્રતિમાણ છે. ઉપરના ભાગમાં શિખરજીની અંદર ગલારામાં રીખવહેવ ભગવાન છે અને ખાનુમાં દીગમ્બરનું દહેરાસર છે.

અનેથી પાંચ પદ્માચલાને વાસ્તે ૦૩ માઠલ જવું પડે છે. રસ્તો કુલભુલામણુનો છે, માટે સાથે માણસ લેવો, જેને વાસ્તે કારખાના તરફથી સંપદ કરી આપવામાં આવે છે, તોલી મલે છે. જેના હા. ૩-૭-૦ લેછે. પહોંચું વર્ણન:-

### ( ૧ ) વિમલાચલ.

આ પહોંચનો ચઢાવ સુગમ છે. એક કોસ એટલે એ માઠલનો ચઢાવ અને એ માઠલનો ઉતાર, રસ્તો બાંધિયો નથી, પરંતુ પત્થરો સારી રીતે ગોડવ્યા છે. નીચેથી ચઢતા પ્રથમ એવંતામુનિની દહેરી આવે છે, જ્યાં આગળ મહાનીર પ્રભુએ ચોમાસુ કર્યું હતું. કેદ ઉપર જતા ચાર દહેરીઓ આવે છે. ( ૧ ) શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમાણ છે. ( ૨ ) શ્રીમહાલીરસ્વામીના પગલાં છે. ( ૩ ) શ્રીમુનિસુવૃત્તસ્વામીના ચાર કલ્યાણક ( ચ્યવન, જન્મ, દીક્ષા, ઝેવણજીન ) ના પગલાં છે. ( ૪ ) શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચર્ણો છે, તથા નેમનાથ અને શાંતિનાથ મહારાજના પણ પદ્માચલાં છે.

તા. ક.—અહીં ત્રણ પહાડ સુધી બીજુલ પાણી મલતું નથી. તેમ કેચ્છ જાતિને નહાવાની છન્છા હોય તેમણે નીચેથી કુંડમાં નાહી પૂજની સામયી સાથે લઈ ઉપર જવું. પહાડની નીચે ૧૭ ઉના પાણીના કુડો છે. જ્યાં આગળ વિષણું ભંદિર છે. પહાડ ઉપર યુદ્ધ સાથે પણ ચદાય છે, પરંતુ રસ્તો બાંધેલો નથી, માટે પથર ઉપર ચદા ચઠનારને અડયણ પડે છે, એટલે ઘણા વગર યુદ્ધ ચઢે છે. બીજો પહાડ ઉત્તર્યા પણી કારખાના તરફથી ભાયું આવે છે, અને ત્યાં આગળ કુવો છે, જ્યાં કુંતા પાણી મળી શકે છે. બીજો પહાડ ચઠવાને વાસ્તે પહેલો પહાડ તફન ઉત્તરી જવો પડે છે. બીજો પહાડ પાણના બાગમાં છે.

### ( ૨ ) રત્નાગિરી.

એ પહાડનો ચદાવ પણ એ માધ્યમનો છે અને ઉત્તાર પણ ર માધ્યમ છે. ઉપર ત્રણ દફેરીએ છે. પ્રતિમાળ છે. ( ૨ ) શ્રીચિંન્તામણ પાર્શ્વનાથના ચારોણી છે. ( ૩ ) શ્રી સંભવનાથ, શ્રી નેમનાથ, શ્રીપાર્શ્વનાથ, તથા શ્રી પદમ-પ્રભુજ્ઞના પગલાં છે. અહીંથી નીચે ઉત્તરવાનો રસ્તો પાછળથી છે. પરંતુ પાંચે પહાડ ચઢી ઉત્તરીએ તો આખરે રસ્તો એક થઈ જય છે, એટલે જ્યાંથી પહેલો પહાડ ચઠવાનો શરૂ કરીએ, ત્યાં આગળજ પાંચમાં પહાડનું નાદું આવી રહે છે. અને એંનેની તોણી આગળજ કુડો છે તથા વિષણું ભંદિર છે.

### ( ૩ ) ઉદીયાગિરી.

આ હુંગર ઉપર ચઠવા માટે બીજો પહાડ ઉત્તર્યા પણી, લગભગ માધ્યમને આસરે સપાઠ રસ્તે ચાલવું પડે છે. ચદાવ સાંચારણ ઉમો છે. પરંતુ કુંડો છે, એટલે લગભગ દોઢ માધ્યમનો છે. અને જે રસ્તેથી ચઢીએ, તેજ રસ્તે પાછું નીચે આવવું પડે છે, અને ત્યાંજ તોણી આગળ ભાયું હેંચવામાં આવે છે. ત્યાં આગળ મઝનાની સવડ નથી, પરંતુ એક ઝડ નીચેજ મુકામ

કુરી વીસામો કે છે. ઉપરના દહેરાસરોની વીગતઃ—( ૧ ) શ્રીશાંનિતનાથની પ્રતિમાળ છે. ( ૨ ) શ્રી પાર્વતનાથની પ્રતિમાળ તથા ચર્ચા છે. ઇરતે ચાર દહેરીએ છે, નેમાં પહેલામાં શ્રી પાર્વતનાથ, બીજામાં શ્રી અલિનંદન, ત્રીજામાં શ્રી આહીશ્વર અને ચોથામાં શ્રી સુમતીનાથજીની પ્રતિમાં તથા ચર્ચા છે.

### ( ૪ ) સોનારગિરી.

ત્રીજે પહોડ ઉત્તર્યો પદ્ધી લગભગ ૦॥ માછલ સીધા રસ્તો ચાલી, પહોડ ચટવાનો આવે છે. નેમાં ચદ્રાવ થોડો છે. પરંતુ લંબાણુ વધારે છે. એટદે નીચે સુધી ઉત્તરાં લગભગ પાંચ માછલ નેટસો રસ્તો થાય છે. રસ્તો છુટા પથરોને હોવાથી કંઈણ લાગે છે. ઉપર એક દહેરી છે નેમાં શ્રીઅજીતનાથની પ્રતિમાળ છે તથા ચર્ચા છે અને તેની સામે નાની દહેરીમાં શ્રીજૈતમસ્વામીના પગલાં છે. ત્યાં દર્શન કરી નીચે ઉત્તરી લગભગ ૦॥ માછલ સપાઈ ચાલતાં અગળ શાલિમદનો કુવો આવે છે, ત્યાં કહેવાય છે કે શ લિલદરોહોનો મહેલ હતો અને હમેશા ૮૮ પેટીઓ આલુપણુ તથા ખાનપાન વિગેરેની આડાશમાંથી ઉત્તરતો, અને પેટીએ એ કુવામાં નાંખી દેવામાં આવતી હતી. સરકાર તરફથી એદ કામ કરી તપાસ કરવામાં પણ આવી હતી, પરંતુ હાથ ન લાગવાથી કુવો પુરી નાંખવામાં આવ્યો છે, જેની નીશાની હાલ પણ છે. આગળ જતા શ્રેષ્ઠીક મહારાજની ગુઝા છે, અને ત્યાં આગળ શ્રેષ્ઠીક મહારાજની મુર્તિ છે. અહીં કહેવાયછે કે શ્રેષ્ઠીક મહારાજનો ભંડાર છે, તેમ પહુલાં રાજસભા ભરતી હતી. ગુઝાની અંદર કોઈ ભીજુ ભાવામાં શિલાલેખ છે. અહીથી લગભગ ૦॥ માછલ આગળ જતાં પાણીનું વહેળું આવે છે. જ્યાં આગળ પાંચમાં પહોડનો ચદ્રાવ શરૂ થાય છે.

### ( ૫ ) વૈલારગિરી.

આ પહોડ ચટવાને વાસ્તે એ રસ્તાએ આવે છે. પહેલો રસ્તો પાણીના હોળાથી શરૂ થાય છે. જ્યારે ભીજે રસ્તો લગભગ ૦॥ માછલ સપાઈ ચાલી

અને ચલવાશરૂ થાય છે. તેણી વિગેરે પહેલે રસ્તે જઈ શકતી નથી, કારણ કે પથરો એકદમ સીધા અને મોટા ચલવાના આવે છે. રસ્તો ધણો અઉચુણું ભરેલો છે, પણ સીધા રસ્તા કરતાં ધણો કુંડો છે, એટલે ચલવ લગભગ એક માછલોનો અખરો અને એક માછલોનો સાધારણું આવે છે. કુંડ રસ્તે ઉપર જતાં, (૧) દહેરીમાં ધનાશા તથા શાલીભદ્રની પ્રતિમા છે, (૨) ચોનીશ ભગવાનના દર્શન તથા મુળનાયકજીની પ્રતિમા નેમનાથ ભગવાનની છે તથા ચર્ચાં છે, અને પાર્થનાથના ચર્ચાં તથા સુમતિનાથની પ્રતિમાણ છે, (૩) દહેરીમાં ગણાંબીરસ્વામીની પ્રતિમાણ છે, તથા પાર્થનાથ, નેમનાથજીની પણ પ્રતિમાણ છે, તથા નેમનાથ ભગવાનના ચર્ચાં તથા ભમતીમાં દાદાજીના ચર્ચાં છે. (૪) નેમનાથ, શાંનિતનાથ, તથા કુંયુનાથજીની પ્રતિમાણ છે. (૫) આહિનાથ, પાર્થનાથ, તથા કેસરીચાણ મહારાજના ચર્ચાં છે. (૬) ચંદ્રપ્રભુજી તથા દાદાજીના ચર્ચાં છે. અહીંથી એક માછલોનો ઉપર ચલવ છે, જ્યાં આગળ દહેરીમાં શ્રી શાંનિતનાથજીની પ્રતિમાણ છે, તથા જૌતમસ્વામી તથા ગણુધરના પગલાં છે. અહીંથી નીચે ઉત્તરવાળો રસ્તો લગભગ એ માછલિના આસરાનો છે.

પાંચે પણાડ દૂરી આવતાં ૨૪ માછલની મુસાફરી થાય છે. પાંચ પણાડ ઉત્તરી આવતાં નીચે ગરમ પાણીના ૧૭ કુંડો છે અને ત્યાં અંધીક મહીને એરસે ત્રણું ત્રણું વરસે મેળો ભરાય છે. રાજબાળી નગરીનો કહેવાય છે કે અસર ૪૮ ગાડોનો ધૈરાવો હતો, જ્યાં આગળ અંધીક મહારાજ રાજ્ય કર્તૃ હતા. હાલ જેતાં જ્યાં ત્યાં એ તેરો અને ઈટો માલમ પડે છે. વલી અહીંથાં આગળ મહાંબીર પ્રભુએ ૨૪ ચોમાસાં કર્યા હતા.

તા. ૨૦, ૨૧, અને ૨૨ મહી ત્રણું દીવસ અને રહી તા. ૨૩ મહીની સાંચે પાંચ વાગે રાજગીરી સ્ટેશનેથી એસી અખતીઓારપુર રાતે અગીઓાર વાગ્યાની ગાડીએ એસી રાતે બાર વાગે પથના-સીદી ઉત્તર્યાં બી. બી. એક્સ. રેન્ચ ( અખતીઓારપુર બીલાર લાઈટ રેન્ચ ) માં રાજગીરીનું છેલ્લું

સ્ટેશન આવે છે, અને જંકશન અખતીઓપુરતું ગણ્યાય છે, અને ત્યાંથી ચોથું સ્ટેશન પઠના આવે છે, બાડું રા. ૧-૧-૦ થાય છે.

### પટના.

“ પટના ” ના ત્રણ સ્ટેશન છે. પટનાસીટી, ગુલારાયાગ, અને પટના જંકશન (આંકીપુર). ધર્મશાળા પટના સીટીથી થોડે છેટે લગભગ ૧૦૦ કદમ્બ હુર ગોડાઉનની પાસે સરકની નીચેના ભાગમાં “ જહુરામ મારવાડી ” ની છે, જેમાં લગભગ ૧૦૦ માણુસો સમાધ શકે છે. બહારના ભાગમાં કુવો છે. સીધુસામાન થોડે છેટે અનન્તરમાંથી લાવવું પડે છે. શહેર ત્યાંથીજ શરૂ થાય છે, પરંતુ અન્નર લગભગ સ્ટેશનથી એક માછલી થાય છે. વલી અન્નરમાં “ અનતિકાલ અગરવાલા ” ની પણું એક મોટી લગભગ ૪૦૦ માણુસો સમાધ શકે એવી ધર્મશાળા છે. “ ગુલારાયાગ સ્ટેશન ઉપર એકદમ સ્ટેશનની નજીવી દરેક બાયતની સોધવાલી ૫૦૦ માણુસો સમાધ શકે એવી “ કોરોનીકાલ ચોધરી ” ની ધર્મશાળા છે. વચ્ચમાં એક કુડ છે, અને તેની આણુમાં દેહાયમાન બંગલો છે, જેની દરતે બગીચો છે. પાણીના નળો પાયખાના વિગેરે દરેક બાયતની જેગવાઈ ધણી સારી છે. બહાર આણુભાંજ શાકભાજુની મારકે છે, જેમાં સીધુ વિગેરે બધું ભલે છે. સ્ટેશન ઉપર ગાડી લગભગ પાંચ મંનીએ ઉભી રહે છે, પરંતુ જત્તાણુંઓને બને ત્યાં સુધી ગુલારાયાગજ ઉત્તરતું દહેરાસરની વીગત:-

(૧) પટના સીટીમાં લગભગ સ્ટેશનથી એક માછલી છેટે બારેકી ગલીમાં અંદ્રપ્રભુતું દહેરાસર છે. જ્યાં આગળ નહાવાની સોઈ પણ રાખી છે. કુત્તા પુલના કપડાં નથી. (૨) ધર્મશાળાથી થોડે છેટે રેલની પેદી આણુ દાદા વાડીમાં એક શિખરઅંધી નાનું દહેરાસર છે, જેમાં દાદાજીના પગલાં છે.

સીટીની મારવાડીની ધર્મશાળાથી “ ગુલાર બાગ ” તું દહેરાસર કંગમાં એ માચલી થાય છે. એટે ગુલારાયાગ સ્ટેશનની નજીવીકર છે. એટમ ભલે છે. વીગત:-

( ૧ ) રેલની આ બાજુએ એવે સ્ટેશન તરફ એક દીગમ્બરતું દહેરાસર છે. ( ૨ ) રેલની સામેની બાજુએ એક દહેરાસર છે જેમાં થુલીભરજી તથા ચુદર્ણન શેડના ચર્ચો છે અહીંચા કહેવાય છે કે કોઈ ગુનલાને લીધે સુદર્ણન શેડને સુધીએ ચાગવામાં આવ્યા હતા, પરંતુ નવકારમંત્રના પરિયણે, સુડી સિંહાસનના ઇપમાં ફેરવાનું ગાઈ હતી. વકી અહીંચા સુદર્ણન શેડ વેશ્યાના ધરમાં ચોમાસુ કર્યું હતું દહેરાસર નાનું છે, પરંતુ દેખાવ એક સિંહાસન જેવો છે. વકી આજુમાં એક તળાવ છે, જેના ઉપર એટલી બંધી સેવાળ ચઢી ગાઈ છે કે પાણી બીજાબુલ દેખાતું નથી. પટના શહેર અસલ પાટલા-પુરના નામથી મશાહુર હતું. અને કહેવાય છે કે, જે વખતે રાજ્ય કર્તા અશોક રાજ હતા, તે વખતે શહેરનો વેરાવો આર કાશનો હતો, લાલમાં પણ વસ્તીનું પ્રમાણ વધારે છે, પરંતુ મકાન જુની ટ્યુના અને અંડીઓએ થાઈ ગયેલા છે. રસ્તાઓ ધણી જગ્યાએ પઠરના બાંધેલા છે.

તા. ૨૪-૧-૨૧ ને દીવસે અમારમાંથી ૧૨ જાણ “ ગયાણ ” ગયા. ગયાણ જવાને માટે પટના જંકશન ( બાંડીપુરથી ) બ્રેડજેન બાંધી નીકલી છે, તે ડેડ ગયાણ સુધી જાય છે. બાંડીપુરથી ગયાણનું ભાડું રા. ૦-૧૫-૦ થાય છે.

### ગયાણ.

સ્ટેશન મોટું છે અને મેન લાઈનનું જંકશન હોવાથી રીફેશમેન્ટ વીજેરે દરેક રીતનું સ્ટેશન ઉપર સાથન છે. ધર્મશાળા સ્ટેશનની નજીબીકરજ છે. જેમાં લગભગ એક લનાર ઉપર માણસો સમાધ શકે છે, પણ પણીક છે. શહેર મોટું અને છલ્લો હોવાથી, મ્યુનિસીપાલીટીનું કામ ધાણું સારું રહે છે. નગો વીજેરે ડેરેક પણીક રસ્તાઓ ઉપર પણું છે, તેમ આખા શહેરની નીચેના ભાગમાં ગટર રાખી છે. મકાનો મોટા અને દરેક મકાનોની બાંધણી એવી રાખવામાં આવી છે, કે દરેક ધરેમાંથી શહેરને નાણે નીકલી શકાય છે. કોમ ગલીઓના રસ્તા પઠરથી ચણી સેવામાં આવ્યા છે. વસ્તી ધણે ભાગે પંડીઓની છે. શહેર “ ફલયુન ગંગા નહીને ” કીનારે આવેલું છે.

“મહાદેવ” તું જયરાજસ્ત પહોડ સમાન હંચી બાંધણું મંદીર એકદમ કીનારે ઉપર આવેલું છે. સામે કીનારે હુંગર ઉપર સીતા કુંડ છે. તથા તોણી નીચેના મંદીરમાં રામ, લક્ષ્મણ અને સીતાળની મુર્તિ છે.

વહી કહેવાય છે કે કપીલમુનિએ ડાઇએક રાજના સો પુત્રાને મારી નાંખેલા, જેના નિર્વાણ અર્થે અહીંચા આદ્ધ કરવામાં આવ્યું હતું જેને લીધે દૈક મહાદેવ, વિષણુના ભક્તો અહીંચા આગળ આદ્ધ કરાવે છે. મહાદેવનું મંદીર સ્ટેશનથી લગભગ ૧૦ માઠલ છેડું છે. જ્યાં જવા વાસ્તે ગાડી દમરમ વિગેરે મદે છે.

તા. ૨૫-૧-૨૧ ને દીવસે રાતે બારની ગાડીમાં નીકલી તા. ૨૬ ને દીવસે સવારે દશ વાગે “ બનારસ કેન્ટ ” આવી પોંચ્યા. વળી જેણો ગયાજ ગયા હતા તે તા. ૨૫ ને દીવસે રાતે નવની ગાડીમાં પરના આવી પોંચ્યા હતા.

### કાશી ( બનારસ ).

સ્ટેશન એ છે. અનારસ સીટી, અને બનારસ કેન્ટોનમેન્ટ, પટનાથી આવતાં વચ્ચેમાં મોગલસરાઈનું જર્કશન આવે છે. ત્યાંથી જો, એન્ડ આર લાઇનમાં આણું સ્ટેશન બનારસ સીટીનું આવે છે. ધર્મશાળા એ છે. એક અંગ્રેજ ડેહીના નામથી ઓળખાય છે. જેમાં પ્રથમ બેનારસર પાંહશાળા હતી. લાલમાં ફૂકત મુનીમ જ રહે છે. તેમ લાયબ્રેરી પણ છે. અંદર ૧૦૦ માણસો સમાઈ શકે છે. એકદમ બનારમાં છે. ગાડીવાલાને મોયા બનારમાં કહેવાચી લધ જાય છે. બીજી ધર્મશાળા એ માટલ ઉપર જેવિપુરમાં છે. જેમાં પણ લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. ત્યાંથી બનારસ કેન્ટોલ-મેન્ટનું સ્ટેશન નજીદી થાય છે. એ ધર્મશાળાથી શહેર છેડું થાય છે. મારે ધર્યે ભાગે, અંગ્રેજ ડેહીમાં ઉત્તરવું સારું છે. અતે સીધું સામાન તેમ બીજી વસ્તુઓ નજીદી જ મદે છે. શહેરની ગલીઓના રસ્તા પથરથી ચણુંવામાં આવ્યા છે. અને રસ્તાઓ ધણા ભુલભુલામણીના છે. વહી અહીંચા રેશમી

તथા કસળી સાડીઓ, મુગયા, પીતાંશુરી વિગેરે ધણું સારં ભલે છે. તે ઉપરાંત પીતળના નકસીવાકા ફરેક. જનના વાસણો પણ સારા ભલે છે. વહી અહીંચા સોદાને વાસ્તે પરદેશી માણુસો પાછળ દ્વારો કર્યા કરે છે. અને અણુજાણુંચા આદ્ધિતી જરૂર પદ્ધતા શીવાય રહેતા નથી. માટે ખાસ ચેતિને ચાલવાની જરૂર છે. તે ઉપરાંત વેપરીઓ તોલ બેવડું રાખે છે એક (૨) ઇંધીયા ભારનો શેર અને ૮૦ ઇંધીયા ભારનો શેર માટે કોઈપણ માલનો ભાવ ટુરન્યા પહેલાં એ વાતચીત કરવી. પીતળના લોયા વિગેરે વાસણોમાં નીચે લાખ આપે છે, તો તુકશાની માલમ નથી પડતી, માટે એ આખતમાં ચોક્સ સાવચેતી રખવી. લેલુંચુરમાં એક દહેરાસર છે તેની વીગત:-

ધર્મશાળા વર્ચ્યે શ્રીપાર્થનાથજીનું દહેરાસર છે. ત્યા તેમના ચાર કલ્યાણુક (ચવન, જન્મ, દીક્ષા અને કેવળજીન) ના પગલાં છે. બાળુમાં દ્વાદ્શીજાના પગલાંની જુદી દહેરી છે. અનેનો હિસાબ અહીંચાના કારખાનામાં રહે છે અને તેને વાસ્તે એક સુનીમ પણ છે.

થેડે છે લહેરીનીમાં જવું, દહેરાસર એક છે અને તે ગંગા નહીંને કીનારે આવેલું છે. શહેરમાંથી આવવાને માટે રામધારથી હેડીમાં પણ આવી શકાય છે. નાની સરખી ધર્મશાળા પણ દહેરાસરની આણુમાં છે અને દહેરાસરમાં શ્રીસુપાર્થનાથના ચાર કલ્યાણુક (ચવન, જન્મ, દીક્ષા અને કેવળજીન) ના પગલાં છે. ડાંસી બાળુએ ભીજાં નાખો ગમારો છે, ત્યા જમણી બાળુએ ચર્ચાએ છે. દહેરાસરની બાંધણી પત્થરની છે અને પાયો ધણો ભજુનું લીધેલો છે. બાળુ બાળુએ દીગમ્બરોના દહેરાસરો છે. શહેરની અંદર ભીજા દહેરાસરો છે, અને તે ગલીઓમાં છે. પુનરી અગર કોઈ ભોગીચાને લાઠને જરૂરું. વીગત:-

(૧) પાદશાળાના મધ્યાનમાં મેડા ઉપર શ્રીપાર્થનાથનું દહેરાસર છે. નીચે પ્રથમ પાદશાળા હતી પરંતુ હાલ જાત્રાનુંઓ ઉતરે છે. અને ઉત્તરાનું પણ મેડા ઉપર છે. નીચે લાયખેરી ત્યા સુનીમ રહે છે. (૨) કુરી

બળરમાં મેડા ઉપર રાજુ ઉત્તમયંદળનું આહેચર ભગવાનનું દહેરાસર છે. પ્રતીમાણ સામત ધાતુની છે. (૩) સુત તોવામાં શ્રીરીખવહેવળનું દહેરાસર છે. પ્રતીમાણ કસેડીની છે. ત્થા મેડા ઉપર શ્રીમહાવીર સ્વામીનું દહેરાસર છે. (૪) સુત તોવામાં દીપયંદ્રોહનું બંધાનેલું શ્રીગોડીપાર્વતિનાથનું દહેરાસર છે. (૫) નયાધારમાં શ્રીઆહેચરળનું દહેરાસર છે. અને ઉપર શ્રીપાર્વતિનાથનો ગભારો છે. (૬) નયાધારમાં ઉપકા દહેરાસરની જેડે શ્રીશામળીએ પાર્વતિનાથનું ધર દહેરાસર છે અને ઉપર ચોમુખજી ત્થા બાળુમાં શ્રીસુપાર્વતિનાથનો ગભારો છે. (૭) નયાધારમાં રામયંદળ એશવાળનું મેડા ઉપર શ્રીયંતીનાથનું ધર દહેરાસર છે. (૮) નયાધારમાં શ્રીપાર્વતિનાથનું દહેરાસર છે. બાળુમાં શ્રીરીખવહેવળ ત્થા ઉપર શ્રીસુપાર્વતિનાથનો ગભારો છે. (૯) રામધારમાં કુશળયંદળનું બંધાનેલું શ્રીચિંતામણું પાર્વતિનાથનું સૌથી મહેઠું દહેરાસર છે. જમણી બાળુમાં શ્રીસહસ્રાણું પાર્વતિનાથની મહેઠી પ્રતિમાણ છે, તથા જેડે સંપ્રતિ રાજની ભરાવેલી પ્રતિમાએ છે, અને તે ડાખી બાળુએ ગભારામાં છે. નીચે બ્રાંયરામાં શ્રી ગોડી પાર્વતિનાથની તથા ચોતીશ તિર્થિકરની પ્રતિમાએ છે, ઉપર ત્રણ ગભારો છે. અંદરને રસ્તો લુલભુજામણુનો છે. પુનરી શિવાય અથે દર્શન કરવા મુશ્કેલ થઈ પડે છે.

શહેર ગંગા નદીને ઝીનારે આવેલું છે, તેમ હરવા હરવાને બગીચાએ છે. બીજું ખાસ જોવા જેવું અહીંએ કર્દી નથી, પરંતુ વિશ્વનાથનું મંદિર સાધારણું સારું છે, બીજું એક સત્યનારાયણનું પણ મહેઠું મંદિર છે.

### સિંહપુરી અને ચંદ્રાવતી.

કાશીથી સીંહપુરી થાય છે, અને સીંહપુરીથી ચંદ્રાવતી આદ્ય માધવ થાય છે. હેડ સુંધી પાડી સરદે છે, ઘેડાગાડીનું ભાડું માણુસ દીડ શા. પુ લે છે. રસ્તો સીંધો ચંદ્રાવતી જવા ભારે એ કલાકનો છે. પાછા ફરતી વખતે સીંહપુરીના દર્શન કરે છે, ચંદ્રાવતીનું દહેરાસર ગંગાનદીને ઝીનારે આવેલું છે. જ્યાં આગળ ચંદ્રપલુના ચાર કદ્યાણું ( ચ્યવન, જન્મ, દીક્ષા,

કેવળજ્ઞાન) ના પગલાં છે ત્યા અહાર દાદાજુના પગલાં છે, ત્યા શ્રીશાંતિનાથજીનું દહેરાસર છે.

સીંહપુરીમાં એક બાગ ત્યા એક મહોટી ધર્મશાળા છે, અને તેમાં શ્રીચંદ્રપલુનું દહેરાસર છે. અહાર એક પીળું દહેરાસર છે. વીગતઃ—

વચ્ચે ચોકમાં સમવસરણુના ધાટમાં શ્રીશ્રીયાંસનાથના કેવળજ્ઞાનના ચોમુખ પગલાં છે, અને ચારે બાજુઓ ચાર દહેરીઓ છે; (૧) દહેરીમાં શ્રીકુંશલયજી મહારાજની મુર્તિ છે. (૨) ચ્યવન કલ્યાણજીના પગલાં છે. (૩) શ્રીમેરપર્વતની રચનાનો હેખવ છે, (૪) ભગવાનના ચર્ચા છે, તેવીજ રીતે ઉપરના ભાગમાં પણ ચાર દહેરીઓ છે. (૧) ચૈદ સુપતનો હેખવ છે, (૨) દીક્ષા કલ્યાણજીના પગલાં છે, ત્યા દીક્ષા લેતાં પંચમુષ્ટિ લોચ કરે છે તેનો હેખવ છે. (૩) જન્મ કલ્યાણજીના પગલાં છે, (૪) ગુરના ચર્ચા છે. એવી રીતે અત્રે શ્રીશ્રીયાંસનાથ ભગવાનના ચાર કલ્યાણજી ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન થયેલાં છે. અત્રેનો હીસાખ અહીંચાઈ રહે છે અને તેને વાસ્તે એક મુનીમ રાખવામાં આવ્યો છે. ચંદ્રવતીનો હીસાખ લેનુંપુરવાલા રાખે છે.

તા. -૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ત્યા તા. -૧-૨-૨૧, ૨, મહી આડ દીવસ અત્રે રહી તા. ૩ જી એ સુવારે અગીચાર વાજ્યાની ગાડીઓ કાર્ય સ્ટેશનેથી એસી સાંચે ચાર વાગ્યે અયોધ્યા ઉત્તર્યી, કાર્યામાં તા. ૨૭ માં ને દીવસે શા. ડાયાલાઇઝ રીડિંગ્ઝ ડેલાવાવાલા વિગેરે તરફથી ટોણી કરવામાં આવી હતી, તથા તા. ૩૧ માં ને દીવસે શા. મંદુ ભાણુજી અષ્ટગામવાલા વિગેરે તરફથી ટોણી કરવામાં આવી હતી. વાસણ વીગેરેની સવડ પાહશાળાની ધર્મશાળામાં છે. ધણ્ણ જત્રાગુંઘો અર્થેથી અલ્લહુભાઈ પણ જાય છે.

### અલાહ્યાદ (પ્રોશાળામ)

કાર્યાથી અલાહ્યાદ ૧૦૨ માધ્વ થાય છે. વચ્ચમાં મોગવસરાઈ જંકશન ગાવે છે. અલાહ્યાદને શાસ્ત્રમાં પુરમતાલ તીર્થ કહે છે, ખવદેવ

લગવાનને ડેવળજીનાન થયેદું છે. હાલ તીર્થ વિચ્છેદ છે. ત્યાથી વણુ ગાડ છે ટે  
મુડીગંજ (પ્રચાગ) ફેરાસર છે. અવાડાધારી પગ રસ્તે સર્કે ૧૮ ગ.જ  
પોણાગમ છે, ત્યાં જનારે સીધુસામન સાથે રાખી જયુ. પોણા જેન શાખમાં  
ક્રૈસ્ટાની નગરી કહે છે, ત્યાં શ્રીપ્રવાપભુના ચાર કદ્યાણુક (ચ્યાતન, જનમ, દીક્ષા,  
ડેવળજીનાન) થયેદાં છે. હાલ તીર્થ વિચ્છેદ છે. ક્ષેત્ર ફરસના થામ છે.

### (અયોધ્યા) અજેઠા (વિનિતા)

ધર્મશાળા રોશનથી લગભગ ૧૦ માધ્યમ છે. ટમટમ, ડેલા ગાડી વિગેરે  
મદે છે. બીજી ધર્મશાળા દીગમ્બરની છે જેમાં લગભગ ૧૫૦ માણુસો  
સમાધ શકે છે. ક્ષેત્રાંભરી ધર્મશાળામાં પણ લગભગ ૧૦૦ માણુસો સમાધ  
શકે છે. ફેરાસર એક છે અને તે ધર્મશાળામંજ છે. શહેર સર્જુનહીને  
ક્રીનારે છે. ધર્મશાળાથી બજર ૦૦ માધ્યમ થાય છે, અને ધર્મશાળાથી નદી  
૦૦ માધ્યમ થાથ છે.

વળી અયોધ્યા ખાસ કરીને વિષણુનું ધામ છે. અને અતે નાના મેદા  
મલી ૨૦૦૦ વૈષણવ મંદિરા છે જેમાં ખાસ કરી જેવા લાયક (૧) રામજીની  
જનમભૂમી (૨) રામજીનું સ્થાન (૩) રતસરીંહાસન જ્યાં આગળ રામજીની  
ગાડી છે. [૪] કનક ભુવન [૫] હતુમાન ગલીમાં રામજીનું મંદિર. (૬)  
નહીને ક્રીનારે સ્થર્ગદ્વાર વિગેરે છે. વળી અહીંથાં વાંદરાનું જેર અહુ ભારી છે.  
અસ્કલની ફેરાસર પ્રમાણે “રામજીએ” હતુમાનની પદ્ધતિનું અહીંથાં છાડી  
દીધી છે. તે વાત સિદ્ધ થાય છે. વળી અહીંથાનો રાજમહેલ પણ જેવા  
જેવો છે. અહીંથાના ફેરાસરમાં ૨૫ કદ્યાણુકા થયેદાં છે. વળી અતેના  
ફેરાસરમાં નદીના વોલાની સગનડ જને કરવી પડે છે, તેમ પુનના કપડાં  
પણ થોડા રહે છે ફેરાસરની વીગત:—

ફેરાસરમાં પેસતાં માધ્યમાં સમવસરણુની આંધણી લીધી છે. પાછુની-  
ચેના ભાગમાં એક ફેરાસર છે. જેમાં મુગનાયકૃ અણતનાથ લગવાનની  
પ્રનિમા તથા સમવસરણું ઉપરના ફેરાસરમાં સંભવનાથ તથા અભિનંહનની

પ્રતિમાળ છે. તથા એજ ગભારામાં સામે અણતનાથના ડેવલનાનના પગલાં છે. વરી ભમતીમાં ઉપર ચાર ઢેરીઓ છે. જેમાં [ ૧ ] રીખવહેવના દીક્ષા કલ્યાણુકના પગલાં છે. (૨) અભિનંદનના ડેવલનાનના પગલાં છે. [ ૩ ] અનંતનાથના ડેવલનાનના પગલાં છે. [ ૪ ] સુમતિનાથના ડેવલનાનના પગલાં છે. તેજ પ્રમાણે નીચે પણ ભમતીમાં ચાર ઢેરીઓ છે. જેમાં (૧) અણતનાથ, અભિનંદન, સુમતિનાથ, અનંતનાથ, અને રીખવહેવના યાન કલ્યાણુકના પગલાં છે (૨) અણતનાથ, અભિનંદન, સુમતિનાથ, અનતનાથ અને રીખવહેવના જનમ કલ્યાણુકના પગલાં છે. (૩) અણતનાથ, અભિનંદન, સુમતિનાથ, અનંતનાથના દીક્ષા કલ્યાણુકના પગલાં છે. (૪) ગણધર મદારાજ તથા દેવીઓની પ્રતિમાળ છે. તે ઉપરાં ઢેરાસરના ખાડારના ભાગમાં દાટાણના પગલાં છે.

તા. ૪, ૫, ૬ મલી હિન ત્રણ રહી તા. ૭ ને દીવસે ઈજાયાદ થઈ રતનુરી જવાને વાસ્તે સત્તારે ડેવા ગાડીઓ ભાડે કરી નીકલ્યા, વરી હમારા સંઘમાંથી ૬ જણને અયોધ્યા રહેવું પડ્યું હતું, કારણ કે કોલવાચારા શા. ડાહ્યા ગોવીંદજીના ચીરંજીવીની માંદગીને લઈ એટા માણસો જુદા પડ્યા, તેમ ત્રણ માણસો રાજગીરીથી જુદા પડ્યા હતા એવું હતે ૪૨ ગીતારોનો સંધ ચાલતો હતો.

### ઈજાયાદ.

અયોધ્યાથી ઈજાયાદ પ માન્દજિ થાય છે. ઈજાયાદ શહેર મહોકું છે, અને જુદ્દો છે. સ્ટેશન એ છે. એક ઈજાયાદ સીરી અને ઈજાયાદ જંકશન બીજું છે, શહેર બને સ્ટેશનની સરખું થાય છે. ટમટમ વિગેરે સ્ટેશન ઉપર તેમ શહેરમાં સારી રીતે મને છે. વરી પ્રથમ અહીંઓ અંગેજની છાવણી હતી, જેને લઈને પદ્ધતણ પણ રહેતી હતી. હાથમાં ફૂકત મહોયા કંપાડિનુમાં ઝુયા છન્યાયા દોડાઓ. ફર્મા કરે છે. જૈન ઢેરાસર ફૂકત એક છે. મુળનાયકજીની પ્રતિમાળ શાંતિનાથ બગવાનની છે. અહીંઓ ડો ગાડુ માનથી નગરી છે.

હાલ તીર્થ વીચ્છેદ છે. અત્રેથી રતનપુરી (નવરાણી) ૧૧ માઘબ  
થાય છે.

### રતનપુરી (નવરાણી)

ગામ સર્જુન નદીને કીનારે છે, અને અત્રેના લોકો નવરાણી નામથી  
સંપોર્યે છે. અન્નરમાં સાધારણું રીતું સામાન ખેલે છે, દહેરાસર એક છે,  
અને અન્નરમાં ધર્મશાળા છે, તેમાં લગભગ ૫૦ થી ૭૫ માણુસો સમાઈ  
શકે છે. દહેરાસરની વીગત:-

ધર્મશાળાની વચ્ચમાં દહેરાસરતા મંદ્યલાગમાં સમોસરણું આંધણું છે.  
ઉપર મુગનાયકળની પ્રતિમાં થીપાર્થનાથ ભગવાનની છે, અને એને ગભારામાં  
સામે ધમનથસ્વામીના ડેવગતાનાં પગદાં ઓં દરટી ભમતીમાં ચાર દહેરીઓ  
નેમાં (૧) ધર્મનાથસ્વામીના ચ્યબન કલ્યાણકના પગદાં છે, (૨) ધર્મનાથ-  
સ્વામીના જન્મ કલ્યાણકના પગદાં છે. (૩) ધર્મનાથસ્વામીના દીજા કલ્યાણકના  
પગદાં (૪) જૈતમસ્નામી, ગંધર્વમહરાજ અને હાદાળના પગદાં છે. વકી  
નીચે ભમતીમાં એચું એક દહેરાસર વચ્ચમાં છે, નેમાં સંપત્તિ રાજની  
ભરાવેલી એક પ્રતિમાણ છે.

અહીંથી હોટ માખલી ઉપર ઓ. એન્ડ આર. રેફ્લેમાં સોલાયનું  
સ્ટેશન આવે છે, તાં તા. ૮-૨-૨૧. ને દીવસે રાતે નીકલી લખનૌ સનારે  
આડ વાગ્યે પ્રોંગ્યા. અને ઇન્દ્રાદામાં મેળો હોનાથી પેસેન્સર ટ્રેનમાં જગ્યા  
મદ્દી નહીં એટલે શુડસના ઉંઘા ત્રણ રીજર્વ કરાતી રાતની ટ્રેનમાં નેડ્યા  
હતા. સોલાયનથી લખનોનું થઈ કલાક રીક્લિફ બાડું શ. ૧-૧૪-૦  
થાય છે.

### લખનૌ.

સ્ટેશન મણોડું છે. વકી કાનપુર જવા માટે નેરેગેજ લાઈન પણ જાય  
છે. સ્ટેશનથી લગભગ ૩૩ માઘબ છેટે છેલીલાલ વિષણુની ધર્મશાળા છે,  
નેમાં લગભગ ૩૦૦ માણુસો જમાણ શકે છે. વળી ઉપરના ઓરડાઓનું

ભાડું લેવામાં આવે છે. ચૈતામ્યરી ધર્મશાળા એ છે. એક ચોકમાં લખમાંથી જવેરીની ધર્મશાળામાં લગભગ ૫૦ થી ૭૫ માણસો સમાઈ શકે છે. રહેવાનું મેડા ઉપર છે. પણ નાં જનર પણ ઉપરજ છે. માલીક ઉપરજ રહે છે. બીજુ અહીંથી પાંચ માત્રીએ રસ્તે ચુડીવાલા ગવીમાં શેડ હિરાવાલ ચુનીવાલ જવેરીની ધર્મશાળા છે. અને પણ સોઈ સારી છે, અને લગભગ ૫૦ માણસો સમાઈ શકે છે. શહેર મહોદું છે, અને મોટો અનેર હમીનાયાદ ત્થા ચોકનો ગણ્ય છે. તે ઉપરાંત આગ બંગીયા શહેરમાં ધણી વણ્ણી જગ્યાએ જેવામાં આવે છે. અને એક મેડીકલ કેલેજ પણ છે.

અને દહેરાસરે બધા મલી ૧૮ છે, તેમાં પાંચ દાદાવાડીમાં, એક સાહિતગંજમાં, ત્થા ૧૨ દહેરાસરે ચોકમાં થોડે થોડે છે, ચોકમાંથી દાદાવાડી એ માઈલ થાય છે, અને દાદાવાડીથી સાહિતગંજ ૩॥ માઈલ થાય છે, અને સાહિતગંજથી ચોકમાં એ માઈલ અને સીધા હમીનાયાદમાં છેહીલાલની ધર્મશાળામાં જવાને મારે ૩ માઈલ થાય છે. ટમટમાવા ત્રણ પેસેન્જરેરા કે છે. બધા દહેરાસરે દર્શન વાસ્તે પુનરાય અગર ભોગીઓ રાખવો સારે છે. દહેરાસરની વીગતઃ—

દાદાવાડીના દહેરાસરેઃ—(૧) બાળુ શીખરચંહ ચૈહીનું વાસુદ્વલ્ય સ્વામીનું દહેરાસર છે. (૨) રીખવદેવ ભગવાનનું બાળુ શુકાશરાયજીનું બંધાવેલું છે. ઉપર ચૈમુખજી પણ છે. (૩) બગ્ગાચામાના દહેરાસરમાં નીચે દાદાળના પગલાં ત્થા ઉપર મુળનાપકજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. અને બાળુમાં દાદાળના ચર્ણો છે. દહેરાસર ઐમચંહ હીંદ્રચંહ શેડ બંધાવ્યું છે. (૪) શેડ મોતીવાલ તલુકચંહનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું છે. એક બાળુ અદ્વાયદી ગભારામાં પાર્શ્વનાથ ભગવાન અને બીજુ બાળુ રીખવદેવ ભગવાનની પ્રતિમાજી છે. (૫) વચ્છરાજ બાલુનું બંધાવેલું મંદીરરવામીનું દહેરાસર છે બધા દહેરાસરે નજદીક નજદીકમાં છે. વકી એક બીજું શીખરઅધી દહેરાસર છે, નેમાં ફક્ત દાદાળના પગલાં છે. દેક દહેરાસરનો હીસાય અદ્વાયદી રહે છે. સાધારણુ વીજેરેતી ટીપ પુનરાય ભોગીઓ

પાસેજ ૨૩ છે. કુનીમ રહેતો નથી. મુળારીએને પૈસા ઉપયોગતાં અડયણ આવતી હોયતો, બધા દહેરાસરના સાધારણ વિગેરે ખાતાની ઈચ્છા, ચોકમાં મુદીવાકી ગલીમાં શેડ ડીરાલાલ ચુનીલાલની પેટીમાં જઈ મંડાવવી.

સાડાટગંજમાં રધુનાથ પરસાદ ભંડારીજીનું બંધાવેલું એકજ દહેરાસર છે. મુળનાયકજીની પ્રતિમાં સંભવનાથસ્વામીની છે. જહારના ભાગમાં દાદાજીના પગવાં છે.

ચોકના દહેરાસરોની વીગત:- (૧) શાંતિનાથ ભગવાનનું પંચાયતી દહેરાસર મોહરન ટોલામાં આવેલું છે. બાળુના ગભારામાં કુંધુનાથસ્વામીની પ્રતિમાજી છે. નીચે મોંયરામાં મુળનાયકજ મહાવીરસ્વામીની પ્રતિમાજી છે, અને દાદાજીના પગવાં છે. મોંયરાનું દહેરાસર અવાયવું ગણ્ય છે. અચે ઉપરના ભાગમાં રતનની પણ પ્રતિમાજી છે. (૨) સુવર્ણચંદ્ર ભંડારીજીનું બંધાવેલું રીખવહેવ ભગવાનનું દહેરાસર છે. મેડા ઉપર મુળનાયકજ મુનાસુવત સ્વામીની પ્રતિમાજી અને એક બાળુએ પદમપ્રભુ તથા બીજી બાળુએ શૈમુખજીની પ્રતિમાજી છે. એ દહેરાસર ઉપકા દહેરાસરની બાળુમાં છે. (૩) કુલવાકી ગલીમાં મુળનાયકજ સંભવનાથ તથા અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. અદ્દર રતનની અને પતાની પણ પ્રતિમાજી છે. (૪) સુંદી તોલામાં મુળનાયકજ પાર્વતિનાથ ભગવાનની પ્રતિમાજી પંચ ધાતુની છે. (૫) ઉપકા દહેરાસરથી યોડે છેટે સુંદીનેલોલામાં મુળનાયકજ પદમપ્રભુનું દહેરાસર છે. ડાખી બાળુએ અજીતનાથ અને જમણી બાળુએ રીખવહેવ ભગવાનની પ્રતિમાજી છે, મેડા ઉપર મુળનાયકજ પાર્વતિનાથસ્વામી તથા ડાખી બાળુએ ગભારામાં શૈમુખજી અને જમણી બાળુના ગભારામાં મહાવીર સ્વામીની પ્રતિમાજી છે. ડાખી બાળુના ગભારામાં દાદાજીના તથા ચોવીશ ભગવાનના અર્ણો પણ છે. (૬) ઉપકા દહેરાસરની બાળુમાં રીખવહેવ સ્વામીનું દહેરાસર છે. (૭) યોડે છેટે સુંદી તોલામાં મહાવીરસ્વામીનું તથા દહેરાસર છે. ડાખી બાળુના ગભારામાં સુમારીનાથ જમણી બાળુમાં સંખેશર પાર્વતિનાથની પ્રતિમાજી છે. ઉપર પણ પાર્વતિનાથ

સ્વામીના દર્શન છે. (૮) ઉપકા દહેરાસરની આજુનાં અયંસનાથ સ્વામીનું દહેરાસર છે. (૯) ચિંતામણીંપાર્વતિનાથનું દહેરાસર છે, અને જેણ ગભરામાં રનની પણ પ્રતિમાળ છે, બીજા ગભરામાં ચૈમુખય ત્થા મહાતીરસ્વામીની પ્રતિમાળ ત્થા સામે શાંતિનાથ અને આજુનામાં પાર્વતિનાથ ભગવાનની પ્રતિમાળ છે. (૧૦) ઉપકા દહેરાસરની આજુનાં શ્રીપાર્વતિનાથ ભગવાનનું દહેરાસર છે. એક આજુના ગભરામાં શ્રીશાંતિનાથ ત્થા એક આજુનામાં શ્રીરીખવહેવ સ્વામીની પ્રતિમાળ છે, ત્થા સામે દાદાળના ચર્ચાં છે. (૧૧) ચુડીવાલી ગલીમાં હીરાલાલ ચુનીલાલની ધર્મશાળા ત્થા આહેથર ભગવાનનું ધર દહેરાસર છે. (૧૨) ચોડમાં પોઢરન તેલા ગલીમાં માણેદયંદ આખું બંધાવેનું મુનિસુવતસ્વામીનું ધર દહેરાસર છે.

તા, એ નો દીવસ અચે રહી તા. ૧૦ ને દીવસે સાંજરે પાંચની ગાડીમાં નીકલી સાડાસાત વાગે કાનપુર આવી પહોંચ્યા. શહેરમાં હમીનાઓદમાં પણ એક ગીકોઈ ઓશીસ છે. આપો દીવસ ઝુલ્લી રહે છે.

### કાનપુર.

સ્ટેશન મંદોડું છે, અને એકાં છે. પરંતુ પાંચ રેલવેનું જંકશા । છે (૧) એ. એન્ડ આર. (૨) બી. બી. એન્ડ સી. આઈ. (નાની લાઈન) (૩) ધ. ધ. રેલ્વે, (૪) લ. આઈ. પી. રેલ્વે, (૫) લિ. એન્ડ ડાલ્ફુ આર. દરેક રેલવેમાં જવાની રીક્ષિટો એક જગ્યાએથી થાય છે. ઓશીસે જુદી છે, અને દરેકના દ્વેદી ફોર્મ જુદા છે. થર્ડ કલાસની રીક્ષિટ મુસાફર ઘાનામાં થાય છે. સ્ટેશન ઉપર બોડાગાડી ટમટમ વિગેરેનું સ્ટેન્ડ છે. પણ રાતના વખતે ધારી થોડી ગાડીઓ મલે છે. શહેરની અંદર વસ્તી પણ સારી છે, તેમ ટેરેન ધ્વેષ્કટ્રી સીટીની લાઈટ છે, અને પમ્પલીક રસ્તા ઉપર ટામે પણ છે. વેપારનું મથક છે, ખાસ કરીને અનાજનો વેપાર ધંદો સારો ચાલે છે. અને ગરમ કપડાની મીલો પણ છે. ધાર્યા, રગ, વિગેરે સાર્દ મને છે.

ધર્મશાળા શૈતાભ્યરી એક છે અને તે પસરી મોહલ્લામાં બાધું સતોકયંદ્ના દહેરાસરની બાળુમાં છે, જેમાં લગભગ ૫૦ માણુસો સમાન શકે છે. વાસણું વીજોને સ્વાધ્યારણ મદે છે. ચાચી મુન્દરીં પાસે રહે છે. હારાની સોછ ધણી સરી છે, નોંધો આપો દીવસ મુલ્લા રહે છે. ખીજુ ધર્મશાળા ત્યાંથી યોડે છે એ પીળા ડેહીમાં મારવાડી અનંતરામે વિષણુની છે. જેમાં અહીંસોથી ત્રણુસો માણુસો સમાધ શકે છે, ખીજુ ધર્મશાળા બાળુમાં દીગમ્ભરની પણ છે.

બાધું સતોકયંદ્નનું બંધાવેણું શૈતાભ્યરી દહેરાસર એક છે. તહેણ કાચનું વૈદુક સમાન બાંધણીનું ચાંખને અંનવે એવું ઉત્તમ બાંધણીનું છે, અહાર ચોકનો દેખાવ પણ તેવોનું છે, દહેરાસર અંદરના હાડી, જુમરો તથા અહાર ચોકના જાઉપાન તથા કુવારા છઢેકટીસીટીથી શાણગારવામાં આવે છે. ચોકમાં મુતાળોનો પણ સંચારસ્થાન સારો કાંચો છે. દહેરાસરાંજુમાં મુળનાયકજીની પ્રતિમાળ ધર્મનાથસ્વામીની છે. બાળુમાં નીચે સૌદાસનમાં સુપાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાળ છે. ગભારાની અહાર જરમણી બાળુના જોખમાં માતા ચકેશ્વરી અને જગહંઝાની મુર્તિ છે, તથા ડાખી બાળું માનભદ્રજીનો જોખ છે, મંડપની પાછળ બેચુણો જોખદો છે, વળી ડાખી બાળુના પ્રાણુમાં એક કાચના જોખવામાં શિખરણ પણાડુની રચના કાંદીલી છે. અને મુળા જીયકળનાં બાળુના ગભારામાં દાહાળના પગદાં છે.

તા. ૧૧, ૧૨, ૧૩, મહી ત્રણ દીવસ અમે રહી ના. ૧૪ ને દીવસે આ. બી. એન્ડ સી. આધ. (નેરેગેજ) રેન્નેમાં રાત્રિ સાઠાસાતની ગાડીમાં પહોંચી ના. ૧૫ ને દીવસે સાડા અગ્નાર વાગે ભયુરા ડેન્ટોલેન્ટ સ્ટેશને હર્થ. તા. ૧૨માને દીવસે બાધું સતોકયંદ્નના દહેરાસરમાં મુલ્લા તથા ગાનવાદા શા. અમીચંદ લગવાનણ તરફથી સંચ કરવામાં આવ્યો હતો,

### કાચભગંજ તથા કપીલાપુરી.

કાચભગંજ સ્ટેશન થથ કપીલાપુરી જ્યાં મારે કાનપુરથી આર એમ. લાઘનવાળા અનવારગંજ સ્ટેશનની એમનું પડે છે. કાચભગંજથી

કંપીલાપુરીનો છ માધ્યલનોં રસ્તો થાય છે. સ્ટેશનથી ગામ ૧ માધ્યલ થાયછે. કંપીલાપુરી જવા માટે ગાડીઓ ઉઠની ગાડીઓ વિગેરે મલે છે. કંપીલાપુરીમાં ૧૦૦ માણુસ સમાઈ શકે એવડી ધર્મશાળા છે. અંદર શ્રી વીમળનાથ ભગવાનનું દહેરાસર છે, ગભારાસમે શ્રી વીમળનાથ ભગવાનના કેવળજ્ઞાનના પગલાં છે. તેમજ ચારે બાળુ ચાર દહેરીઓમાં (૧) ચ્યવન કલ્યાણુક (૨) દીક્ષા કલ્યાણુક, (૩). જન્મ કલ્યાણુક, (૪) ગણુધરના પગલાં છે. અહીંથી દીગમ્બરના મંહિરો ધણ્ણ છે. અને જોઈતો સામાન મલે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતે શ્રી વીમળનાથ ભગવાનના ચાર કલ્યાણુક ( ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ) થયેલાં છે.

કાયમગંજથી શીકોહાભાઈ જવાને માટે ફરકાભાઈ જંકશન ઉતરી મસ્ટ ઘનીયા રેલ્વેમાંથી જધુ શકાય છે.

### શીકોહાભાઈ તથા સોરીપુરી.

શીકોહાભાઈમાં સ્ટેશનની સામેજ ધર્મશાળા છે, જ્યાં આગળ ભાડું આપવું પડે છે. ત્યાંથી ગામ એક માધ્યલ થાય છે. ત્યાં જોઈતી ચીને મળે છે. સ્ટેશનથી સોરીપુરી બાર માધ્યલ થાય છે. વોડાગાડીઓ મલે છે. ત્યાંના દહેરાસરમાં શ્રી નેમનાથ ભગવાનનાં ચ્યવન અને કલ્યાણુકનાં પગલાં છે તથા નીચે એક અયુજ પ્રતિમાળ છે. જેઠે પુરાણું મંહિર તથા ધર્મશાળા છે.

### મથુરા.

હેઠો સંખળા કંપીલાપુરી તથા સોરીપુરી ન જતાં સીધા મથુરા આવ્યા હતા, અતે સ્ટેશન એ છે. મથુરા કેન્ટોલમેન્ટ, અને મથુરા જંકશન, શહેર કેન્ટોલમેન્ટથી લગભગ એક માધ્યલ થાય છે, અને જંકશનથી એ માધ્યલ થાય છે. શેતામ્યરી દહેરાસર એક છે. ધર્મશાળા ( શેતામ્યરી ) એવિલકુલ નથી. દીગમ્બરી ધર્મશાળા છે, અને તે દહેરાસરની પાસેજ છે. વળી વિષણુની ધર્મશાળા ધણી છે. નયા અજારમાં કલકત્તાવાલા બાયુની ધર્મશાળા છે, જેમાં ૧૦૦ માણુસો સમાઈ શકે છે. અતે છાયલ વિગેરે કૃપદાં સારાં મલે

જે. વહી વાંદરાનું જેર પુષ્પલ છે. દહેરાસર ગોડી પાર્વતાથતું છે, અને તે ભસળદી સામે ગલીમાં ધીઆમંડીમાં છે. અતેના ગાડીકલા બાહુ લુચ્યા હોય છે, કોડાથી પણ સાવચેતી રાખવાની જરૂર પડે છે.

### વૃંદાવન.

મધુરાથી વૃંદાવન ૬ માછલ થાય છે. .જી. આઈ. પી. લાઈનમાં સ્ટેશન પણ છે, જ્યાંથી ગામ વા માછલ થાય છે. શહેર સાધારણ મહોદું છે. અન્નર પણ છે. વિષણુના દહેરાસરો ધણા છે. પરંતુ જેવા જેવાં ફૂકત પણ્ય છે. મોહું મંદીર લક્ષ્મીચંહ શોહદું છે, જેમાં એક મહોટા કુંડ છે. વહી મંદીરના ચોકમાં વર્ષ્યે સાડા બાર મણુ સોનાનો થંલ છે. વહી સવારીની ઘીળ વસ્તુઓ, જેવીકે, પાદભી, સીંહાસન, ગરૂડાસન, મધુરાસન વિગેરે ખંડી વસ્તુઓ સાડાબાર મણુ સોનાથી મટેલી છે. દરવાજે એકદા ધંટનો બાધ્યદો છે. વહી અહીંથા આગળ એક ભજનાશ્રમ છે. જેમાં હજનો ગરીબ શુદ્ધ બાધાં, લુલાં લંગડા વિગેરે આપો હિન ભજન કરે છે, અને દરેકને બોજન પણ આપવામાં આવે છે. વહી લખનૌવાલા બીહારીલાલ અગરવાલાનું મંદીર પણ જેવા લાયક છે. તે ઉપરાંત કુંભગલીમાં પણ મંદીર છે, જ્યાં આગળ કૃષ્ણ ભગવાન જોપીયોના ચિર લધ ઝાડ ઉપર ચડી ગયા હતા, વળી જમતા નહીંદું તેરી જળ મણીધરને વશ કરી અમૃત સામાન અનાંદું હતું, વિગેરે દરેક પુરાણા દૃતિહાસ સારીત થાય છે; રાસમંડપ, શૈપતનાગની મુર્તિ, મુરાણું ઝાડ, વિગેરે દરેક વસ્તુ હ્યાત છે.

તા. ૧૫, ૧૬ મહી એ હિસ્સ અતે રહી તા. ૧૭ મી ને હિસ્સે મધુરા કુશન સ્ટેશનથી જી. આઈ. પી. રેલ્વેમાં અપોરે હોઢ વાગે ઐસી સાંજે હત વાગે હીલ્હી જંકશન ઉત્ત્યો. જી. આઈ. પી. રેલ્વેમાં દેક મુંખધીયી ઉપડેલી ગોડી (પંજાબ મેલ) આવે છે. વહી અતે વાંદરાનું જેર પુષ્પળ હોય છે. જાણ્યા આદમીઓ બાહુ સાવચેતી રહેવાની જરૂર છે.

## હીલદી.

હીલદીનાં સ્ટેશન એ છોટાસહર દીલદી, અને દીલદી જંકશન દીલદી જંકશનનું સ્ટેશન મુહેઠું છે, તેમ પ્રેયરેઝર્વ પણ ધણા છે. શહેરની આંહર ડામ, ગાડી વોડા વિગેર ટુરે ટેર કરતા રહે છે. મેટો બજર ચાંદની ચોકનો કઢેવાય છે, મકાનો સાધ રણ નીચા, ખણ ડોતરકામમાં ધણા સારા છે. વહી જેવા લાયકમાં પ્રથમ લાલ કીલ્ડો જ્યાં આગળ અસર સુસદ્વામાન આદ્ધારનું સંક્રયતાભત હતું. હાલ ગવર્નર્મેન્ટને હસ્તક છે. વહી તેની આંહર અસરની મભારતો, જુની જાહી, સુસ્તીયામ, લડાઈના સામાનનું મુશ્કીયામ નેમાં હથીયાર અપ્સરા વિગેર છે. તે ઉપરાંત જુમા મરીફ પણ જેવા લાયક છે. વહી અહીંથી અગ્રીઆર માધ્યમ ઉપર કૃતયુદીન આદ્ધાર વખતનો કૃતુષ્યમનાર છે, જેની ઉચ્ચાં લગભગ ૩૦૦ ક્રીટી છે. ઉપર પણ જઈ શકાય છે પૃથ્વીરોજ ઈર્દુંખાણુના વખતનો લોદ્દુંથંબ પણ હોયાત છે. વહી નવી દીલદી ને લાલ ગવર્નર્મેન્ટ બાંધાવે છે, તેના મકાનો પણ જેવા નેવા છે. બાંધણી એવી રીતની લીધી છે કે મકાનની નીચેના ભાગમાં ત્રણ માળ અને જમીન ઉપર એ માળ. ચેતાંસ્પરી ધર્મશાળા એક છે અને તે ચેતાંપુરી ગલીમાં આવેલી છે, નેમાં લગભગ ૫૦ માણુસો સમાઈ શકે છે. તે શિવાય પીજ એક દીગાંસરી ધર્મશાળા “શેહકા ફુલ્યા” નામની ગલીમાં છે, નેમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ માણુસો સમાઈ શકે છે. વાગણ જોડાં વિગેરનું સાધન મળતું નથી. એણું એક ધર્મશાળા સ્ટેશન ઉપર અગ્રીયાની પછવાડે લાલા છુનામખની છે, નેમાં પણ લગભગ ૩૦૦ થી ૪૦૦ માણુસો સમાઈ શકે છે. શહેરમાં દીગાંસરની વસ્તી લગભગ ૧૫૦૦ ધરેની છે, જ્યારે ચેતાંસ્પરતી ફક્ત ૫૦ ધરેની છે.

ફલેરાસર અધ્યા મહી પાંચ છે, નેમાં ત્રણ શીખરાયાંથી અને એ ઘર ફલેરાસર વીગતઃ—(૧) કાનારી અન્નર નોંધરા ગરીમાં સુમતીનાથસ્વામીનું ફલેરાસર પંચાયત તરફથી અંધાવવામાં આવ્યું છે. જ્વમણી આજુના ગમારામાં વાસુપુન્યસ્વામી અને ડાયી આજુના ગમારામાં શાંતિનાથ ત્થા મંડપની આગળી

એક જુદા ગ્રબારામાં પાર્થનાથ ભગવાનની પ્રતિમાળ છે. વહી મંડપ આગળ એક ગોખલામાં રલની ૧૨ પ્રતિમાઓ છે. મેડા ઉપર ચૈમુખલ ત્થા દાદા-જીના પગલાં છે. અને નહાવાની પણ સવડ છે. અનેતો કારલાંડ બાયુ હિરલાલ સોહનલાલ ચંહાનીચોકવાલા રાખે છે. (૨) ચેલપુરી. ગલીમાં રોક હળવીમલના મફાનમાં શ્રીપાર્થનાથ ભગવાનના ધર દહેરાસરમાં રલની પ્રતિમાળ છે, અને તેની સામે બીજી ઓરીમાં રલની, પાનાની, ત્થા ડસોઈની પ્રતિમાઓ છે. (૩) ચેલપુરી ગલીમાં સંભવનાથસ્વામીનું દહેરાસર છે. જમણી બાળુના ગ્રબારામાં મહાવીરસ્વામી ત્થા ડાખી બાળુના ગ્રબારામાં રીખ્વહેવ-સ્વામીની પ્રતિમાળ છે. વહી એજનાથ બાયુને બંધાવેલો એક ગોખલો છે, નેમાં દાદાલાના પગલાં છે, ત્થા આજુ બાળુએ એમની તરણીર છે. દહેરાસરની અંદર સેનેરી ચીતરકામ વિગેરે ધાણું સાંદ કર્યું છે. (૪) ચીરાખના ગલીમાં શ્રીપાર્થનાથ ભગવાનનું દહેરાસર છે. એ દહેરાસરનું કામ પણ ધાણું ઉત્તમ અને રણાચામણું લાગે છે. (૫) એનારકી ગલીમાં બાયુ કનુમાઈના મફાનમાં મેડા ઉપર ધર દહેરાસર છે.

તા. ૧૭, ૧૮, ૧૯ મહી હીન ત્રણ અને રહી તા. ૨૦ મીની રાને મેસી તા. ૨૧, મી એ સવારે આડ વાગે આચા (રાન્નમંડી સ્ટેશને) ઉત્તર્ય. દિલ્હીથી નવ કલાકનો રસ્તો છે. વહી અને કુતુમભીનાર જવા માટે મોટરે મંતે છે. અનેથી ૪૧ માઘ મીરત સ્ટેશને થધ દસ્તીનાપુર જતું.

### હસ્તીનાપુર. (ગજપુર)

મીરત સ્ટેશનથી ૩૩ માઘલ દુર ૨૫૦ માણસો સમાઈ શકે એવી ધર્મશાળા છે. અને દીગમ્બરી દહેરાસરો છે, અને ત્યાં ૩૩ માઘલ દુર ધારણી હોવાથી ગામમાં જોઈતો સોમાન ભાગે છે. અનેથી હસ્તીનાપુરી જધ શકાય છે. માઘલ ૧૭ થાય છે. ગાઠ, મોટર વિગેરે મંતે છે. રસ્તામાં બડ-નીયાણા કરી ગામ અને છે. દસ્તીનાપુરમાં ૨૦૦ માણસો સમાઈ શકે તેવાં ધર્મશાળા વચ્ચે શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. તેમાં સંપતી રાન્નની ભરાવેલી શ્રીમંહીરસ્વામી અને શ્રીઅભીનંદન ભગવાનની પ્રતિમાઓ ત્થા જમણી

બાળુના ગભારામાં શ્રીકૃંચુનાથ અને ડાખી બાળુના ગભારામાં શ્રીઅરનાથ તેમજ આળુઆળુ પગલાં છે. ધર્મશાળામાં ચાર ખુણે ચાર દહેરીઓ છે. (૧) શ્રીમહાનીરસ્વામી, શ્રીશાંતિનાથ, શ્રીકૃંચુનાથ અને શ્રીઅરનાથનાં ચરણ છે. (૨) શ્રીશાંતિનાથનાં ચાર કલ્યાણુક (ચ્યવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન) ના પગલાં છે. (૩) શ્રીઅરનાથના ચાર કલ્યાણુક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન) ના પગલાં છે.

### ચાગ્રા.

અમો દીલહિથી હસ્તીનાપુરન જતા આચા આવ્યા હતા. અનેના રટેશન ચાર છે. એક ખી. ખી. એન્ડ સી. આઈ. રેલવેનું અને વણુ જી. આઇ. ખી. રેલવેના દીલહિથી આવતી વખતે રાજમંડી સ્ટેશને ઉત્તરથું. સામેજ શે. ઉત્તમચંદ્ર ભરોસાલાકાની ધર્મશાળા છે. નેમાં ૧૫૦ માણુસો સમાઈ શકે છે. તેમ અંદર લાયથેરી અને પાડશાળા પણ ચાલે છે. શહેર અહીંથાથી એ માછલ હુર થાય છે. શહેરની અંદર મોટી કટલાં ૧૦૦ માણુસો સમાઈ શકે એવડી ધર્મશાળા છે. વસ્તીમાં હજાર ઘરો દીગમ્બરના છે, જ્યારે ફૂકુલ ૫૦ ઘરો શૈતામ્બરના છે, મોટો બજાર કીનારી બજાર કહેવાય છે. અહીંની સેતરથી વખણ્યાય છે. નેવા લાયક અહીંથાથી એ માછલ ઉપર તાજમહેલાં થા નૌરોજા ઘણી ઉત્તમ કોરણીચાલા મકાનો બનાવ્યા છે. વલી શહીજાન વખતનો આચાનો ઝીલ્લો પણ મોણુદ છે. પાસેજ ખી. ખી. એન્ડ સાઈન્સ અંડ રટેશન આચા ફોર્ટ આવી રહેણું છે. શૈતામ્બરી દહેરાસરો ચા ૮ છે. વીગત:-

રાશન મોહેરલામાં:- (૧) શ્રીચિંતામણ પાર્થનાથના મહોદ્ય દહેરાસર પ્રેસતાં સાંમે ખીને નાનો ગભારો છે. અહાર દીગમ્બરીની. શ્રીપાર્થનાથ પ્રતિમાણ છે. વલી ત્યાં નહાવાની સોછ સારી છે. તેમજ જેડે અપાસરો (૨) શ્રીમહાનીરસ્વામીનું દહેરાસર છે. અંદર પાનાની પ્રતિમા છે. નોન મડીમાં, (૩) બાઇપુનમચંદ ભગવાનદાસનું શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસ

છે. તેમાં ભમતીમાં મોટી પ્રતિમા તથા બાળુમાં ગભારો છે. (૪) દીગભંડીમાં લાભવિજયાલુ રખુંધીર વિજયળનું મેડા ઉપર શ્રીનેમનાથ ભગવાનનું દહેરાસર છે. મોતી કટલામાં—(૫) ચંદ્રપાલ હંસરાજનું શ્રીગોડીપાર્વતીનાથનું દહેરાસર છે, તેમાં જમણી બાળુના ગભારામાં શ્રીમંદીરસ્વામી, ડાખી બાળુના ગભારામાં શ્રીમહાવીરસ્વામી તથા ભમતીમાં પણ પ્રતિમાં અને તેના ઉપર શ્રીઆદેશ્વર ભગવાનની પ્રતિમાં અને તેના ઉપર શ્રીઘરમાં શ્રીઅનંતનાથ ભગવાનની પ્રતિમા છે, લાંધી આખા ગામતો દેખાવ જેવાય છે, (૬) પુનમયંદ ભગવાનીદાસનું શ્રીનાનુપુન્યનું દહેરાસર છે. (૭) ઉપકા દહેરાસરની જોડે શ્રીકેસરીચાળનું દહેરાસર છે. (૮) ગદીમાં અગરલાલ દેવીદાસનું શ્રીસુવિધિનાથનું દહેરાસર છે. (૯) એવગંજમાં શ્રીપાર્વતીનાથનું દહેરાસર છે. ગામથી એ માધવિ છેડે દાદાવાડીના બગીયામાં શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે, તેમાં ભમતીમાં પગવાં તેમજ દહેરાની પાછળ ભોંયરામાં પ્રતિમાં તથા બાગમાં શ્રીહીરવિજયસુરી ભખારાજનાં પગવાં છે.

તા. ૨૧ નો દિવસ અને રહી તા. ૨૨ ને દિવસે ચાર વાગ્યાની ગાડીમાં આચા ફોર્ટના સ્ટેશનથી એસી તા. ૨૨ ને દિવસે રાતે ત્રણ વાગ્યે નેપુરના સ્ટેશને ઉત્તર્યા. રાજમંડીથી આચા ફોર્ટનું સ્ટેશન એ માધ્યલ થાય છે.

### નેપુર.

નેપુર દેશીરાજ છે, તેમ રાજવાનીનું શહેર છે. શહેરેની બાંધણી ધર્યું સારી છે, સ્ટેશનથી શહેર એક માધ્યલ થય છે. ધર્મશાળા શહેરમાં સાંગાનેર દરવાજની પાસે, શેડ નથમલજીની છે, જેમાં લગભગ ૫૦૦ માણુસો સમાઈ શકે છે. અંદર કોઈ કોઈ ઓરીઓનું લાંડુ કેઢે. અંદર પાણીનો હોજ છે. બીજુ શેનામ્યરી ધર્મશાળા ધીવાલાને રસ્તે શ્રીમાળાની છે, જેમાં લગભગ ૫૦ થી ૭૫ માણુસો સમાઈ શકે છે. બજાર સીધો એક લાઈનિમાં છે. તેમ એજ ચોકમાં ફરેક વસ્તુ મદી શકે છે. અને જેવેરીઓની પણ ધર્યી દુદનો છે. ધર્યો ખરો માલ ધૂમીદેશન મને છે. અનેના દહેરાસરની વીગન:-

ધીવાવાકા રસ્તા:- (૧) શ્રીસુમતીનાથ ભગવાનતું દહેરાસર તેમાં જમણી બાળુએ ગભારો છે. ત્થા નહાવાની પણ સોધ મારી છે. (૨) શ્રીસુપાર્વતાનાથ ભગવાનતું મહેદું દહેરાસર છે તેમાં જમણી ત્થા ડાખી બાળુએ એ ગભારો ત્થા અદાર પણ ગભારામાં મેડી પ્રતિમાઓ અને કાઉસગીઓ છે. વહી અત્રે મીનાકારી ડામ ધણું સુરસ કીધેલું છે. અત્રે પણ નહાવાની સોધ છે. (૩) શ્રીપાર્વતાનાથ ભગવાનતું દહેરાસર તેમાં ડાખી બાળુએ ગભારો છે. (૪) શ્રીશ્રીયાસનાથ ભગવાનતું દહેરાસર છે. (૫) શ્રીરીખવહેવ ભગવાનતું દહેરાસર છે, તેમાં જમણી તેમ ડાખી બાળુએ એ ગભારો અને જેડે અપાસરો છે. કુંગલીકા રસ્તા:- (૬) અપાસરાનાં મેડા ઉપર દાઢાળના ચરણ છે. (૭) શ્રીનેમનાથ ભગવાનતું દહેરાસર છે. (૮) શ્રીરીખવહેવ ભગવાનતું દહેરાસર છે, તેમાં જમણી ત્થા ડાખી બાળુએ ગભારો છે. (૯) ચંદ્રાનીકા મોહલ્લામાં આણું હીરાવાલ છગનવાવના ધરમાં ચાંદીના સમેસરણવાળું શ્રીરીખવહેવ ભગવાનતું ચોમુખાવાનું દહેરાસર છે. (૧૦) રોડા રસ્તા ઉપર રોડ ગુલાયચં દાઢાના મઙણનમાં શ્રીઅશ્રતનાથ ભગવાનતું ધર દહેરાસર છે. ધર્મશાળાથી એક માછલ છેટે દાહાવાડીમાં શ્રીપાર્વતાનાથ ભગવાનતું દહેરાસર છે. સામે દાઢાળના પગદાં છે. અત્રે પણ નહાવાની સોધ ધર્ણી સાહી છે. જેપુરથી સાંગાનેર આડ માછલ થાય છે, ત્યાં દરવાજન પાસે શ્રીદ્રઘ્રસુ ભગવાનતું દહેરસર છે, અને તેની જેડે શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે.

“ આમેર ” જેપુરથી સાત માછલ થાય છે. ત્યાં મહેદી પ્રતિમાવાળું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. દહેરાસરની અંદર મીનાકારી ધણું સાંદ્ર ક્રાંતું છે, તેમજ નહાવાની સોધ પણ છે. અત્રે આમેરનો જુનો કીંકરો પાસ અત વવાથી ફૂકત પુરુષેનેજ જેવા હેઠે. અસર જેપુરની જુની રાજધાનીનું શહેર આમેર હતુ. રદેશન ઉપર શ્રીરીખવહેવ ભગવાનતું દહેરાસર છે,

તા. ૨૩ નો દીવસ અત્રે રહી તા. ૨૪ ને દીવસે સાંજે પાંચ વાગ્યાની ગાડીમાં નીકલી તા. ૨૫મીની સવારે ૬ વાગ્યે શીકાનેર પહોંચ્યા. બામારામાંથી ૧૪ ડીકીએ ના માણુએ અત્રેથી અજમેર થધુ ચીનોડ જંકશને

થછ કેસરીઆજ તિર્થ કરી રત્નામ રહી વડોદરા થછ ધર તરફ ગયા. અત્રેથી બીકાનેર જવાને માટે પુલેરા જંકશનથી બીકાનેર જેધપુર લાઇનની અંદર મેરતારેડ ગાડી બદ્લવી પડે છે. બીકાનેરથી પણ જેધપુર આવી લુની જંકશનથી આયુવાલી લાઇનની અંદર મારવાડ જંકશનથી અગમાવાદ સીધું આવી શકાય છે. કેસરીઆજ જવાને માટે બીકાનેરથી મેરતારેડ જંકશનથી પુલેરા થઈ અજમેર આવવું પડે છે, અને અજમેર થછ કેસરીઆજ તીથ જાઈ શકાય છે.

નેપુરની અંદર બીજું જેવા લાયક સાંગાનેરની ધર્મશાળાથી યોડે છે એક અગીયો “રામધાર” ને નામે શોળખાય છે. તે ખાસ જેવા જેવો છે. અંદર દરેક ચીનેતનું મુખીયમ તેમ જીવતા જનવરોનું સંઘર્ષસ્થાન સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. વલી રેઝ સાંજરે રાજી તરફથી ઐન્ડ વગા-ડવામાં આવે છે. બીજું કીલ્દો પણ અતે જેવા જેવો છે. શહેરની દરતો કોટ ખાંધવામાં આવ્યો છે, તેમ હેર્ડેર નજો પણ મુકવામાં આવ્યા છે.

### બીકાનેર

સ્ટેશન સાધારણ મ્હોડું છે. ગાડી દુક્ત એક આવ જ કરે છે. સ્ટેશન ઉપર ડારામાલ ઉપર જગત લેવામાં આવે છે. ધર્મશાળા શેઠ મોતીલાલની સ્ટેશનની સામે છે. જેમાં ચારસો માણસો સમાધ શકે છે. દરેક હિંદુએને વાસ્તે છે. બીજી શ્વંતાંખરી ધર્મશાળા શહેરમાં કોચરાના મોહલ્લામાં રાય બહારુર મહેતા મહેરચંદ્રની છે, જેમાં લગભગ ૫૦ માણસો સમાધ શકે છે. સ્ટેશનથી શહેર એક માછલ છેડું થાય છે. અતે દહેરાસર બધા મલી નાના મોટા સાથે ડપ ગણ્યાય છે. તેમાં મ્હોટાં શીખરથથી આઠ દહેરાસરો છે. બધા દહેરાસરો શહેરમાં નજદીક નજદીકમાં છે. તેમાં ડાચરા મોહલ્લામાં પાંચ દહેરાસરો તથા નાધરાની ગલીમાં ચાર દહેરાસરો તથા દેખાણી મોહલ્લામાં એક દહેરાસર અને કંબારાના ચોકમાં ભાંડાસરજીનું કુંયુનાથજીનું દહેરાસર જરા મ્હોડું છે. અને છેડું પણ છે. પરંતુ પુરાણું દહેરાસર ગણ્યાયછે.

બાળુમાં બીજું શ્રીનેમનાથનું દહેરાસર છે. તે શીવાય બીજા દહેરાસરો નહાના અને ધર દહેરાસરો ગણ્યાય છે. વળી શહેરની અંદર પાણી મોજું છે. તેમ ઇલેક્ટ્રીસિટી ટેલ્લાંક્ષિન વીગેરે પણ શહેરની અંદર છે. બીજું ખાસ જેવા જેવું કંઈ નથી.

તા. ૨૫-૨-૨૧ નો દીવસ અને રહી તા. ૨૬ને દીવસે સાંજની ગાડીએ સાડા છ વગે એસી રાતે ત્રણ વાગ્યે ઇલોધી ( મેટ્રારોડ ) સ્ટેશને ઉત્તર્યા.

### ઇલોધી ( મેટ્રારોડ સ્ટેશન )

નેઘપુર બીકનેર લાઠનમાં એક જંકશન છે. ધર્મશાળા સ્ટેશન ઉપર સુગનકાવ ડાગા બીકનેરવાલાની છે. તેમાં ૫૦ થી ૭૫ માણુસો સમાચ શકે છે. સીધું સામાન બાળુમાં ભલે છે. દહેરાસર એક છે, અને ધર્મશાળાથી ચોડે હુર આવેલું છે. જ્યાં આગળ પણ એક મ્હેટી ધર્મશાળામાં ચારસો માણુસો સમાચ શકે છે. સીધું સામાન અંદરજ ભલે છે. દહેરાસરની અંદર મુળનાયકજ પાર્શ્વનાથની પ્રતિમાળ છે. ગામ નાનું છે અને સ્ટેશનથી એક માછલ થાય છે, તા. ૨૭-૨-૨૧ ને દીવસે બપોરે એ વાગ્યાની ગાડીએ એસી રાતે સાત વગે પુસેરા જંકશને આવી પહોંચ્યા અહીંથી તુરતની બીજી ગાડીમાં એસી અજમેર રહી ચીરોડ થઈ તા. ૨૮ને દીવસે સવારે દશ વાગ્યે ઉહેપુર આવી પહોંચ્યા.

### નેઘપુર.

મેરતારોડ જંકશનથી નેઘપુર ૬૪ માછલ થાય છે. ત્યાં શહેરમાં ધર્મશાળા તથા દહેરાસરા છે. તેમાં કેટલાક દહેરાસરમાં પાનાની તથા રલની પ્રતિમાંએછે. અહીંથી લુની જંકશન થઈ ભીલમોરા થઈ જેસલમેર જવું.

જેસલમેર.

નોંધપુરથી ૨૦ માછલ રેલનો રસ્તો લુની જંકશનનો થાય છે. અને ત્યાંથી ૫૦ માછલ બીલોતરા થઈ ૫૦ માછલ હિંગર ગાડામાં જેસલમેર જવાય છે.. શહેરમાં કોલ્કાતાની અંદર ૮ અને શહેરની બહાર ૩ મળી ૧૧ રમણીય દહેરાસરો છે, તથા શહેરમાં બગીચામાં હાદળનું સ્થાન છે, તેમજ ધર્મશાળા એને પ્રાચીન પુસ્તકોનો મોટો ભંડાર છે. અને તે જમીનની અંદર છે. એવું કહેવાય છે. જેસલમેર જવા માટે રસ્તા માટે બીલોતરાથી જણુસ ભાવ મેવી.

ઉદ્ઘેર.

અમો નોંધપુર જેસલમેર ગયા ન હતા, ચીતોઽથી ઉદ્ઘેર ચુંધી નાની લાઈનનો એક દ્વારા છે, રટેશનથી શહેર દોઢ માછલ છેડું છે. શહેરમાં જવા માટે ટેંગા ગાડા વીજેરે મલે છે. જૈન શૈતાંખરી ધર્મશાળા હાથીપોલમાં છે જેમાં લગભગ ચારસો આણુસો સમાચ શકે છે. વાસણુ ગોડાં વીજેરેની સારી સોધ છે. અહીં એક મુનીમ રહે છે. દહેરાસરો બધા મલી ઊર છે. અને ઘણે ખરે દહેરે નહાવાની સોધ પણ છે. શહેર સાધારણ મહેદું છે. સરફાઈની દુકાનો પણ ધણી છે. વળી અહીંનાં ચલણી સીકકાઓ જુદા હોય છે. અને તે કલદાર ઇવીચાની આની ૧૩ અને આનીનાં દીંગલા ૧૨ કેખે ગણ્યાય છે અજરમા એના ઉપર સટો ચાલે છે તે ઉપરાંત અહીંના રાણુનો કીલો જેવા જેવો છે. એકદમ ઉંચાણુમાં ફરતે ઉંચાત્રણ કોટની મધ્યમાં બાંધવામાં આવ્યો છે. ગામની ફરતે પણ કોઠ બાંધવામાં આવ્યો છે, મહેલની નજીદી એક બગીચો છે, જેની અંદર મુઝીયમ છે. વળી થોડે છેટે એક તલાવ છે જેની વચ્ચમાં છે, બગીચો તેની અંદર પણ મહેલ બાંધવામાં આવ્યો છે. તે જેવા માટે હોડીની અંદર જધ શકાય છે,

ઉદ્ઘેરથી ડેસરીયાળ જવા માટે ટાંગાઓ. તથા ગાડાઓ મલે છે. ભાડાનો દર જત્રાળુંઓ ઉપર આધાર રાખે છે, રસ્તા ઉપર રજી તરફથી ૮

ચોકીઓ બેસાડવામાં આવી છે. તેઓને રસ્તે ચાલતા માણસો તથા ખાલી ગાડુ, ભરેલું ગાડુ તથા ટાંગાની દરેકની ચોકી આપવી પડે છે અને તે અહીંના સીકાઓથી પછસા આપવા પડે છે, ટાંગાની જણુણની તથા ગાડામાં જણુણ પની ચોકી આવતા જતાં હા, જની થાય છે. જત્તાજુઓએ ઉદેપુરથી ત્વાંના સીકા ખરીદી લેવા.

### કેસરીયાળ તીર્થ ( ધુળેવા )

ઉદેપુરથી ધુળેવા જતાં રસ્તામાં દીંડી કરી ગામ આવે છે ત્યાં આગળ ગાડાએ જનાર તથા પગે ચાલનાર મુસાઇરને એક રાત વાસો કરવો પડે છે, કારણું રાતે સાત વાગ્યા પણી અને સવારે ખાંચ વાગ્યા પહેલાં નીકલવા નથી હેતા. ટાંગાઓ ધણે ભાગે એક દીવસમાં જણ શકે છે. દીંડી ગામ નાતું છે પણું સીધું સામાન ભવી શકે છે. ધર્મશાળા સાધારણ જુંપડા નેવી બાંધીલી જગ્યા છે. ઉદેપુરથી કેસરીયાળ ૧૮ ગાડનો રસ્તો થાય છે. અને દીંડીથી ૬ ગાડ રહે છે. કેસરીયાળ જનાર મુસાઇરને રાજ તરફથી હુકમ લેવો પડે છે તેમ ચોકીદારો બીજી ચોકી સુધી સાચે આવે છે, કેસરીયાળમાં વીશાળ ધર્મશાળામાં ૨૦૦૦ માણસો સમાઈ શકે એવી સવડ રાખવામાં આવી છે. દીખ્વદેવ ભગવાનનું પ્રાચીન જગપ્રસિદ્ધ દહેરાસર ધર્મશાળા ની બહારના ભાગમાં છે. અન્યકોંડા પણ કાળીયા ભાવાના નામથી ધણુણ માને છે. દરરોજ કેસર પુષ્કળ ચટે છે અહીંનાં કારખાનાનો વહીવર ઉદેપુર સંધ્ય તરફથી થાય છે, જણસ ભાવ સર્વે મલે છે વળીઅહી જોડીએ તથા પુલવાલા ભાળીઓ ધણુણ રહે છે, અને જત્તાજુઓને વશપદ્ધરના યજાન કરી લે છે, તે લોકો શરકોની માફુક મોટા મોટા ચોપડાઓ રાજે છે, જેમાંથી વડવાએના હસ્તાક્ષરો ભવી આવે છે.

તારીખ ૧-૩-૨૧ ના દીવસે સવારે આડ વાગે ઉદેપુરથી નીકલી ચાર વાગે દીંડીમાં આવી રાત રહી ભીજે દીવસે સવારે દીંડીથી નીકલી સ્તાંજરે તાં ૨-૩-૨૧ ને દીવસે કેસરીયાળ આવી પહોંચ્યા રસ્તો પાડાછે.

પણ કુળ પુષ્ટણ છે. તા. ૩, ૪ મહી દિન એ અતે રહી તા. ૫ ને દીવસે સંબંધે નીકલી તા. ૬ ને દીવસે સાંજરે ચાર વાગે ઉદ્દેશુર આતી પહોંચ્યા. તા. ૭ નો દીવસ ઉદ્દેશુર રહી તા. ૮ ને દીવસે સાંજરે ચારની ગાડીમાં કરડા પાર્થીનાથ જવાને માટે નીરદયા.

### કરડા પાર્થીનાથ.

ઉદ્દેશુરથી પાંચમું સ્ટેશન કરડા પાર્થીનાથનું આવે છે. ભાડુ રૂ. ૦-૧૦-૦ થાય છે. સ્ટેશન નાતું છે પણ જનતાનું વાસ્તે કારખાના તરફથી ગાડું ત્થા એક માણુસ (પોલીસ) સ્ટેશન ઉપર રાખવામાં આવે છે. ધર્મશાળા રેશનથી ૦૦ માંદુલ છેરી થાય છે. જણસ ભાવ મલે છે. સામળીઓ પાર્થીનાથનું દહેરાસર ધર્મશાળાની અંદરજ છે. દહેરાસર પ્રાર્થિન અને મુર્તિ ચમઠારીક કહેવાય છે. ધર્મશાળામાં લગભગ ૩૦૦ માણુસો સંખ્યા થાકે છે. વર્તી બીલકુલ નથી. ગામ છેડું છે.

તા. ૮-૩-૨૧, ને દીવસે રત્ને સાત વાગ્યે અતે આવી પહોંચ્યા. બળી હમારા સંઘમાથી, નેણો અયોધ્યાથી છુટા પડ્યા હતા, તેણો ઉદ્દેશુરમાં ભેણાઈ ગયા હતા. અતેથી મેળો વીખરાય જવાનો હતો. સંઘમાથી યોડો ભાગ એટલે ૧૫ ટીકોડા નેપુરથી છુટી થઈ હતી. તેણોનો મેળાપ પણ ઉદ્દેશુરમાં થયો હતો. પણ એક દીવસ આગળ નીકલી ગયા હતા. બાકી ફૂક્ત દ્વારા શિવાયના માણુસો આને છુટા પડતા હતા છુટા-પડતી વખતે સંઘની અંદર તીર્થી ફરી વખતનો આનંદ સારી આવતો હતો, અને તે ફૂક્ત છુટા પડનારાઓનો અનુભવતો હતો. અતેથી ૬ ટીકોડા શિવાયના માણુસો ચીતોડ થઈ રનકામ રહી વડોદરા થઈ ધર તરફ ગયા, જ્યારે બાકી રહેવા અજમેર રહી આયુ તરફ ગયા. તા. ૯ ને દીવસે ચીતોડ રહેવું પડ્યું કારણ કે તે વખતે અજમેરમાં મુસલમાનોનો મેળો હતો એટલે ગડીમાં જગ્યા મનતી ન હતી,

## ચીતોડગઢ.

પદ્મીક ધર્મશાળા સ્ટેશનથી નણુ મીનીડ નેટલે રહ્યે રહ્યે છે. અંદર લગભગ ૧૦૦ માણસો સમાચિ શકે છે. શહેર નણુ માઈલ દૂર છે. મુરનેવાક્ષ જાખર જરસ કીલ્વાની અંદર નાના સરખા પહાડ ઉપર શહેર વસેલું છે. શહેરમાં દાખલ થવા વારતે પાસ મેળવવી પડે છે. ગાડાઓ ટેઠ પહાડ ઉપર જાઈ શકે છે. દહેરાસર નણુ છે. એક પહાડની ઉપર ત્યા એ નીચેના ભાગમાં, ધીજું જેવા લાયક મીરાંબાઈનું દહેર, તોપખાતું, મીરાંબાઈનું સાત માળનું ઉત્તમ ક્રોતરણીયાનું મકાન, સતી પહીનીનો અંડીત મહેલ, વિગેરે પુરાણી વસ્તુઓ છે. વહી અનેના કુંઝમાં રંગીત માછલાંઓ છે. તા. ૧૦-૩-૨૧, ને દીવસે ખોરાક ચીતોડ આવી પહોંચ્યા. તા. ૧૧ ને દીવસે રાત્રે નીકલી તા. ૧૨ ને દીવસે ખોરાક બાર વાગે અજમેર આવી પહોંચ્યા. એસેન્ઝર ટ્રેનમાં જગ્યા મલી નહીં એટલે ગુડસનો છુંઘો લેવો ખુલ્યો હતો અને તે ગુડસ ટ્રેનમાંજ જોઇન કરવામાં આવ્યો હતો.

## અજમેર.

ધર્મશાળા સ્ટેશનની સમે શેડ શુલાખચંદ હીરાયંહની છે. અંદર ખ્સોથી અઠાસો મણસો સમાચિ શકે છે. સુનીમ પણ રહે છે. વાસણ, જોડાંતી પણ જોગવાઈ છે. અને દહેરાસર એ છે અને એક શેડ મુદીકરણના મકાનમાં ધર દહેરાસર છે, નેમાં રલની પણ પ્રતિમાળ છે. વહી અજમેરમાં બાગ, અદાધ દીનકી કુંપડી, દરગા, તથા રાવ અલાદુર દુળચંદ સોનીનું દહેરાસર દીગમ્બરી છે અને તે ગામને નાકે છે. અનેનો બજાર ધણું મહોટા છે, અને સ્ટેશનથી લગભગ ૩૦ માઈલ છેટે છે.

તા. ૧૨ ને દીવસે રાત્રેની ગાડીમાં એસી તા. ૧૩ને દીવસે આયુરૈદ ખરડી આવી પહોંચ્યા, વહી અજમેરમાં મદારાજ શ્રીનદ્દભવિજ્યજીના દર્શનનો પણ લાભ થયો હતો. અને પંચતીર્થની જન્મા ફરવા વચ્ચમાં રાણીગામ ઉત્તરનું,

### રાણી ગામ

અજમેરથી રાણીગામ ૧૦૦ માઈલ થાય છે, સ્ટેશનથી ગાડે છેટે ૧૨૫  
માણુસો સમાધ શકે તેવડી ધર્મશાળા તથા દહેરાસર છે. પંચનીર્થ ઇવા  
વાસ્તે ગાડોઓ ભલી શકે છે. અહીંથી ગાડે ૧૩ વર્કાણું જવું.

### વર્કાણું.

મેટી ધર્મશાળા તથા મ્હોટા એ દહેરાસરો છે, તેમાં શ્રી વરણાણ  
પાર્શ્વનાથના નામથી જગત પ્રસિદ્ધ દહેરાસર છે, જણુસ ભાવ ભલી શકે છે.  
વળી એ દહેરાસરમાં ૨ શીલાદેખ ધારાપર છે, પણ ઉક્ખતો નથી પેટ વદ  
૧૦ની અને જતા ભરાય છે. અહીંથી ગાડે ૨ નાંદાલ જવું.

### નાંદાલ.

દહેરાસર સાત તથા ધર્મશાળા છે, જણુસ ભાવ ભલ છે. અહીંથી  
રાણી સ્ટેશન આડ માઈલ થાય છે, અહીંથી ગાડે એ નાંદાલ જવું.

### નાંદલાધ.

અહીંથી ગામને છેટે ૧૦૦ માણુસો સમાધ શકે એવડી ધર્મશાળા  
છે. ગામમાં નવ દહેરાસરો તથા ગામની ભાગોગમાં એ છે. અને  
બાળુણે અડ્યા અડ્યા ગાડિના ચાદાવની હુંગરની ટેકરીઓ છે, તેમાં  
એક સિદ્ધિગ્રિણીની અને એક શ્રી ગીરતારણીની ટેકડી કહેવાય છે, તે એ  
ટેકરીઓ ઉપર એ દહેરાસરો છે, તે મળો અડી અગીયાર દહેરાસરો છે,  
જણુસ ભાવ ભલે છે, અહીંથી ગાડે નણ ધાણુરા જવું.

### ધાણુરા.

દહેરાસરો દ્વારા તથા ધર્મશાળા છે, સર્વ ચીજ ભલે છે. વળી અહીંથા  
સુકૃવણી સારી ભલે છે. અહીંથી એ ગાડે ઉપર જણલગમાં હુંગરની સપાઈ

પર જતાં મુખાળા મહાવીરનું દહેરાસર છે, ત્યાં સરસામાન ગામમાં મુક્તી જરૂરીઆત ચીજ તથા મુજારીને સાથે રાખી ચોકી પહેરા સાથે જવું, એવાગાડી જઈ શકે છે.

### મુખાળા મહાવીર

અહીં ધર્મશાળા તથા કુંડ છે સંપત્તિ રાજન્યે બંધાવેલ એ મુખાળા મહાવીર સ્વામીની ચમત્કારી પ્રતિમાળનું ભવ્ય દહેરાસર તીર્થિપ ગણ્યાય છે, રાત રહેવું હોય તો રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે, તેથી હીંસક પ્રાણીનો ભય રહે છે માટે રાત રહેનારે ચોકી પહેરા સહીત રાતે ધર્મશાળા માંજ રહેવું, બહાર નીકળવું નહીં. અહીંથી પાછા ધાર્શારા આવવું અને ધાર્શારથી ગાઉ ત્રણ સાદી જવું.

### સાદી

રાણ્યી ગામથી સાદી આડ ગાઉ થાય છે તેમ અહીંથી ફાલના ઝેશન પણ આડ ગાઉ થાય છે અહીં ચાર દહેરાસરો છે, તથા એ ધર્મશાળા-એંઝે. વલી શ્રીરાણુકપુરતીર્થનો ભંડાર અહીંચાજ રહે છે. કારખાનાની ચેઢી છે, અને જૈનશાળા પણ છે સર્વ ચીજ ભાવ મળે છે. અહીં સરસામાન મુક્તી જેઠતી ચીજ સાથે લઈ કારખાના ભારકૃત ચોકી પહેરો સાથે લઈ ત્રણ ગાઉ પર કુંગરની તકેટીમાં શ્રી રાણુકપુરણ તીર્થ છે ત્યાં જવું, ગાડાં પણ જઈ શકે છે.

### રાણુકપુર તીર્થ.

જગત્કાલમાં મોટા પલાણીની તલાડી ઉપર આ જગત પ્રસિદ્ધ તીર્થ છે. વલી અને મોટી વિશાળ ધર્મશાળા વચ્ચે કુંવો છે, અને તેની જેડે ખીલ નાની ધર્મશાળા છે. વલી તેની જેડે ૧૪૪૪ થાંબલા તથા ૮૪ લોંયરાવાલું ધનાશા પોરવાલનું બંધાવેલું ત્રણ માળ સુધી શરીરિખવદેલ ભગવાનનાં ચોમુખવાળું અતિ વિશાળ દહેરાસર છે. તેમાં ચોકું ડાતરકામ કરેલું છે. ચારે તરફ

ભાગતી છે. યોડા વર્પ ઉપર આડ દશ લેંપરાં સંઘ આવે તારે અને હર-હરેશ એ નાણ લોંયરા ઉધાડવાનો રીવાજ હતો. પરંતુ હાલ યોડા વર્પત થયાં લોંયરા જોલવાથી આશાતનાનો સંભવ ધારવામાં આવ્યાથી લોંયરા ઉધાડવામાં આવતાં નથી. મોટો સંઘ આવે અને ઉધાડવા બંધ કરવાનો ખરચ કરે અને સંઘની અનુમતી મળે તો ઉધાડી શકાય છે. એ દહેરાસર બંધવામાં દંતકથા નવાણું કરેઓ રૂપીઆ ખરચ્યાની છે, અને કેટલીક નવાણું લાખની છે. રાત રહી શકાય છે. અને રાત રહેવું હોય તેમણે સીધું સામાન સાથે લઈ જવું. આહીંથી પાણી સ્વાદી આવી આડ ગાડ રાણી રૂટેશને જવું, અગર ફ્રાલના સ્ટેશને જવું.

એ પ્રમાણે પંચતીર્થની યત્તા રૂપા ગાડની થાય છે, રાણી સ્ટેશનથી પણ જાઈ શકાય છે, તેમ ફ્રાલના સ્ટેશનથી પણ જાઈ શકાય છે. રાણી સ્ટેશનથી ગાડની સવડ સારી મયે છે. વળી આહીંથી પીંડવાડા સ્ટેશને થએ આમનવાડા જવું. ગાડું પણ થાય છે.

### આમનવાડા,

ગામદી અરદો ગાડ ધર્મશાળા અને પ્રાચીન દહેરાસર છે, ચમલકરી ચોવીસમા ભગવાનની વાણુની મર્ત્ઝિ રાતા મહાત્મિરના નામથી પ્રસિદ્ધ છે. દહેરાસરની ભદ્રારની બાળુંને પગવાં છે. ગામમાં ફ્રકત સીધા શીવાય બીજું કંઈ મલતું નથી. દર વર્પ વૈત્રી પુનમ ઉપર મહોટા મેળો ભરાય છે, આપી ભારવાડના શ્રદ્ધાળું લોડો આહીં તીર્થરાજના દર્શન કરવા આવે છે. આ ગામની આસપાસ મહાત્મિરસ્વામી મહારાજને ચાર ઉપરસર્ગ થયેલા હતા એમ કહેવાય છે. ત્યાંથી નજીક પડાડ છે, તેની બાળુંમાં વીકટ રરતો છે, પણ ગાડી જાન શકે છે. ચોક્કા પહેરા સાથે આહીંથી એ ગાડ નાહીઆ ગામ છે ત્યાં જવું.

### નાદીયા.

અગાઉ નંદ્યુર નામે આહીં શહેર હતું, હાલ નાદીયા નાનું ગામનું છે, કંઈ મળી શકતું નથી દહેરાસર નાણ છે. તેમાં વીર ભગવાનના જીવતા

ભરાનેલાં ખીંઅ છે. તે જીવિત સ્વામીના નામની પ્રતિક્રિયા મર્ત્ય છે. ધર્મ-શાળા છે. આ ગામની નજીક નંદન નામે વનમાં ભગવાન કાઉસસગ ધ્યાને રહ્યા હતા, ત્યાં ચંડોશીક નામના નાગે પ્રભુના જમણા પગના અંગુહી ડંખ માર્યો હતો, તેને પ્રતિમોધ પમાઉવાથી તે નિરીપ જેવો થઈ અતે મરણ પામી હેવગતી પામ્યો. તે સ્થાનકે પ્રભુના ચરણની સ્થાપના છે (આ-ઉપસર્ગ ૧ )

વળી આમનવાડા તીર્થની નજીક ભગવાન ધ્યાનદ્રટ થયેલા તે વખતે ગોવાળીઓએ ભગવાનને ન જાણતાં ગાયો સાચબવાતું કહી ગયેલા, ગાયો વગડામાં ચરવા ગાધ, ગોવાળીઓએ આવી જેવું તો ગાયો ત્યાં નહી જેવાથી તેની શૈખ માટે ગયા, પણ પતો લાગ્યો નહીં, ઇચ્છી આવી ભગવાન પાસે જેવું તો ગાયો આવેલી હીઠિ, તેથી રીતે ભરાયા ભગવાન કાઉસસગ ધ્યાને ઉભા હતા, તેમના એ ચરણ વચ્ચે ચુકો સલગાવી, હાંડલી ચઢાવી ખીર શંખી, પરંતુ ભગવાનના પુન્ય પ્રભાવથી એંચાઘ તે ગાયો ત્યાં આવેલી, તે મુર્ખ ગોવાળી-આને સમજવામાં ન આવ્યું (આ ઉપસર્ગ ૨ )

વળી ભગવાન તેથી પણ માત્ર ચલાયમાન થયા નહીં, ત્યારે ગોવાણીએ ભગવાનના એ કાનમાં એક ઓળને સામસામે છેડો એક એવી રીતે ઝીલાએ ઢોકી એસાઉયા (આ ઉપસર્ગ ૩ )

ત્યાર પછી રીધારથ નાગના આવકે મંયાને ખરક વૈઘને જગંગલમાં કાદ જઈ ભગવાનના કાનમાંથી ખીલા તાણી કહડાયા. આ મોટો ઉપસર્ગ ભગવાનનો થયો, તે વખતની ભગવાનની અકર્માત ચીસથી નાદીઓ ગામની પાસેનો દુંગર દ્વારી એ ભાગ થઈ ગયો એમ કહેવાય છે, આ દુંગરના એ ભાગ થયેલા દાદ પણ પ્રત્યક્ષ જણાય છે. (આ ઉપસર્ગ ૪) નાદીઓ ગામથી પાછું આમનવાડા આવવું, ત્યારી આયુરોડ, અરેડી જરૂરું.

આયુરોડ ખરાડી.

સ્ટેશનથી થોડે છેડે બાયુ ઘુઘ્ઘીસીગળ ભીસનચંહળની ધર્મશાળા ૫૦૦ માણુસો સમાઈ રહે એવડી છે. અંદર દહેરાસર છે, તેમ કારખાનામાં એક મુનીમ તથા જમાહાર રહે છે. વાસણુ ગોડા તથા નહાવાની પણ સેઈ સારી છે. સીધુ સામાન વિગેરે જણસ ભાવ નજીફીજ મલે છે. સ્ટેશન ઉપર કારા માલ ઉપર જગત લેવામાં આવે છે. આયુ જવા મારે મોટર તથા ગાડાનો હેડો સ્ટેશન ઉપર છે. મોટરનું ભાડું માણુસ દીડ હા. ૨-૩-૦ થડે કલાસનું અને હા. ૪, સેન્ટર કલાસનું ભાડું લેવામાં આવે છે. ગાડાનું ભાડું જણુ ૪ ના હા. ૫ લે છે. અને એક દીવસે પહોંચાડે છે. ઉપર જવા આરે ભાડાની પાસ લીધા પહેલાં ડાકતર વીજીએ કરે છે. આયુ ઉપર કેમ્પમાં જવા મારે પણ નીચે સ્ટેશન ઉપરથી પાસ મેળવવી પડે છે. વહી ઉપર જતાં પહેલાં માર્ગમાં શારીરાડી દરખાર સાંદ્રે તરફથી મુંડકું માથા દીડ હા. ૧-૩-૬ લેવામાં આવે છે, પણ લોગી સાંધુ, સાંધી, સેવક, બાક્ષુદ, આલણુ, રજપુત, મુસલમાન, ચકર, સીપાઈ, એટલાનું માડું કરે છે. માર્ગની ૧૮ માછાની પાકી સરક છે.

માઉન્ટ આયુ (હેલવાડા.)

આયુરોડ સ્ટેશનથી હેડ ઉપર જવાને મારે પાકી સરક આંવામાં આવી છે. અસલ કહેવાય છે કે એ પદાડ ઉપર જવાના ૫૨ રસ્તાઓ હતા, નેમાં હાલમાં વણ રસ્તે અંગેને સરક બાંધી છે. એ આયુરોડ ખરાડીથી જવાય છે, અને ક્રીઝ સરક ગામ આણુદરથી જવાય છે. આયુરોડ સ્ટેશનથી ઉપર જતી વખતે લગભગ અવધિયે આરણું કરી ગામ આવે છે, જ્યાં આગળ ધર્મશાળા તથા દહેરાસર છે, અને ગાડાની મુસાફરીવાલાને તથા પગે ચાલતા જતાયુંને ભાયુ આપવામાં આવે છે. ઉપર અન્નર કેમ્પમાં છે. કેમ્પથી ડાખે હથે નખી તળાવ છે, જ્યાં આગળ નવ ગામના લેડો પાણી ખીના હતા એવું કહેવાય છે. વળી કેમ્પથી જમણું હાથ તરફથી હેલવાડાના

હણેરાસરો તરફ જવા માટે મોટી પાકી સરૂપ છે, તે રસ્તે જતાં જમણા હાથ તરફ અધ્યાત્મેદીનું સ્થળ છે. હણેરાસરો પાંચ છે. નેમાં સુળનાયકજી આહે. ક્ષર ભગવાનના હણેરાસરની કોરણી એવી છે, કે તેના વખાણું કરવા સુસ્કેલ ધરું પડે. એ હણેરાસર શેડ વીમળશાહનું બંધાવેલું છે, નેમાં અઠાર કરોડ વ્રેપન લાખનો અરચના થયો છે. એ હણેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૦૮૮ ની સાલમાં થઈ છે. કહેવાય છે કે પંદરસો કારોગરો ભલી ત્રણ વરસ્યમાં એ હણેર પુરું કર્યું હતું. મળુરીની ગણુની થઈ નથી. એનું દ્રાંત એમ અતાયું છે કે આરસના પલથર આર ગાડુથી એટસે નીચેથી આવતા હતા, અને દાયો હાથ લીધું ચાલ્યું આવતું એટદા મળુરો રહેતા હતા. શાનેમીશર મહારાજનું હણેરાસર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે. નેમાં કોરણીનું કામ વધારે છે, અને અરચના આર કરોડ વ્રેપન લાખનો થયો છે. અંદર ગમારની અઠારના ભાગમાં હેરણી નેહાણીના એ જોખદા કરાવ્યા છે. નેમાં એક લાખ ને અઠાર હજાર રૂપીઓનો અરચના થયો છે. વળી ભીજ હણેરાસરો પણ સારા અને અથાગ અરચના કરી બંધાવ્યા છે. કારખાનું સુળનાયકજીના હણેરાસરની પાસેજ છે. ધર્મશાળા પણ નજરીંક છે. સીધું સામાન વાસણું જોઈયાં વિગેરે અંદી નેગવાઈ ધણી સારી છે. અનેથી ત્રણ માધ્યમ ઉપર અનુગ્રહ જવું. ગાડા વળી શકે છે.

### અમૃવચ્ચણગાઢ.

રસ્તો પદાડી હેવાને લીધે કારખાના તરફથી હથીઆરવાલા માણસો આવે છે. તાં આગળ ધર્મશાળા પણ છે. આગળ જતાં અચ્છેશ્વર મહાદેવના મંત્રીર પાસે એક તથાન આવે છે. નેતા ઝાનારા ઉપર બેંસાસુર હૃતતા ત્રણ પાડા છે, નેમાંથી અરજુને જગન્ય વખતે એક બાળ માર્યું નેથી એક પાડો ગંગા નહીને ઝાનારે જરૂર પડ્યો છે. વળી અહીંચા પાર્વતીનું વિશુળ ઘડવતાં કોણનો એક કટકો પડ્યો છે, તે ભીમની ગહા તરીકે ઓળખાય છે. વિશુળ મહાદેવના મંત્રીરમાં છે. હણેરાસરજીમાં પ્રતિભ જુસમ ધાતુની મેળવેલી છે. એને વારતે એવું કહેવાય છે કે, કુંભારણાના મરણ પણી તેની એ રાણી

એમે ભવી આપત્તિનો કાળ વીચારી, ખજનામાંતું સધળું દ્રવ્ય ગળાવી સવ ધાતુના બાર બીંબ કરાવ્યા, નેતું વજન ૧૪૪૪ મળું થયું, છેવટે મુળનાય-કળની પ્રતિષ્ઠા ૧૫૩૬ ની સાલમાં થઈ છે. વળી ચા દહેરાસરળમાં પેસતાં એક બાળુ નેમનાથનું તથા બીજું બાળુ શ્રીપાર્વતિનાથ લગવાનતું ભવી એ દહેરાસરે છે. દહેરાસરની અહાર નીકલી જમણા હાથપર ચોમુખળ જતાં ઇપ-વિજયળ મહારાજની છત્રી છે, ત્યાંથી નીચે ઉત્તરતાં જમણા હાથપર એક નતું કરાવેલું નગારખાનનું છે. વળી તેની પાસે શાંતિદાસ શૈકૃતું કરાવેલું શ્રીડ્વિ-ભનાથળ મહારાજનું એક દહેરું છે. ત્યાંથી અહાર નીકલતાં બારણા પાસે હુનુમાનળની ચોકી છે, ત્યાંથી નરી ધર્મશાળાના દરવાજાં અહાર નીકલ્યા પણી જમણે હાથે વાવ પાસે ઉચા માગે જતાં આવણું ભાવરવે નામના તળાવ છે, એને વાંતે દહેરાય છે કે આયુના રાજન ભરણું પામ્યા તે વખતે રાણી-એના રહનાં આંચુંદોથી ભરાયેલાં છે. ઇપવિજયળની છત્રીવાલું દહેરાસર શ્રીસધની મહદ્વી થેવેલું છે. પ્રથમ રાજના એ દીવાન સાસા અને સુલતાન નેંબન ધર્મી હતા, તેમણે એ દહેરું અંધાવનું શરૂ કર્યું પણ અંધાવતાં રાજના ભયથી છોડી ચાલ્યા ગયા, ત્યાર પણી યોડી મુદ્દે ૧૫૬૬ની સાલમાં મુળનાયકળની પ્રતિષ્ઠા કરી સંદે પુરું કર્યું, અને મોટો રંગમંડપ તથા અહારની છત્રી શ્રીડ્વિવિજયળ મહારાજને કરતી છે.

અંત્રથી દેખવાટે જરૂર નીચે અરેડી જવું, મોટર અગર ગાડાની સવડ કારખાના તરફથી કરી આપવામાં આવે છે. દેખવાડાના તીર્થ ઉપર જનતાનું એક દીવસ અગર પાંચ સાત દીવસ રહે તો પણ રતે ચોકીનો જણું એક-નો આનો ઠા લઘુ પણેંચ આપે છે. અરેડીથી અંધારું થઈ કુંભારીચાદુ તીર્થ જવું.

### શ્રી અંધારુ.

અરેડીથી શ્રીઅંધારુ જવા મારે રહ્યો પદ્ધતામાં આવેલો છે; આને સરકાર તરફથી ગાડાએ ત્યા ચોડા નીગેરે વાદળેનો ડેકા આવેલો છે. ગાડાનું લાડું જણું ચારનું ઢા. ૧-૮-૦ તથા ચોડાનું ઢા. ૨-૪-૦ જવાનું થાય છે, તથા

એટદુંજ આવવાનું પડે છે. રસ્તે ચોકીઓ આપવી પડે છે. ખરેડીથી નીકલતાં પહેલી ચોકીએ મરહના હા. ૦-૪-૦ અને ખીના હા. ૦-૨-૦ કે છે. આગળ એ જગ્યાએ ભાંધા દીડ હા, ૦-૧-૦ કે છે. અંખાજી ગામમાં જતાં હાંતાના રાણું તરફથી સુંડકું માણસ દીડ હા. ૧-૧૫-૬ અને આયુષ્ણ જઈ આવ્યા હોય અગર જવાના હોય તો હા. ૦-૬-૮ ખીન તથા ખીના હા, ૦-૧૪-૩ અને આયુષ્ણ જઈ આવ્યા હોય અગર જવાના હોય તો હા, ૦-૬-૯ જુદ્ધ એવી રીતે લેવામાં આવે છે. ચોકી દરેક નણું ત્રણું ગાડુ ઉપર છે, દરેક જગ્યાએ પાણીની નેગવાઈ રાખી છે. એકદર અંખાજી ભાર ગાડુ થાય છે. ખરેડીથી નીકલતાં નણું ગાડુ પર એક નહીં આવે છે, જેના કીનારા ઉપર હોટલ છે. ખીલુ ૬ ગાઉની ચોકી ઉપર હોટલ છે. ધર્મશાળા અંખાજમાં આશરે ૧૫ થી ૨૦ છે. રહેવાની સોઝ ધર્મશાળા સારી છે. સીધું સામાન વિગેરે ભદ્રે છે. અહીંઆથી, કુંભારીઆજ તીર્થ ના માફલ થાય છે.

### કુંભારીઆજ.

દહેરાસરો પાંચ તથા એક ધર્મશાળા છે. વાસણું જોહડાં વિગેરે ભદ્રે છે. એ દહેરાસરો શેડ વીમલશાના બંધાવેલાં છે. ધર્મશાળા રમણીય અને આરસના પથરોની ઉત્તમ ડેરણીવાલા છે. સુગાનાયકળતું દહેરાસર શીનેમીશર મહારાજનું ગણણ્ય છે. અતે નહાવાની સોઝ સારી છે. તેમ કારખાનું પણ છે. એ દહેરાસરો હાલ વગડામાં છે. ખીલુ ડેઝ જલની વરસી નથી. આગળ ત્યાં કુંભલેરનામની નગરી થઈ હતી, જ્યાં આગળ કુંભારણાનું રણ હતું તેથી દહેરાસરો કુંભારીઆજ તીર્થ તરીકે ઓળખાય છે. અહીંથી પાછું અંખાજ આવી ખરેડી આવવું. આવતી વરણે ચોકી તથા સુંડકું કંધ આપવું પડતું નથી.

## હમારી યાત્રાનો અંત.

તા. ૧૩-૩-૨૧. ને દીવસે આયુ ઉપર જઈ તા. ૧૪ ને દીવસે અવગણગણી જતા કરી તા. ૧૫ ને દીવસે ખરેડી આવી પહેંચ્યા. ખીલ દીવસે તા. ૧૬ ને દીવસે અંભાળતું ગાડું ભાડે કરી તા. ૧૭ ને દીવસ તાં રહી કુંભારીચાળના દહેરાસરો દર્શન કરી તા. ૧૮ ને દીવસે ખરેડી આવી પહેંચ્યા. અનેથી એજ દીવસે રહે નીકલી અમદાવાહ સવારે આવી, રહેલો મેળો પણ ખવાસ થઈ ગયો.

પ્રિય વાંચક, શિખરજીની યત્રાએ જવાનો વિચાર, નીકળાતી વખતનો દીવસ, અને તીર્થીએ ઇરતી વખતનો આનંદ, એ સંધાળું સાથે ઇરનારાજ કલ્પી શકે. આહા ! છુટા પડતી વખતે રમત ગમત, મુસાફરી, જતા તેમજ સંધની સેવા અજાવી એ ચીંતાથી સ્નેહઅધનથી છુટા પડતી વખતે કોને ન સાદ્યું હોય ? દેશ દેશના દહેરાસરો, કોકોની રીતભાતો, તાંતા દેખાવો, તથા સંધની મોજ મજલ વિગેર આખતો મારે, અતુલની, પોતાના મીત્રા સ્નેહીઓ તેમજ સગા વહાલાં આગળ ઉદ્ઘગારો કાઢી સતોપ માને તો પ્રિય વાંચકજંદ, તને માદમ તો હશે કે આ હોરંગી હુનીએ પાખડાનો મેળો છે, તેમાં હજારો બદ્દે લાખો જણું આવી, એકાએક ડી જય છે, તો તને પ્રભુએ યથાગોધ્ય ને લક્ષ્મી ભક્તી હોય તેનો સહદેપયોગ કરી એ અનુભવ કેવા ચુકીશ નહીં એવી ભારી નન્દ વિનંતી છે.

## મેસાણા.

અને દહેરાસરો અધા મહી ૨૨ તથા ધર્મશાળા અને જેન પાદશાળા પણ છે. સર્વે ચીજ ભાવ મળે છે. અંધીચાથી ૧ રેલ પારણું તરફ જય છે, ખીલ વીસનગર તારંગાળ જય છે, ત્રીજ અમદાવાહ તરફ અને ચોથી આયુદ મરવાડ તરફ જય છે. સ્ટેશનની સામે વીરાઓ પણ છે. દહેરાસરોની વિગત:-

(૧) સ્ટેશનથી થોડે છેટે શ્રીશાંતિનાથ ભગવાનનું અને (૨) શ્રીપાશ્ચિનાથ ભગવાનનું બાવન જિનાલય દહેરાસર છે. (૩) સંધવી પોલમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને (૪) શ્રીપદ્મપલુ ભગવાનનું, (૫) મોચી વાડામાં શ્રીઆદીશ્વર ભગવાનનું, (૬) મોતી જડીયાની ખડકીમાં શ્રીસંભવનાથ ભગવાનનું, (૭) નેરણિના માઉમાં શ્રીશાંતિનાથ ભગવાનનું, (૮) પીવાપોળમાં શ્રીશાંતિનાથ મહારાજનું, (૯) વૈલાલાઈ કરમચંહની હુવેલી પાસે શ્રીવિમળનાથ ભગવાનનું અને (૧૦) શ્રીસુમતીનાથ ભગવાનનું અને છેલ્લું (૧૧) સરમાળી વાડામાં શ્રીકૃષ્ણનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. અત્રેથી બેરાળું આંસ વાદી ગાડીમાં શ્રીતારંગાજ જવું.

### તારંગાજ.

મેસાણુથી બેરાળુંવાદી રેલે તારંગાજ જવું, ત્યાં સ્ટેશન ઉપર કારખાનાનું માણુસ હજર રહે છે. તે માણુસ સાથે એક માછલ તારંગાજ પર્વત ઉપર ચંદ્રનું પડે છે. એ તીર્થ પદ્માં ઉપર છે. ગાય નાચે છે. ઉપર ધર્મશાળા! તથા કારખાનાનું છે, અતે દહેરાસર નથ છે. ઉપર રાત રહેનું હોય તો રદ્દી શકાય છે. પણ કંઈ જણુસ ભળતી નથી. અતે શ્રીકૃમારપાળ ભૂપાળનો અનાવેલો આતી ઉતુંગ અને અદ્ભુત પ્રાસાદ છે, તેમાં એવા પ્રદારનું કાય વાપરવામાં આવ્યું છે, કે તે અભિ સંયોગે ભળવાને અફે તેમાંથી પાણી છુટે છે. દહેરાસર ધાણુંજ જિયું અને વિશાળ છે, નેમાં ધીજન તીર્થંકર અજીતનાથ ભગવાન ધીરાજે છે. અહીંઆથી મેસાણું જામ વીરમગામ તરફ જતી ગાડીમાં ઘેલડા જવું ત્યાંથી બોયણી જવું.

### બોયણી.

બોયણી જવાના રેલેના એ રસ્તા છે. મુંબઈ, સુરત અને અમદાવાદ તરફના લોડો કલોલ થામ બોયણી સ્ટેશને ઉત્તરે છે, કાહિયાવાડના લોડો વીરમગામ થામ, તેમજ મારવાડ તરફના લોડો મેસાણું થામ ઘેલડા સ્ટેશને ઉત્તરે છે. અને સ્ટેશનથી ગામ લગભગ એ માઘલ થામ છે. એવ ગાડી સ્ટેશન

ઉપર ભાડે ભરે છે, અતે ત્રણ ધર્મશાળા છે, તથા કારખાનાની પેઢીમાથી વાસણુ ગોહડા વિગેરે ભાડે ભરે છે, અત્રેથી પગ રસ્તે એ માઈલ બોયણી રટેશનેથી કદી તરફ જતી ગાડીમાં કલેબ થઈ પાનસર જવાય છે, એવાજણીસમાં તીર્થંકરનું ભવ્ય દહેરાસર મુખ્ય ધર્મશાળા છે, ભલ્લીનાથ મહારાજનો જન્મ દીવસ આવણું સુધ ૧૫ નો છે, તે ઉપર હજારો માણ્યસો આવે છે, તથા મોટા જોચ્છવ થાય છે, કાર્તિક અને ચૈત્રી એ એ પુનર્મોદ્દે મોટા મેળા ભરાય છે, એક લાખ દ્વારીઓ અદ્યી ભવ્ય દહેરાસર બનાવી તેમાં ભલ્લીનાથ મહારાજની મહા સુદ ૨૦ ના શેષ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, અને તે તીર્થી એ પણ એવાચ્છવ દરવ્યામો આવે છે, અને અમહાવાહના શેષ મનુષ્યભાઈ ભગુભાઈ તરફથી તેજ દીવસે વરસગાડ તીમાતે શીસંધને જમાઉવામાં આવે છે, અહીંથી સંભેદ્યર જણું.

### શ્રી સંભેદ્યર.

બોયણીથી સંભેદ્યર ૨૦ ગાડ બેસ ગાડીએ જવાય છે, વચ્ચા હશ ગાડ પર સંભેદ્ય ગામમાં પ્રાચીન દહેરાસર તથા ઉત્તરવાની જગ્યા છે, ત્યાંથી હશ ગાડ સંભેદ્યર જતું, વળી વીરમગામથી પાટડીની ગાડીમાં એસી જુડ રટેશને ઉત્તરવું તાં ગાડા રસ્તે માંડલ થઈ સંભેદ્યર જવાય છે, રસ્તો ખાર ગાડનો થાય છે, અતે વિશાળ ધર્મશાળા છે, તથા દહેરાસરમાં વૈવિસમા ભગવાન પાર્થીનાથની પ્રતિમા છે, તીર્થ સુપ્રસિદ્ધ છે, અતેના કારખાનામાં સર્વે ચીજ મળે છે, કાર્તિક તથા ચૈત્રી પુનર્સે મેટા એ મેળા ભરાય છે, ગાઢ એવાદીના નવમાં તીર્થંકરના વખતમાં અશાહી નામના આવકે આ સંભેદ્યરની પ્રતિમા ભરાવેલી હતી, તે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ કોડમાં પૂજાતાં શીકૃષ્ણ, વાસુદેવ, અને જરાસંધના દાઢું યુધ્ય વખતે, જાહેરાના નિર્બાણાર્થે, અદમ તથ શીકૃષ્ણએ કરવાથી પ્રગટ થઈ હતી, ત્યારથી અહીં પૂજાય છે.

### પાનસર.

અમહાવાહથી મેસાણું લાઈનમાં કલોલ સ્ટેશન મુકી પાનસર સ્ટેશન આવે છે. સ્ટેબનથી પાનસર ગામ ૦॥ માઇલ દૂર છે, અને શ્રીમંતુ ગાયકવાડ સરકારના તાખાતું ગામ છે. અત્રેથી ચોવીસમાં તીર્થંકર મહાવીરસ્વામી, રાવળ જલા તેજના ધરમાં સં. ૧૯૫૬ ના આવણું સુદ્ધ દ ને દીવસે પ્રગટ થયા હતા. દર પુનને ધણું યાત્રાળુંએ દર્શન કરવા આવે છે. ગામની બહાર એક ભવ્ય દહેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. જાતાળુંએ માટે ધર્મશાળા, વાસણું ગોદાં, વિગેરેની કારખાના તરફથી પુરતી સગન્દ છે.

### ઉજાળન.

સુંખથી ભગસીળ જવાને માટે રસ્તો ૧ વો-આનંદ, રતલામ, ઉજાળન, અને ભગસીળ. રસ્તો ૨ જો-ઝુસાવળ-ખાંડવા-કલદાયાદ-ઉજાળન અને ભગસીળ. અને ઉજાળન શહેરમાં સરાકું બજારમાં ધર્મશાળા ત્થા દહેરાસરો બધા મલી ઉર છે. વળી એ તેવીસમાં ભગવાનનું એવંતીલ નામથી પ્રભ્યાત પ્રાચીન તીર્થ છે. શ્રીઆર્થ્ય મહારાજે કલ્યાણું મહિર સ્તોત્રની નવીન રચના કરી જમીનમાંથી સુર્તિ પ્રગટ કરી અદાર રાજને સહીત વિકભાહિત રાજને અમતકાર બતાવી પ્રતિઓધ દ્વારા જૈની કર્યી હતા. સર્વે જાણુસ ભાવ મલે છે. આ શહેરને શાસ્ત્રમાં પ્રાચીન એવંતી નગરી કહે છે. અહીં આર્થી ભગસીળ જવું

### શ્રી ભગશીળ તીર્થ.

ઉજાળનથી ૨૫ માઇલનો રેલનો રસ્તો છે. સ્ટેશનથી ૦॥ ગાડું શહેર છે. સ્ટેશન ઉપર ધર્મશાળા છે, રાને એકલા શહેરમાં જવાની મનાંદ છે, માટે ધર્મશાળામાંથી સીપાઠ સાથે રાખી જવું તેવીસમાં ભગવાન પાર્થીનાથનું ભગશીળ પ્રાચીન અમતકારી તીર્થ છે. ખીજું દહેરાસર ૧ સંવત ૧૯૨૬ નાં ગોડાલ મહારાજ પ્રગટ થેલાં ત્યાં બંધાવેલું છે. ધર્મશાળા ત્થા કારખાતું છે સર્વે જાણુસ ભાવ મલે છે.

શ્રી પંચતીર્થની નગરીઓ.

શ્રીપાવાપુરી પંચતીર્થ:-૧. શુદ્ધિઆળ ૨. પાવાપુરી, ૩. કુંડલપુર,  
૪. બીજાર ( વીસાદા નગરી, ) ૫. રાજગીરી,

શ્રીશીખરજી પંચતીર્થ:-૧. મનેત શાખરજી, ૨. અંપાપુરી, ૩.  
રણવાડકી નગરી, ૪. કાકંદી, ૫. ( લઘવાડ ) ક્ષત્રીકુંડ,

શ્રીરાણકપુર પંચતીર્થ:-૧. રાણકપુર ( સાદડી, ) ૨. ધાર્ઢેરા, ૩.  
નાંદલાઈ, ૪. નાંદલાલ, ૫. વરકાણાળ,

ભણીતા તીર્થનું ભાડું અને બીજું નોંધ.

અમલસરાઠી સુરત થએ જુસાવણી આંડાલા હા. ૫-૨-૦ [ આંડા-  
લાઠી અંતરીક્ષ પાર્શ્વનાથ ( સીરિપુરજી, ) ગાડાનું ભાડું જણ્ય ૫ સામન સાથે  
માછલ ૪૦ હા. ૧૨-૦-૦ ત્થા મોટરનું ભાડું માણસ દીડ માલેગામ સુધી  
હા. ૩-૨-૦ ]

આંડાલાઠી નાગપુર ... ૨-૮-૦ નાગપુરથી ગીરીડી ... ૧૧-૧-૦  
[ ગીરીડીથી મહુવન મોટરનું ભાડું જણ્ય ૧ તું હા. ૨-૦-૦ માછલ ૨૫.  
મહુવનથી દસ્તીના ગાડાનું ભાડું જણ્ય ૪ હા. ૨-૧-૬ માછલ ૧૨ ] ધસરીથી  
કલકતા ... ૩-૨-૦ [ શ્યામાણાધની ગલીથી દાદાવાડીના ફેરસરાધ માછલ  
૩ ] કલકતાથી અણમગંજ ... ૨-૨-૩ [ અણમગંજથી મહીમાપુર થએ  
કણોલા તથા બાનુચર સુધી આવવા જવાનું હોડી ૧ તું ભાડું જણ્ય ૮ તું  
હા. ૨-૪-૦ માછલ ૩ ] [ અણમગંજથી બાનુચર થએ કાસર અણર સુશી-  
દાયાદ આવવા જવાનું ટાંગાનું ભાડું જણ્ય ૫ તું હા. ૫-૦-૦ માછલ ૧૪ ]  
અણમગંજથી બાગલપુર ... ૨-૨-૩ [ બાગલપુરથી નાથનગર થૈધ  
અંપાપુરી જણ્ય ૬ તું ટાંગાનું આવવા જવાનું ભાડું હા. ૨-૦-૦ માછલ ૪ ]  
બાગલપુરથી લખેસરાધ ... ૦-૧૫-૬ [ લખેસરાધથી કાકંદી ૧૨ માછલ,  
કાકંદીથી લઘવાડ ૨૦ માછલ, લઘવાડી લખેસરાધ સીધા ૨૦ માછલ, લખે-

સરાધથી ફોયુલ ૧ માધ્યમ જણ્ય ૫ રેન્જના હા. ૧-૪-૦ ] કીયુલથી નવાડા ... ... ૦-૧૧-૦ [ નવાડાથી શુણુંથાણ ૨ માધ્યમ, ગુણુંથાણથી પાવાપુરી ૨૪ આધિ, પાવાપુરીથી બીહાર આઠ માધ્યમ, બીહારથી કુંલપુર ૬ માધ્યમ, કુંલપુરથી રાજગીરી ૧૦ માધ્યમ, જણ્ય ૫ ગાડાતું બાહું હા. ૮-૨-૦ ] રાજગીરીથી અખતિઆરપુર જણ્યન થઈ પટના સીડી ૧-૧-૦ પટના સીડીથી ગયાણ ... ... ૧-૦-૦ પટના સીડીથી મોગલસરાધ જણ્યન ... ૨-૨-૬ મોગલસરાધથી કારી ( બનારસ હેન્ડોલમેન્ટ ) ... ૦-૨-૬ [ કારી અગ્રણ ફાહિથી બેલુપુર થઈ બહેની આવવા જવાતું ગાડીતું જણ્ય ૬તું બાહુ હા. ૧-૦-૦ માધ્યમ. ૨ ] [ અગ્રણ ફાહિથી સીંહપુરી ૬ માધ્યમ, સીંહપુરીથી અંદ્રાગતી ૮ સાધ્યમ આવવા જવાતું જણ્ય ૬તું ગાડીતું બાહુ હા. ૩-૦-૦ ] કારીથી અગ્રણથા ... ... ૧-૧૪-૦ [ અગ્રણથી હેન્ડોલ માધ્યમ ૫, હેન્ડોલથી રલપુરી ( નવરાહી ) ૧૧ માધ્યમ, નવરાહીથી સોહચાલ ૨ માધ્યમ જણ્ય ૫તું ગાડાતું બાહુ હા. ૩-૦-૦ ] સોહચાલથી અખનો ... ૧-૨-૦ [ અખનો છેદીલાલની ધર્મશાળાથી ચોકમાં ૧॥ માધ્યમ, ચોકમાથી હાદાવાડી ૨ માધ્યમ, હાદાવાડીથી સાહલગંજ ૨ માધ્યમ, સાહલગંજથી છેદીલાલની ધર્મશાળા ૩ માધ્યમ ] અખનોથી કાનપુર ... ... ૦-૧૧-૦ કાનપુરથી અથુરા ... ... ૩-૭-૦ [ મથુરાથી વંદ્યાવન માધ્યમ, ૬ જણ્ય ૧તું બાહુ હા. ૦-૬-૦ છ. આધ. પી. રેલવેમાં બીજું સ્ટેશન વંદ્યાવનતું છે. સ્ટેશનથી ગામ ૧ માધ્યમ. [ મથુરાથી દીલદી ... ... ૧-૭-૦ [ દીલદીથી કુતુખમીનાર માધિ ૭, મોટર ૫થી મોટર ૫થી જાઈ, શકે છે. બાહુ જણ્ય ૧ ના હા. ૦-૬-૦ ] દીલદીથી આચા ... ... ૧-૧૪-૦ [ આચાથી ( શહેરમાથી ) તાજ મહેલ ૨ માધ્યમ ] આચાથી જેપુર ... ... ૨-૬-૦ જેપુરથી બીજાનેર ( ઝુદેરા, મેરતારોડ જણ્યન થઈ ) ૩-૧૧-૦ બીજાનેરથી દીલદી ( મેરતા રોડ સ્ટેશન ) હા. ૧-૧૦-૬ દીલદીથી અજમેર ... ... ૨-૪-૦ અજમેરથી ચીનોડગંજ ... ... ૧-૧૩-૦ ચીનોડાથી ઉહેપુર ... ... ૧-૧-૩ [ ઉહેપુરથી કુસરીઅણ ( ઝુદેરા ) ૩૬ માધ્યમ એવાગાડી ત્યા શીદગાડી જણ્ય શુકે

છે. ] ઉદ્દેપુરથી કરેડા પાર્શ્વનાથે ... ૦-૧૦-૦ કરેડાથી મીતોડ ...  
 ૦-૭-૩ મીતોડરાઢથી અજમેર ... ૧-૧૩-૦ અજમેરથી આયુ ...  
 ૩-૦-૦ [ ખરેડીથી માઉન્ટ આયુ ૧૮ માઠલિ, મોટરનું ભાડુ જણુ ૧ તું રા.  
 ૩-૬-૦ ખરેડીથી અંબાળ ૧૨ ગાડ ગાડનું ભાડુ જણુ ૪ તું રા. ૭-૮-૦ ]  
 આયુથી અમદાવાદ ... અમદાવાદથી અમલસાડ ...

### મોટા તીર્થના એટ્રેસો.

- ( ૧ ) આંકોલા:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. આંકોલા. જલ્લા  
 વરાડ પોષ્ટ (વાયા) આંકોલા જ. આઠ. પી. રેલ્વે.
- ( ૨ ) અંતરીક્ષ પાર્શ્વનાથ (સીરપુર)-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા.  
 સીરપુર (અંતરીક્ષ પાર્શ્વનાથ) વાયા. આંકોલા (જલ્લા વરાડ)  
 જ. આઠ. પી. રેલ્વે.
- ( ૩ ) નાગપુર:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. નાગપુર હે. આહિત-  
 વારી પેઠ પોષ્ટ (વાયા) નાગપુર જ. આઠ. પી. રેલ્વે.
- ( ૪ ) ગીરીડી:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. ગીરીડી પોષ્ટ (વાયા)  
 ગીરીડી ધ. ધ. રેલ્વે. (અંચ)
- ( ૫ ) મધુવન:-શ્રી જૈન શૈતામ્બરી ડોડી સુા. મધુવન (સમેત શીખરજ)  
 પોષ્ટ (વાયા) ગીરીડી ધ. ધ. રેલ્વે. (અંચ)
- ( ૬ ) કલકતા:-શ્રી જૈન શૈતામ્બરી ધર્મશાળા હે. સ્થામાણોધ ગાડી નં. ૪  
 હેરીસન રોડ, કલકતા પોષ્ટ નં. ૪
- ( ૭ ) અણુમગંજ:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. અણુમગંજ રેશન  
 (પોષ્ટ) અણુમગંજ જલ્લા મુર્દીદાયાદ ધ. ધ. રેલ્વે.
- ( ૮ ) લાગલપુર:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. લાગલપુર જલ્લા  
 ભાગલપુર ધ. ધ. રેલ્વે.
- ( ૯ ) ચંપાખુરી:-શ્રી જૈન શૈતામ્બર ધર્મશાળા સુા. ચંપાખુરી જલ્લા

- ભાગલપુર પોષ્ટ (વાયા) નાથનગર ઈ. ઈ. રેલ્વે.
- (૧૦) શ્રીવિનારાયણ રામનારાયણ ધર્મશાળા સુા. લખેસરાઈ ટે. પુરાના અનાર જીલ્લા મુગેર પરગણા સલેમાયાદ ઈ. ઈ. રેલ્વે.
- (૧૧) કાકંડી:-અત્રેના દહેરાસર આતાનો હીસાબ લઘવાડ કારખાનામાં રહે છે. માટે ટપાલ વિગેરે તાંજ મંગાવવું.
- (૧૨) લઘવાડ:-શ્રી જૈન ખેતામ્બર ધર્મશાળા સુા. લઘવાડ જીલ્લા મુગેર પોષ્ટ સીકન્દરા સ્ટેશન ક્રીયુલ ઈ. ઈ. રેલ્વે.
- (૧૩) ગુણીચ્છાળ:-શ્રી જૈન ખેતામ્બર ધર્મશાળા સુા. ગુણીચ્છાળ જીલ્લા ગયા પોષ્ટ (વાયા) નવાડા. ઈ. ઈ. રેલ્વે.
- (૧૪) પાવાપુરી:-શ્રીજૈન ખેતામ્બર કારખાના સુા. પાવાપુરી (પોષ્ટ) થાના ગીરીયડ સ્ટેશન, ભીહાર શરીરક જીલ્લા પટના ખી. ખી. લાઈટ રેલ્વે.
- (૧૫) ખીહાર:-શ્રી જૈન ખેતામ્બર ધર્મશાળા સુા સુધે ખીહાર જીલ્લા પટના સ્ટેશન ખીહાર શરીરક ખી. ખી. લાઈટ રેલ્વે.
- (૧૬) કુંડલપુર:-શ્રી જૈન ખેતામ્બર મંદીર સુા કુંડલપુર પોષ્ટ મીરચા-છિંજ સ્ટેશન નાળંડા, જીલ્લા પટના ખી. ખી. લાઈટ રેલ્વે.
- (૧૭) રાજગીરી:-શ્રી જૈન ખેતામ્બર ધર્મશાળા સુા રાજગીરી પોસ્ટ સીલાઉરાજગીરી સ્ટેશન રાજગીરી, જીલ્લા પટના ખી. ખી. લાઈટ રેલ્વે. રાજગીરી તારનું એડ્રેસ:-ખેતામ્બર ડોડી સીલાઉ રાજગીરી પટના.
- (૧૮) પટના:-સીટી અનંતલાલ અગરવાલાની ધર્મશાળા પોસ્ટ (વાયા) પટના જીલ્લ. પટના ઈ. ઈ. રેલ્વે.
- જદુરામ મારવાડીની ધર્મશાળા ટે. પટના સ્ટેશન ઉપર પોસ્ટ (વાયા) પટના જીલ્લા પટના ઈ. ઈ. રેલ્વે.
- (પટના) ગુલજાર બાગ:-કીરોરીલાલ ચોધરીની ધર્મશાળા ટે. ગુલજાર બાગ સ્ટેશન પર જીલ્લા (વાયા) પટના ઈ. ઈ. રેલ્વે.

- (૧૬) કાશી (અનારસ) સીટીઃ—પદ્મોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ડૉ. અચ્છેલ કોહી કાશી (અનારસ સીટી) ઈ. ઈ. રેલ્વે.
- (કાશી) લેલુપુરઃ—શ્રી જૈન શૈતાભ્યર ધર્મશાળા ડૉ. લેલુપુર સ્ટેશન, અનારસ કેન્ટોલ્સમેન્ટ ઈ. ઈ. રેલ્વે.
- (૨૦) અન્નેદ્યાઃ—શ્રી જૈન શૈતાભ્યર ધર્મશાળા ડૉ. અન્નેદ્યા જીલ્લા ફૈનાયાદ એંસ. એન્ડ આર. રેલ્વે.
- (૨૧) રત્નપુરી (નવરાહી) :—શ્રી જૈન શૈતાભ્યર ધર્મશાળા ડૉ. નવરાહી (રત્નપુરી) જીલ્લા ફૈનાયાદ પોસ્ટ નવરાહી એંસ. એન્ડ આર. રેલ્વે.
- (૨૨) લખનોઃ—છેડીલાલ વિષણુંની ધર્મશાળા ડૉ. હમીનાથાદ લખનો એંસ. એન્ડ આર. રેલ્વે.
- લક્ષ્મીયંદ ઝવેરીની ધર્મશાળા ડૉ. જોલકુવા ચોકમાં લખનો એંસ. એન્ડ આર. રેલ્વે.
- હીરાલાલ ચુનીલાલની ધર્મશાળા પેઢીમાં ડૉ. ચુડીવાલી ગલી, ચોકમાં લખનો એંસ. એન્ડ આર. રેલ્વે.
- (૨૩) કાનપુરઃ—શ્રી જૈન શૈતાભ્યર ધર્મશાળા ડૉ. મેસરી મોહલ્લો કાચના દહેરાસરની સામે કાનપુર.
- બાયુ સંતોક્યંદ ભંડારીની પેઢી ડૉ. ચોકમાં કાનપુર.
- હરસાઇમસજ સુખદેવદાસની વિષણુંની ધર્મશાળા ડૉ. પીલી કોહી કાનપુર.
- (૨૪) મથુરાણઃ—શ્રી જૈન શૈતાભ્યરી મંદીર ડૉ. ધીઆમંડી મથુરાણ ગુ. આધ. પી. રેલ્વે.
- હરદ્યાલ ખીસનદ્યાલ કલકત્તાચાલાની ધર્મશાળા ડૉ. નયા અનર મથુરાણ ગુ. આધ. પી. રેલ્વે.
- હરમુખરાય ખીસનદ્યાલ હુથરસવાલા ડૉ. નયા અનર મથુરાણ

જ. આધ. પી. રેલ્વે.

- (૨૫) દીદહી:- શ્રીજૈન દીગમ્બરી ધર્મશાળા બડાયનાર ડે. શેનો કુચો દીદહી  
શ્રીજૈન શ્વેતામ્બરી ધર્મશાળા ટે. બડાયનાર ચેલપુરી ગલી દીદહી
- (૨૬) આચા:- ઉત્તમચંદ ભરોસાલાલની ધર્મશાળા ટે. રાનમંડી સ્ટેશનની  
સામે રાનમંડી (આચા) આચા.  
શ્રીચિત્તામણ પાર્શ્વનાથનું શ્વેતામ્બરી મહાર ઈ. રાશન મોહોલ્લો  
કાનારી બનાર આચા?
- (૨૭) જેપુર:- શેડ નથમલજની ધર્મશાળા ટે. સાંગાનેર દ્વરવાળ જેપુર.  
શ્રીજૈન શ્વેતામ્બર શ્રીમાળાની ધર્મશાળા, ટે. ધીવાલાને ઝસ્તે જેપુર
- (૨૮) ધીકાનેર:- લક્ષ્મીચંદ જોવરધનદાસની ધર્મશાળા મા. ધીકાનેર  
ટે. સ્ટેશનની સામે જેધપુર બીકાનેર રેલ્વે.
- રાયધાદુર મહેતા મહેરચંદની ધર્મશાળા મુા. ધીકાનેર ટે.  
ડાચરાના મોહોલ્લો જેધપુર બીકાનેર રેલ્વે.
- (૨૯) ઇલોધી:- સુગનલાલ ડાગા ધીકાનેરવાલાની ધર્મશાળા મુા. ઇલોધી  
સ્ટેશન મેરતારેડ ને. બી. રેલ્વે.
- શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા મુા. ઇલોધી ટે. પાર્શ્વનાથ દહેરા-  
સર, સ્ટેશન મેરતારેડ ને. બી. રેલ્વે.
- (૩૦) ઉદ્દેપુર:- શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા મુા. ઉદ્દેપુર (મેવાડ) ગુલાઉદ્દેપુર
- (૩૧) કેસરીયાળ:- શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા મુા. રીખવદ્વિ બુલેવા  
ગુલાઉદ્દેપુર (મેવાડ)
- (૩૨) કરેડા પાર્શ્વનાથ:- શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા ટે. કરેડા પાખનાથ  
સ્ટેશન કરેડા રોડ ચીતોડ ઉદ્દેપુર રેલ્વે.
- (૩૩) શેડ હીરાલાલ ગુલાઅચંદની ધર્મશાળા ટે. સ્ટેશન ઉપર અજમર.  
બી. બી. એન્ડ સી. આધ. રેલ્વે.

(૩૪) આયુરોડ ( ખરેડી )—રાય બુદ્ધિસાગરજી ખીસનચંહળની ધર્મશાળા દેઠો આયુરોડ સ્ટેશન આયુરોડ ખરેડી, જુલાલા આયુ. બી. બી. એન્ડ સી. આઇ. રેલવે.

શ્રી કૈન શૈતાભ્યરી ધર્મશાળા ઠ. હૃદલવાડા માર્કિન્ડ આયુ સ્ટેશન આયુરોડ. બી. બી. એન્ડ સી. આઇ. રેલવે.

(૩૫) અંબાળ—શ્રી અંબાળ માતાની કોટી ઠ. અંબાળ સ્ટેશન આયુરોડ ખરેડી. બી. બી. એન્ડ સી. આઇ. રેલવે,

તા. કુ.—ડિપરના એહુરેસો ને શિખરજી તરફના છે, એટલે ના. ૨૬ સુંદીના, તેનું શીરનામું બાલએમિમાં અગર અંગ્રેજુમાં કરવું વળી ને જગ્યાએ કાગળ મંગાવવો હોય તાં આગળ પ્રથમ લખી જણાવવું અને તે પણ અંગ્રેજુમાં અગર હિંદુસ્તાનીમાં લખવું, અને ગુજરાતી લખવું તો પણ એડિમ છુટ્ટા અક્ષરે લખવું જેથી કાગળ રખુંવાનો સંભવ ન આવે.



# ધી ન્યુ લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ

માંડવી શાકગલી—મુખ્ય ૩.

અમારા પ્રિન્ટિંગ પ્રેસમાં દરેક પ્રકારનું સંસ્કૃત  
હિંદી ભરાડી ગુજરાતી હિંદીશ આપવાના  
કામ સર્કારદાર અને ડીક્રાયતથી કરી  
આપવામાં આવે છે.

તે ઉપરાંત

અપાવનાર મહાશયોને ખાસ સગવડ એ છે કે  
ગમે તેવું અશુદ્ધ અને કરીન લખાણ હોય  
તો પણ અમો જાતેજ પ્રેર્ણ વાંચી  
તદ્દન શુદ્ધ કરી આપીએ છીએ.

ન્યુ થાટે લખો—

મેનેજર ન્યુ લક્ષ્મી પ્રેસ,

માંડવી શાકગલી મુખ્ય ૩

શ્રી પાર્વતનાથાય નમઃ

# દ્વિતીય ખંડ.

## ભક્તિમાળા.

મંગળાચરણ

રાગદ્વેપવિજેતારં, મેતારં કર્મભૂમૃતાં;  
જ્ઞાતારં વિશ્વતત્વાનાં, વંદે તદ્ગુણલબ્ધયે.

\* ભાવાર્થ:- રાગ અને દ્વેપાદિક આત્માના શરૂઆતે જેણે અન્યા છે, અને કર્ષ્ણિંધી પર્વતે જેણે લેદી નાખ્યા છે, જગતના તત્વો જેણું જાણ્યા છે, તેવા શ્રીસર્વજ્ઞ લગવાનને હું નમસ્કાર કરું છું. તે એલાજ માટે કે તેમના ગુણાની પ્રાપ્તિ અમોને પણ થાય.

શ્રી પંચપરમેણિ નમસ્કાર.

સ્તુતિ.

શાર્દૂલવિકીર્ણિત.

અર્હુતો લગ્યાંત ધંદ ભહિતાઃ  
સિદ્ધાશ્ચ સિદ્ધિં સિથતાઃ,

आचार्यो जिनशासनेभविकराः  
पूज्या उपाध्यायकाः,  
श्रीसिद्धांतसुपाठकाः  
मुनिन्द्रा रत्नव्याख्यातकाः,  
पंचैते परमेष्ठिनः  
प्रतिहिनं कुर्वन्तु वो मंगलं ॥ १ ॥

दर्शन भावना.

सरस शांति सुधारस सागरं,  
शुचितरं शुशु रत्न महागरं;  
भविक पंडज ऐश्वर्याकरं,  
प्रतिहिनं प्रणमाभि जिनेधरं.

श्री जिनराज प्रार्थना.

हाङ्गरा-

प्रभु दर्शन मुख संपदा, प्रभु दर्शन नव निः;	
प्रभु दर्शनथी पाजीमे, सकण पदार्थ सिङ्.	१
आवे जिनवर मुल्ये, आवे हीने दान,	
आवे भावना भावीये, आवे केवलज्ञान.	२
ज्ञवर जिनवर मुल्ये, जिन पुजे मुख थाय,	
हुँख हाङ्गर हुरे टप्पे, मनवांछित मुख थाय.	३
कुलन केरा भागमां, ऐठा श्री जिनराज,	
तारामां केम चंदमा, तेम शोभा महाराज.	४
चावीशे जिनराज छे, मेष्टितथा दातार,	
भजि करे तुझ सेवको, हीनानाथ ह्यामा.	५

હેવાધિહેવા ચરણ સેવા, નિત્ય મેવા આપીએ,  
નિજ દાસ જાણી દ્વારા આણું, આપ સમોવદ સ્થાપીએ.  
જિને લક્ષ્મિ, જિને લક્ષ્મિને દિને દિને,  
સદા મેસ્તુઃ સદા મેસ્તુઃ સદા મેસ્તુઃ અવે અવે.  
દર્શનં હેવ હેવસ્ય, દર્શનં પાપ નાશનં,  
દર્શનં સ્વર્ગ સોપાનં, દર્શનં મોક્ષ સાધનં.  
આણુ અષ્ટાપદ ગીરનાર, સમેત શીખર શેરુંણે સાર,  
પંચ તીર્થ એ ઉત્તમ ધાર, મોક્ષે ગયા જેને કરું પ્રણામ.  
જગત્તાંત્રાર કૃપાવતાર  
દુર્વાર સંસાર વિકાર વૈદ,  
શ્રીવીતરાજ લયિ સુન્ધર ભાવાર,  
વિજા પ્રભુ વિજાપયામિ કિંચિત.

આવ્યો શરણુ તુમારે જિનવર કરણે આશાપુરી હુમારી,  
નાવ્યો ભવપાર મારો તુમ વીણુ જગમાં સાર લે કોણુ મારી,  
ગયા જિનરાજ આજે હુર્ઝ આદકથી પરમ આનંદકારી,  
પાયો તુમ દર્શનાણે અય અય અમણા નાય સર્વે હુમારી.

### પ્રભાતીઓ.

તમન કરું હું અવી, પ્રહુર ઉડી સવી;  
મોક્ષના મોતીને પ્રથમ વંદી;  
એ રદ્વી ચંદ્ર તારા થકી શોલતા,  
અધિક ઉજાર ભરે આત્મ નંદી. ૧  
મનોહરા સુભિતના, સુંદરી શીન વર્યા,  
હૃદીય દીપતા દઠ ભાવે,  
છો કદ્રી કોડ આવે શરી શોલતા,  
તાય પણ તેહના તુલ્ય નાવે. ૨  
પ્રાણી આધાર છો, અવતીમાં એકલા,

પણ વસ્ત્યા વેગળા દૂર હુએ,  
તુમ વિના દાસનું દુઃખ કાપી કહો,  
કોણું અનાથની આશ પુરે.

૩

સર્વને સ્નેહથી સુખકર સાહીબા,  
શાંતિ મંગળ કરી લય વિદારી,  
દાસની દૂરથી હીન અરજુ સુધી  
સંઘ લે જે હવે તું સ્વીકારી.

૪

જીન જહાં, ભીભસ્થણ, જગ વિષે,  
હશ હીશે, હોય આકાશ પાતાળ માંહી  
વંદના ક્ષેમ ધરી પ્યાર હેઠો સતા,  
કાહીલા કેવલી જગત માંહી.

૫

### પુઞ પ્રકરણ.

કેદ સજજન પુરુષને પોતાના માત પિતા કે ગુરુની છણી જોઈને આનંદ થાય છે. તથા તેમના ગુણ અને ઉપકારની યાદી થાવે છે. તેથી તેમને મન, વચ્ચન અને કાચાંએ કરીને નમસ્કાર કરે છે. સ્વીને પોતાના પતિની અને પુરુષને પોતાની સ્વીની છણી જોઈને પરસ્પર દંપતી રહુણ્ય ઉત્પત્ત થાય છે. વળી હાલમાં ડકાણે ડકાણે મહાન પુરુષોના બાવલાં ઉભાં કરવાનો તથા દ્રોગ-આર્દ (છણી) દાંગવાનો રીવાજ પડેલો છે, તે પણ એટલાજ માટે કે તેમના ગુણુની અને પરાકરણની આપણુને વારંવાર સમૃત આપી તેવા સદગુણાનું આપણે અનુકરણ કરતાં શીખીએ, તેને માટે તે પ્રત્યક્ષ દિશાંત (પ્રદર્શન) રૂપે થઈ પડે છે. તેમજ અવ્યાખ્યાખ્ય અને અક્ષય સુખના લોક્તા મોક્ષગામી નિરંજન નિરાકાર સચિચહાનંદ અરિહંત પરમાત્મા શ્રી લુનેથેર અગવાનની શાંત મુદ્રાવાગી પ્રતિમાને જોઈને આપણુને આનંદ ઉત્પત્ત થાય છે,

એવચું નહીં પણ તેમના સદગુણોનું અતૃપત્રેણ કરવાનું ભન થાય છે. વળી વધારે વધારે ભાવથી નીરખીએ છીએ તથા સુતિ, નમસ્કારને પુજા આદિ પ્રકારથી તેનું બંધુ માન કરીએ છીએ તેમ તેમ આપણાં અત્મામાં ચાલીને મોક્ષ સુખ મેળવવાનાં અંકુરો પ્રગત થાય છે. પ્રતિમાના દર્શન કરવાથી, તેની પુજા કરવાથી તથા જે ઉત્તામ જગતનું તે પ્રતિષ્ઠિંબ છે, તેના ગુણોનું ભનન કરવાથી આપણી જંગી પણ તેના જેવી ધર્માદ્ધ, દ્વારું અને પરોપકારી થાય, અને આપણે પણ તેની પેઠે મોક્ષના અનંત સુખ મેળવીએ, એવી ભાવના ભાવવાથી આપણનું કદ્યાણ થાય છે, અને પરંપરાએ તેના જેવી સિથિતિએ પહોંચવાને લાયક થધુએ છીએ. કદ્દાય કોઈ એમ ધારે કે અરિહતંત પરમાત્માની એકાંત સ્થળમાં ભનને વિષે યાદી કરવાથી પણ ભાવના ભાવી શકાય છે. તે વાત સત્ય છે. પણ કારણ વિના કાર્ય નીપજતું નથી, માટે ઉપર લાયા પ્રમાણે કરવાની આવશ્યકતા છે.

પુજાના એ પ્રકાર છે. ૧, દ્વયપુજા ૨, ભાવપુજા.

### ૧ દ્વયપુજા.

દ્વયપુજામાં અષ્ટપકારી પુજાનો સમાવેશ થાય છે. પ્રથમ સૂર્યાદ્ય થયા પછી શુદ્ધ ગાળેલાં પાણીથી સ્નાન કરી, આખું શરીર લુધીને પુજા કરવાના જુદા સ્વચ્છ કપડાં રાખેલાં હોય તે પહોરયાં. એકબંદું સાંઘા વિનાનું સગંગ અખંડ ઉત્તરાસંગ રાખ્યાં એને આઠ પડ વાળું વસ્તુ કરી સુખોકોશ બાંધવો. એ વણે વસ્તો ઉજળાં તથા આખાં હોવા જોઈએ. પછી કપાળો કેસરનો ચાંદલો કરી, પુજા કરવાની કેશરની વાટકી લઘ પ્રતિમાલ સમીપ ઉલાં રહી નીચેના ફષ્ટા બોલવા.

અષ્ટ પ્રકારી પૂજના દુહા.

પ્રલુભી પાસ જીજું, આણી હૃદ અપાર,  
ભવિક લિત કરણ રચું, પુજ અષ્ટ પ્રકાર,  
જલ ચંદન કુસમની, ધૂપ દીપ મનોહર,  
અક્ષત નવેહ ઇણ તણી, પૂજ અષ્ટ પ્રકાર. ૧  
ભાવ વૃદ્ધિને કારણે, દવ્ય સ્તવ અધિકાર,  
હેતુ અર્થ સમજ કરો, શીવ સુખ ઇણ દાતાર ૩  
દવ્ય ભાવ હોય પુજના, કારણ કાર્ય સંબંધ,  
ભાવસ્તવ મુખ્ય ભણી, કરું રચના આણી ઉમંગ ૪

પ્રથમ શ્રીજાપાપુજન.

પ્રથમ દીપ અને ધૂપ કરવો. પછી ગાયનું હુંદું, દહીં કેશદ  
સાકર અને જળ એ પંચામૃતથી પ્રક્ષાલન કરવું, અને સુખથી  
નીચેના દુહા ઓલવા.

હુંદના નહવણનો દુહા.

મેરુ શીખર નવરાવે હો, સુરપતિ મેરુશીખર નવરાવે.  
જનમ કાળ જનવરકો જણી, પંચદીપ કરી આવે.

પાણીના નહવણનો દુહા.

જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરમું,  
શ્રી જિનને નવરાવતાં, મેલ થયા ચઠચૂર.  
જળ પુજ જીગતે કરો, તેથી અનાદિ વિનાશ,  
જળપુજ ઇણ સુજ દળો, ભાગું એમ પ્રલુભાશ.  
શ્રી જીનને નહવણ કર્યા પછી કોરાં પવિત્ર વણ અંગ લુછણા  
ને ધૂપ ધ્ય તે વડે વણવાર જીરેદીર ભગવાનતું અંગ લુછણું,

तेमां उपयोग साध्यवो के कभरमां तथा कांडा नीचे लीनुं रही  
न जाय, ते भाटे अंग लुष्णानी शेइ करीने धसवुं.

**धीरु श्री चंदन पूजा.**

श्री जिनेश्वर लगवानने अतर तथा घरासनुं विलेपन  
करी उंचा प्रकारना सुगंधी केसरनी वाटडीने धुप दृष्टि नीचेनो  
हाहुरो घोलवो.

केसर चंदन धसी करी, भरी कच्चाणां सार,  
जिनवर अंगे चरचतां, पाप कर्या परिहार.  
केसर चंदन दृष्टि थडी लाव थडी खुङ मान,  
जिनवर अंगे चरचतां, प्रगटे आतमज्ञान.

पछी जमणा हाथनी रचडी अंगणीनी घासेनी आंगणीनुं  
टेवुं ( नभने केसर अउ नहीं एवी दीते ) घोलोने नीचे  
प्रभाषे प्रभुलुना नवे अंगे निर्भण ( यिते पुजा करवी ).

१ जमणा पगनो अंगुडा, पछी डाढा पगनो अंगुडा.

२ जमणा पगनुं ढीचण, पछी डाढा पगनुं ढीचण,

३ जमणा हाथनुं कांड, पछी डाढा हाथनुं कांड,

४ जमणा अंलो, पछी डाढो अंलो.

५ शीर्षा-मस्तक. ६ कपाळे.

७ केटे ( कंडे ) ८ छाती. ९ नाली ( डंडी )

ऐ दीते कभवार नवे अंगे पुजा करवी. तेमां उपयोग  
ऐ साध्यवो के चालां करतां जिनभिंभने जरा पाण धडो न  
लागे तेम धीमेथी पुजाकरवी. कदापि पैताना आत्मानी स्थि-  
रता न होय तो भाव एकजन्मिंभनी, पुण्य तेमना नव अंगनी  
भहुत्वतानी भावना भावतां स्थिर चित्ती पुजा करवी.

## શ્રી જિલ્લા નવ અંગ પુજના દોહા.

અંગુઠે પુજા કરતાં—

જળ ભરી સંપુર્ણ પત્રમાં, ચુગલિક નર પુજાત,

રૂપલ ચરણ અંગુઠા, દાયક સવ જળ અંત.

દીંઘે—જાનુ ખોણે કાઉસણા રહ્યા, વિચર્યા હેશ વિદેશ,

ખડા ખડા કેવળ લહું, પુજો જાનુ નરેશ.

કાડ—સોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન,

કર કાડ પ્રભુ પુજના, પુજો અવિ અધુ માન.

અંદે—માન ગણું હાય અંશથી, હેઠી વીર અનાંત,

ભુજ ખોણે ભવજળ તર્યા, પુજો અંદે મહાંત.

મસ્તકે—સિદ્ધ શિદ્ધા ગુણ ઉજવલી, સોકાંતે ભગવાંત,

પ્રિલુચનતિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવાંત.

કપાણે—તીર્થાંકર પદ પુજયથી, પ્રિલુચન જન સેવાંત;

પ્રિલુચન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવાંત.

ગળે—સોળ પહોર પ્રભુ હેશના, કંડે વિવર વર તુલ;

મહુર ધ્વની સુર નર સુણે, તેણે ગળે તિલક અમુલ્ય.

હદ્દે—હૃદય કમળ ઉપરેસ ખોણે, બાહ્યા રાગ ને રોષ;

હીમ દહે વન અંડને, હૃદય તિલક સંતોષ.

તાલિ—રલમચી ગુણ ઉજવલી, સકળ સુગુણ વિશ્રામ,

તાલી કમળાની પુજના, કરતાં અનિયળ ધામ.

હાથ જોડી—ઉપહેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિણાંદુ

પુજો અધુવિધ રાગથી, કહે શુલ વીર સુણીદુ.

એ દીતે નવ અંગ પૂજદા, તેમાં પ્રથમ જમણું અંગ

પુજયા પછી આણું અંગ પુજવું.

વળી સિદ્ધચક્ષુમાં અરિહંતાહિક નવ પદની અનુક્રમે  
પુજા કરવી તે આ પ્રમાણે:-

૧ અરિહંત. ૨ સિદ્ધ. ૩ આચાર્ય. ૪ ઉપાધ્યાય. ૫  
સાહુ. ૬ દર્શાન. ૭ જાન. ૮ આરિચ. ૯ તપ.

### ત્રીજ શ્રી પુષ્પ પૂજા.

સુગંધી સારાં ઉઘડેલાં અને પવિત્ર જળથી ઘોંબેલાં, વાસી  
ન હોય તેવાં આખંડ કુલની સુતરના દ્વારા વતી ગાંડ દછને  
ગુંધેકી ભાગા પ્રલુના કરે આરોપવી. અને ભીજા અંગપર  
કુલ ચાચવાં તે વખતે નીચેનો દાહો ઘોલવો.

શતપત્રી વર મોગરો, ચંપક જાધ ગુલાબ;  
કેતકી ડમરો બોલ સીરી, પુજો જિન ભરી છાબ.

### ચોથી શ્રી ધુપ પૂજા.

પાયક શૃષ્ટે સુગંધકુ, ધુપ કલ્હાવત સોય;  
ઉભેવત ધુપ લણંદકં, કર્મ દહેન સખ હોય. ૧  
ધુપ ઉભેવત જે જના, પ્રલુ આગળ અહુ માન;  
દુર્ગાંધતા દૂરે કરે, પામે અમર વિમાન. ૨  
કુતારશનસોં કાષ જયું, તેમ ધ્યાનાનલ કર્મ,  
તેણે વિષે ધુપગુજા કરો, જિમ પામો શિવ શર્મ. ૩

### પાંચમી શ્રી હીપ પૂજા.

કલ્યા હીપક ઝાનસ કરી, ભાવ હીપકને કાજ;  
કેવળજ્ઞાન પ્રગટ કરી, લાઘએ શિવપુર રાજ.

### છી શ્રી અક્ષત પૂજા.

પાંચમી હીપકની પુજા થધ રહ્યા ખાદ જિન ભુવનમાંથી  
બહાર આવી મંડપમાં પ્રલુ સન્મુખ એસી સ્વસ્તિક (સાથીઓ)

અક્ષતથી ( ચોખા ) પુરવો. તેમાં પ્રથમ ગ્રણ ઠગલી અને સિદ્ધ-  
શિલા કરતી વખતે નીચેનો હાહો બોલવો.

દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર,  
સિદ્ધશિલાની ઉપરે, હો સુજ વાસ સ્વીકાર.

પછીથી સાથીએ પુરતી વખતે નીચેનો હાહો બોલવો.

અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરી અવતાર,  
ક્રણ માંગુ પ્રલુ આગળે, તાર તાર ચુજ તાર.  
અખંડ અક્ષત ઉજવલયે, નંદાવર્ત વિસ્તાર,  
ચઉગતી ચુરણ સાથીએ, અક્ષય ક્રણ દાતાર.

**સ્વસ્તિક ( સાથીએ ) નો ભાવાર્થ.**

ઉપરનાંઅર્થ ચંદ્રકાર ચિનહુ તે સિદ્ધ શિલા એહલે સુક્ષ્મ-  
સ્થાનનું સૂચ્યક સમજવું અને નીચે ગ્રણ ઠગલીએ તે ગ્રણ રત્ન  
( દર્શન જ્ઞાન ચારિત્ર ) સમજવાં.

સાથીએના ચાર પાંખડાં તે ચાર ગતી ( મનુષ્ય, દેવ,  
તિર્યંચ, નારકા ) ના સૂચ્યક સમજવા.

એ પ્રમાણે સ્વસ્તિક પુરી માંગવાનું કે હે ! નિસોડના નાથ  
આ ચાર ગતીમાંથી મને સુક્ષ્મ દ્વારા મોકશસ્થાન ( અજરામર )  
પામવા શક્તિમાન કરો.

**સાતમી શ્રી નૈવેદ્ય પૂજા.**

છી અક્ષત પૂજા કર્યા પછી નૈવેદ્ય મૂકવું અને નીચેનો  
હાહો બોલવો.

વિવિધ જાતિ પક્વાનશું, ભરી અધ્યાપહ થાળ,  
અણહારી પહ પામવા, પુણ્યે ત્રિલુચન પાળ.

આડમી શ્રી ઇણ પૂજા.

નૈવેદ સુક્યા પછી ઇણ મુક્કવું અને નીચેનો ઢાંઢો પોલવો.

ઇણ પૂજા કરી આડમી, સિઇણ કરો અવતાર,

ઇણ માંગો પ્રલુબ આગળો, તાર તાર મુજ તાર.

મને હર ઉત્તમ વૃક્ષના, ઇણ લધ નર નાર.

પ્રલુબ આગળ જે ધરે, સિઇણો તસ અવતાર.

એ પ્રમાણે સંક્ષેપથી જળ ચંદ્રન, કુલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ અને ઇણ એ પુજા યથારક્તિ પ્રમાણે હુંમેશાં આવકને કરવાની આવશ્યકતા છે.

૨ ભાવ પૂજા.

ભાવ પૂજામાં પ્રથમ વિધિપુર્વક એક ચિંતા ચૈત્યવંદન કરી પ્રલુના ગુણોત્તાની સ્તુતિ મનોહર સ્તવન સ્તોત્રથી કરવી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધ મનોવૃત્તિ વડે ભાવના ભાવવી. ચૈત્યવંદન કરતી વખતે કહેલું છે કે પુરુષે જમણી બાળુએ અને સ્ત્રીએ હાથી બાળુએ ઓછામાં ઓછા પ્રલુથી નવ હાથ અને વધારેમાં વધારે સાઈ હાથ છેટે ઐસવું.

અથ ચૈત્યવંદન વિધિ.

ઇચ્છામિ ખમાસમણો વંદિં જવણિજજાએ નિસીહિયાએ,  
મધ્યઘેણ વંદામિ.

આ પ્રમાણે તણું ખમાસમણું હેવા પછી ઐસીને હાથ દીંચણું જોંય દિપર સ્થાપી એ હાથ નેતી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ચૈત્ય વંદન કરું! મન્દાં” એમ રૂપી પછી ચૈત્યવંદન આપવું.

## અથ ચૈત્યવંદન.

ખાર ગુણ અરિહંત હેવ, પ્રણમીને ભાવે,  
સિદ્ધ આડ ગુણ સમર્પાં, હૃદ્ય હોલુગ જાવે.  
આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજાય,  
સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય.  
અણ્ટોતર શત ગુણ મલી એ, એમ સમરો નવકાર,  
ધીર વિમળ પંડિત તણો, નય પ્રણમે નિત્ય સાર.

આ સીવાય બીજા ચૈત્યવંદનોમાંથી નેતે જે આવડે તે એલી શકાયછે.

## અથ જંકિંચિ.

જંકિંચિ નામ તિથાં, સંગે પાયાલી માણસે લોચે,  
જાઈ જિણુ બિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ.  
એકી એ હાથ નેડી નારીકા સુર્ખી ડંચા રાખીનુનમુખ્યુણું કહેવું.

## નમુદ્ધ્યાણ ( શક્ષસ્તવ )

નમુદ્ધ્યાણ અરિહંતાણ ભગવંતાણ આઈગરાણ તિથ્યરાણ  
સયંસયુક્તાણ પુરિસુતમાણ પુરિસસીહાણ પુરિસવરપુરીઓણ  
પુરિસવરગ ધહુથીણ લોગુતમાણ લોગનાહાણ લોગહિયાણ  
લોગપદ્ધતાણ લોગપજનેઅગરાણ અભયહ્યાણ ચાગઘુદ્યાણ  
માગદ્યાણ સરણદ્યાણ પોહિદ્યાણ ધરમદ્યાણ ધરમહરસીયાણ  
ધરમનાયગાણ ધરમસારહીણ ધરમવરચ્ચાઉરંત ચક્કવહીણ અ-  
અરિહંયવરનાણું સણુધરાણ વિયદૃષ્ટિમાણ જિણાણ જાવયાણ  
નિશાણ તારયાણ ઝુદ્ધાણ પોહુયાણ મુતાણ મોચ્યગાણ  
સવ્વનૂણ સવ્વદરિસીણ સિવ ભયલ મરુચ મણુંત મજાખ્ય  
મન્યાઓ મપુણરામતિ સિદ્ધ ગાં નામધેય હાણ સપ્તાણ

નમો જિણાણં જિયભવાણં જેએ અપુઅા સિદ્ધા જેએ ભવિસસં-  
તિ ણાગએ કાલે, સંપર્ચિય વદ્માણા સંવે તિવિહેણ વંદામિ.

**અથ જવંતિ ચેદાઈ.**

જવંતિ ચેદાઈ, ઉ હૃદેય અહેય તિદ્ધિલેણે અ,  
સંવાઈ તાઈ વંદે, ઈહ સંતો તથ સંતાઈ.

**અથ ખમાસમણો.**

ઇચ્છામિ ખમાસમણો, વંદિં જાવણીજળાએ, નિસીહી-  
યાએ મથ્યઘેણ વંદામિ.

**અથ જવંત કેવિ સાહુ.**

જવંતિ કેવિ સાહુ, ભરહેન્દ્વયમહાવિહેણ અ,  
સંવેસિં તેસિં પણાએ, તિવિહેણ નિદંડ વિર્યાણં;

**અથ નમસ્કાર.**

નમોઽર્ધ્વત સિદ્ધાચાર્યોપાચાય સર્વ સાહુભ્ય:

**અથ સ્તવન.**

અંતરજામી સુણ અલવેસર, માહુમા ત્રિજગ તુમારો,  
સાંભળીને આંધ્યો હું તીરે, જનમ ભરણ હુંથ વારો.  
સેવક અરજ કરેણ રાજ, અમને શિવસુખ આપો

એ આંકણી.

સાહુકોના મનવ છિત પુરો, ચિંતા સહુની ચૂરો.

અનું બિદ્ધ છે રાજ તમારં, કેમ રાખો છો હુર—સેવક ૨૦  
સેવકને ટળવળતો હેઠી, મનમાં મહેર ન ધરશો.  
કર્ણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો—સેવક ૩.

લગ્નપત્રનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશણ દીજે,  
ધુંઘાડે ધીંજુ નહીં સાહેબ, પટે પદ્યા પતી જે—સેવક ૪.  
શ્રીશાંખેશ્વર મંદિર સાહેબ, વિનિતી અવધારે,  
કહે કિન હર્ષ ભયા કરી સુજને, ભવસાગરથી તારો-રો.

### અથ જ્યવિયરાય.

( એ લાથ નેડી માથા સુધી ઉચ્ચા રાણી જ્યવિયરાય આભવમખંડા  
સુધી કહી હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા જ્યવિયરાય પૂરા કરવા. )

જ્યવિયરાય જગ ગુરુ, હોડિ ભમ તુહ પક્ષાવચો ભયવં  
ભવનિવૈચો ભગગાણુસાસિયા ધૃતુ કુલ ચિદ્રિ,  
લોગ વિરુદ્ધ ચ્યાચો, ગુરુજણ પુઅા પરથ્થ કરણુંચ.  
સુહગુરુ જોગો તવયણ, સેવણા આભવમખંડા.  
વાદિજજીજ જ્યવિનિઆણ, બંધણું વીચરાય તુહ સમચો,  
તહુંવિ ભમ હુજજ સેવા, ભવે ભવે તુહે ચ્યલણાણ.  
હુંઘગાખચો કરમાખચો, સમાહિમણું ચ ગોાહલાભોચ.  
સંપજજચો મહુ એ એ તુહ નાહ પણામ કરણુણ.  
સર્વ અંગજ માંગદ્વં, સર્વ કલ્યાણ કારણ.  
પ્રધાન સર્વ ધર્માણાં, જન જ્યતિ શાસન.

### અથ અરિહંત ચેદ્યાણ.

( પછી ડિલા થમ અરિહંતચેદ્યાણ કહેણું. )

અરિહંત ચેદ્યાણ કરેમિ કાઉસસંગં,  
વંદળ વતિઆચે, પુઅણ વતિઆચે.  
સક્કાર વતિઆચે, સમાણ વતિઆચે,  
ઓહિલાલ વતિઆચે, નિરવસંગ વતિઆચે.  
સફ્રાચે, મેહાચે, ધિધાચે, ધારણાચે,  
અણ પણાચે, વહુમાણીચે, હામિ કાઉસસંગં.

અથ અન્ધથ ઉસસિએણું

અન્ધથ ઉસસિએણું, નિસસિએણું ખાસિએણું છીએણું  
જાલાએણું ઉડુએણું વાયનિસંગેણું ભમલિએ પિતમુચ્છાએ  
સુહુમેહિં અંગસંચાલેહિં સુહુમેહિં ઐલસંચાલેહિં સુહુમેહિં  
દિકુસંચાલેહિં એવમાઈએહિં આગારેહિં, અભજો અવિરા હિએ,  
હુજ્જ મે કાઉસગો જવ અરિહંતાણું અગવંતાણું નમુક્કારેણું  
નપારેમિ તાદ્કાયં દાણેણું મેણેણું આણેણું અધ્યાણું વોસરામિ.

લાર્યા એક નવકારનો કાઉસગ કરી “ નમોઅરિહંતાણું ”  
ઓલી “ નમોડર્દીતસિદ્ધાચાર્યોપાદ્યાય સર્વ સાધુક્ય : ” કહી એક  
શ્રાય કરેની.

અથ થોય.

શ્રી શનુંજ્ય તીર્થ સાર ગિશિવરમાં કેમ મેડુ ઉદાર,  
ઠાકુર રામ અધ્યારે ॥  
મંત્ર માંહિ નવકારજ જાણું, તારામાં કેમ ચંદ્ર વાખાણું,  
જળબર જળમાં જાણું ॥  
પંથીમાં કેમ ઉત્તમ છંસ કૃણ માંહિ કેમ ઋપભનો વંશ,  
નાર્દિલ તણો એ અંશ ॥  
ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરામાં મહા મુનિવંત,  
શનુંજ્ય ગિરિ ગુણવંત ॥



## શ્રી ચૈત્યવંહનો.

(૧).

## શ્રી ચોવીસ તીર્થકરનું ચૈત્યવંહન.

પ્રહૃદામે ભાવ ધરી ધણો, પ્રણસું મનરે આનંદ,	
ધન્ય વેળા ધન્ય તે ધડી, નિરસું પ્રલુભુ સુખ ચંદ.	૧
રિખવ અજિત સંસદ ભલા, અભિનંદન વંહન,	
સુમતિ પદ્મપ્રલુભુ જિનવરા, શ્રી સુપાર્થી જિનેંદ્રા.	૨
ચંદપ્રલુભુ સુવિધિ નમું, શીતલ ને ઓયાંસ,	
વાસુપુન્ય વિમલ પ્રલુભુ, અનંત ધર્મ જિનેશ.	૩
શાતિ કુંઘ અર જિનવરા, એ ત્રણ ચડી કહીને,	
મલિ સુનિ સુવત પ્રલુભુ, નમિ નેમ નમીને.	૪
પાર્થી વીર નિત્ય વંહીએ, અહુવા જિન ચોવીશા,	
જ્ઞાનવિમલ સૂરિ પ્રણસતં, નિત્ય હોય જગીશા.	૫

(૨).

## શ્રી અરિહંતનાં લંછનનું ચૈત્યવંહન.

પૃથ્વે લંછન રીખવ હેવ, અજિત લંછન હાથી,	
સંભવ લંછન વોહસો, શિવપુરનો સાથી.	૧
અભિનંદન લંછન કપિ, કૌચ લંછન સુમતિ,	
પદ્મ લંછન પદ્મ પ્રલુભુ, વિર્યદેવા સુમતિ.	૨
સુપાર્થી લંછન સાથીએ, ચંદપ્રલુભુ લંછન ચંદ,	
મગર લંછન સુવિધિપ્રલુભુ, શીવચંદ લંછન શિતલજિલ્લાંદ.	૩
લંછન અડગી ઓયાંસને,, વાસુપુન્યને મહિષ,	
વરાહ લંછન પામે વિમાદેવ, અવિયા તે નમો શીપ,	૪

સિંચાણો જિન અનંતનો એ, વજ લંઘન શ્રી ધર્મ,  
શાંતિ લંઘન મુગલો, રાજે ધરમનો લર્મ. ૫

કુંઝ લંઘન પોકડો, અર જિન નંદાવર્તી,  
ઘર લંઘન મહિં પ્રલુ, કાચેપો મુનિસુગ્રત. ૬

નમિ જિનને નીલો કમલ, પામીએ પાંકજ માંછી,  
શાખ લંઘન પ્રલુ નેમળુ, દીસે ઉંચે આંછિ. ૭

પારસનાથને ચરણ સર્પ, નીલવર્ણ શીલિત,  
સિંહ લંઘન કંચન તણું, વર્ધમાન વિષ્ણુાત. ૮

ધર્ષી પરે લંઘન ચિનવીએ, આલખીએ જિનરાય,  
જાનવિમલ પ્રલુ સેવતાં, લક્ષ્મીરતન મૂરિરાય. ૯

(3)

### શ્રી પ્રલુના ભવનું ચૈત્યવંદન.

પ્રથમ તીર્થંકર તણા હુંવા, ભવ તેર કહીજે,  
શાંત તણા ભવ આર સાર, નવ ભવ નેમ લડી જે. ૧

દૂસ ભવ પાસ જિલ્લાંદને, સત્યાવીશ શ્રી વીર,  
ગોપ તીર્થંકર વિહું ભવે, પામ્યા ભવજળ તીર. ૨

જયાંથી સમકિત ઇસ્સીથું ત્યાંથી ગળ્ખીએ તેણ,  
ધીર વિમળ પંહિત તણોા, જાન વિમળ ગુણ ગેણ. ૩

(4)

### શ્રી પ્રલુના વર્ણનું ચૈત્યવંદન.

પદ્મપ્રલુ ને વાસુપુન્ય, હોય રાતા કહીએ,  
ચંદ્રપ્રલુ ને મુવિધિનાથ, હોય ઉજ્વલ લહીએ.

મહિનાથ ને પાર્વતનાથ, હો નીલા નિરાયા,  
મુનિસુગ્રત ને નેમનાથ, હો અંજળ સરિયા.

સોણે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ,  
ધીરવિમળ પણિન તણો, જ્ઞાન વિમળ કહે શીય.

### જગચિંતામણિ ચૈત્યવંદન.

જગચિંતામણિ જગનાહ, જગ ગુર જગ રજાખણુ,  
જગઘંદેવ જગ સંથવાહ, જગ ભાવ વિચારખણુ.  
અડૂબય સંઠવિય, રૂપ કર્મકુ વિષુસણ,  
ચઉનિસંપિ જિષુવર, અયંતુ અપદિલ્લય સાસણ. ૧

કર્મ ભૂમિહિં કર્મ ભૂમિહિં, પદમ સંઘયણી,  
ઉક્કોસય સતારિસય, જિષુવરાણ વિહૃરંત લખાય,  
નવ કેાદિહિં કેવલિણ, કેાદિ સહુસસ નવ સાહુ ગમદઈ,  
સંપત્ત જિષુવર વીસમુણિ, મિહું કેાદિહિં વરનાણુ, ૨  
સમણુહ કેડી સહુસ હુચ્ય, થુણિ જિય નિચ્ય વિહુણિ,  
જયઉ સામી જયઉ સામી, રિસહુ સતુંજિ,  
ઉજિજંત પહુનેમિજિણુ, જયઉ વીર સચ્ચાઉરિ મંણણ,  
ભરૂચચ્છહિં સુણિમુખયં, સુહુરિપાસ હુહુરિચ્ય ઘંણુ.  
અવર વિહૃહિં તિથયરા, ચિહુંદિસિ વિદિસિ જિંકેવિ,  
તિચાણુાગ્ય સંપદચ્ય, વંદું જિષુ સંવેવિ. ૩

સતાણુધ સહુસસા, લાખા છપત અકુ કેાદિયો,  
ભાતિસ આસિઆઈ, તિચ લોચે ચેઢાયે વાઢ, ૪  
ગનરસ કેાદિ સથાઈ, કેાદિ ભાયાલ લાખા અહવના,  
ઘરીસ સહુસ અસિઆઈ, સાસયામેંબાઈ પણુમાનિ. ૫



સ્તવનો

(૧)

શ્રી મહાવીરસ્વામીનું સ્તવન.

વીર પ્રભુને ચિત્ત ધારજે, સદારે જીવ, વીર પ્રભુને ચિત્ત ધારજે,  
કાળ અનાદિના મોહુ અરિ જે, વિવેક અસીથી તું ભારજે,  
સદા રે૦ ॥ ૧ ॥

આર્ત ને વૈદ ધ્યાન કલ્યાં છે, ધર્મથી તેને નિવારજે,  
સદા રે૦ ॥ ૨ ॥

ચોરાશી લક્ષ ચોની માંહે દેરા ફરતાં, અશાતી જીવને તારજે  
સદા રે૦ ॥ ૩ ॥

કુદેવ કુદ્ધમી ચિત્ત વિષેથી, સ્વરૂપ જાણી વિસારજે  
સદા રે૦ ॥ ૪ ॥

દીન જનોનાં દુઃખ જોઈને, રહેમ ધરીને ઉધારજે  
સદા રે. ॥ ૫ ॥

પરોપકારી જીવ થયા જે, ગુણો તેના તું સંભારજે  
સદા રે. ॥ ૬ ॥

(૨)

શ્રી નેમનાથનું સ્તવન.

હારે કીને હેડા હુમારા સ્વામી;  
સ્વામીજી અત્ય જામી રે, કીને. ૨૬  
આઠ ભવકી પ્રીતિ પ્રકાશી,  
નન્મે ગયા શિવ ગામીરે કીને.  
॥ ૧ ॥

सहस्रावनकी कुंज गतनमें;  
भज्या मुने अंतरजभीरि, कीने।                   ॥ २ ॥

आप चले गीरनारकी उपर;  
नारी तमारी देवता पाभीरि, कीने।           ॥ ३ ॥

कहे करतुर प्रलु नेम नगीने,  
कुंभ छु आज शिर नाभीरि, कीने।           ॥ ४ ॥

(3)

## श्री भव्विनाथस्वामीनुँ स्तवन

( कसुंधी कसुंधी कसुंधी रंग हो गये—अराग )

भद्रीलु भद्रीलु भद्रीलु, भद्रीलु प्रलु भील गये—           (२)

सदृष्ट हुओ अवतार, आजे भद्रील०                                   ॥ १ ॥

ऐकतो में दर्शन में दर्शन, में दर्शनकुं आयो—           (२)

मुख देखी हृष्ट हुओ हुर, आजे भद्रीलु。                           ॥ २ ॥

ऐकतो भन मेहुं भन मेहुं, भन मेहुं तारा इपने—           (२)

बुद्ध्या कुरुप संसार, आजे भद्रीलु。                                   ॥ ३ ॥

ऐकतो में पापी में पापी, में पापीऐ पाप धोयुं—           (२)

प्रलु युण सरोवर पाज, आजे भद्रीलु。                                   ॥ ४ ॥

ऐकतो तुं ब्राता तुं ब्राता तुं ब्राता तुं ब्राता—           (२)

अवर न तुज विना डेय, आजे भद्रीलु。                                   ॥ ५ ॥

ऐकतो युण गाया युण गाया, युण गाया तेरा भित्र भंडो—(२)

प्राणुके तुम ओधार, आजे भद्रीलु。   ॥ ६ ॥

(४)

॥ શ્રી વીર પ્રભુનું સ્તવન ॥

( આવો સખી આવો, માને મોતીડી વધાવો એ રાગ )

ગાવો લવિ ગાવો, મહાવીર ગુણ ગાવો. ( ૨ )

વીર ગુણ ગાવો, મહાવીર ગુણ ગાવો. ગાવો. ( ૨ )

ચિર મળ રાણી પ્રભુ, અંગ પખાણી,

કેસર ચંદ્ર ઘન ઘરી પ્રભુ ધ્યાવો. ગાવો. ॥૧॥

આલમ ગંધ અનાહિની રાણી

માલતી મોગર શુલ પુષ્પ ચહાવો. ગાવો. ॥૨॥

અષ્ટ પ્રકારી સ્તાત્રપુજા કરી,

લાવના લાવી શુલ અંગી રચાવો. ગાવો. ॥૩॥

અક્ષિ સ્તુતિ શાસનપતિની કરી

જ્ઞાન ધ્યાન એકતાન લગાવો. ગાવો ॥ ૪ ॥

થૈ થૈ નૃત્ય કરી ઝળનૈવેદ ધરી,

થાળ ભરી ભરી મોતીડી વધાવો. ગાવો ॥ ૫ ॥

અમલસાડની મહાવીર મંડળી,

આવાગમન નયનથી ન પાવો. ગાવો ॥ ૬ ॥

(५)

મિથ્યા સંસાર.

( કામ છે દુષ્પ વિકારી—એ રાગ )

દ્વાલત દુનિયા હારી, જાવું જરુ દ્વાલત દુનિયા હારી.

જનમ્યો તે જવાનો નકી ( ૨ ) કેષ રહ્યું નહીં ભરી;

પલની અખર નહીં પ્રાણીને, કાળ ભરે શ્રીરહાલી,—જાવું. ॥૧॥

પાંડવ કૌસય રામ ગળનન કંસ ગયોરે મોરારી;  
 રાવણ યોધ્યો રણમાં હાર્યો, કાષણી કીધી પથારી—જવું. ॥૨॥  
 સત્યવાહી હરિશ્ચંદ ગયા, વળી હકેમ ને અધિકારી,  
 દીર ગયા ને ધીર ગયા ડેઢ, અમીર ગયા નીરધારી—જવું. ॥૩॥  
 મહામલ ચોક્કા ગત પામ્યા, રણમાં યશ વિસ્તારી,  
 ચક્કવર્તી નિજ વૈભવ મૂકી, ચાલ્યા એકલા હારી—જવું. ॥૪॥  
 માત પિતા સુત નૌતમ નારી, પ્રીત પલકમાં વિસારી;  
 પાપ પુણ્યની પણો બાંધી, જાય ખલક લે વિચારી—જવું. ॥૫॥  
 પાપ પ્રયોગે પુંજ વધારી, અધિક કરી રખવાળી,  
 કેટી એક ન સાથે આવે, હુસ્ત ચોર જનારી— જવું. ॥૬॥  
 અંત સરો સૌ વૈભવ દ્રોગાય, સત્ય ધર્મ સુખકારી,  
 સાકરચંદ સદા પ્રલુ ધ્યાને, દુર્ગિત દૂર નિવારી,—જવું. ॥૭॥

(૬)

॥ અમે મેમાન ॥

રાગ કાઢી

અમે તો આજ તમારા એ હિનના મેમાન;  
 સર્કણ કરો આ સહજ સંમાગમ, સુખનું એજ નિદાન અમે. ૧  
 આવ્યા કેમ જશું તે રીતે, સર્વે એમ સમાન  
 પાછા કેષ હિંને નહીં ભળીએ, કયાં કરશો રસ્તાન અમે. ૨  
 સાચવણે સંખ્યા પરસ્પર, ધર્મ રાખી ધ્યાન,  
 સંપી સહદ્યુષ લેણે હેણે, દૂર કરી અભિમાન અમે. ૩ ॥  
 લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન,  
 હોય કશી કડવાશ અમારી, તો પ્રિય કરણે પાન અમે. ૪ ॥

અથ શ્રી શૈખો.

( ૧ )

॥ બીજની શૈય. ॥

દિન સકળ મનોહર, બીજ દિવસ સુવિશેષ,  
રાય રાણુ પ્રણમે, ચંદ તણી જિહાં રેખ;  
તિહાં ચંદ વિમાને, શાચ્છતા જિનવર જેહ,  
હું બીજ તણે દિને, પ્રણમું આણી નેહ.

( ૨ )

॥ પાંચમની શૈય. ॥

આખણ શુદ્ધ દિન પંચમીએ, જન્મયા નેમ જિખુંદ્તો,  
શ્યામ વરણ તનુ શોલતુએ અલચારી લગ્નવંતતો;  
સહુસ વરસ પ્રલુ આઉઝુએ, અલચારી લંગવંતતો,  
અષ્ટ કરમ હેલે હણીએ, પહેલાતા સુક્તિ મંહંતતો.

( ૩ )

॥ આડમની શૈય ॥

મંગળ આડ કરી જસ આગળ, ભાવ ધરી સુર રાજજી,  
આડ જતીના કળશ કરીને, નવરાવે જિનરાજજી;  
વીર જિનેદીર જન્મ મહોત્સવ, કરતાં શિવસુખ સાધેલ.  
આડમનું લપ કરતાં અમધર, મંગળ કમળા વાધેલ.

( ૪ )

॥ એકાદશીની શૈય. ॥

એકાદશી અતિ રૂઘી, ગોનિંદ પુછે નેમ,  
કોણ કરણ એ પર્વ મોકું, કહો મુજશું તેમ;

જિનવર કલ્યાણુક અતિ ઘણાં, એકસેને પચાસ,  
તેણે કારણ એ પર્વ મોડું, કરો માન ઉપવાસ.

(૫.)

## ॥ સિદ્ધચક્ષુની થોય..॥

જિન શાસન વાછિત, પૂરણ હેવ રસાળ,  
ભાવે ભવિ ભણીએ, સિદ્ધચક ગુણમાળ;  
ત્રિહું કાળે એહની, પૂજા કરે ઉજમાળ,  
તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ.

(૬.)

## ॥ નિત્ય સ્તુતિ ॥

સકળ કરેમ વારી, મોક્ષ ભાગાધિકારા,  
ત્રિલુલન ઉપકારી, કેવલ જ્ઞાન ધારી;  
ભવિયણ નિત્ય સેવો, હેવ એ અક્ષિ ભાવે,  
એ જિન લજંતાં, સર્વ સંપત્તિ આવે.

(૭)

## ॥ શ્રી જિન પંચક થોય ॥

( હૃદિગીત છંદ )

શ્રીઆદિ શાંતિ નેમિ પાસ, વીર શાસન પતિ વલી  
નમો વર્ત્તમાન અતીત અનાગત, ચોવીશે જિન મન મળી;  
જિનવરની વાણી ગુણની આણી, પ્રેમે પ્રાણી સાંભળી,  
થયા સમકિત ધારી, ભવનિહારી, સેવે સુરવર લળી લળી.



( ૯ )

॥ સીમંધર સ્વામીની થોય ॥

શ્રી સીમંધર જિનવર, સુઅકર સાહિય હેવ,  
અરિહુંત સકળની, ભાવ ધરી કરું સેવ;  
સફળ આગમ ધારક, ગણુધર ભાગ્યિત વાણો.  
જ્યોતંતી આણા, શાનવિમળ ગુણ આણી.

( ૧૦ )

॥ શ્રી પંચતીર્થ થોય ॥

અષ્ટાપદ શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર;  
વાસુપુન્ય ચંપાનયેર સિદ્ધા, નેમ રેવા ગિરિવર,  
સમેત શીખરે વીસ જિનવર, મોક્ષ પહોંચા સુનિવર,  
ચોવીશ જિનવર નિત્ય વંદન, સમય સંઘ સુહંકર.

( ૧૦ )

॥ શ્રી જિનેશ્વર લગ્વાનની થોય વા

ભાવે કરીને પુન્ય, શ્રી જિનેશ્વર હેવા,  
નભું નિત્ય નેહે, આપણે તુમ સેવા.  
તુજ સુખદું દીડી, થાય આનંદ ભારી,  
કેવળી મોક્ષ રાયા, વિદ્ય કીર્તિ વધારી.



અથ શ્રી સન્જાય.

( ૧ )

॥ વૈરાગ્યની સન્જાય ॥

ઉંચા મંદિર માળીયાં, સોઝ વાળોને ચુંટો ॥  
 કહુડો કહુડો એને સહુ કહે, જાણે જન્મોજ ન હોતો ॥  
 એકરે દિવસ એવો આવશે, મને સખ્લોજ સાલે ॥ ૧ ॥  
 મંત્રી ભજ્યા સર્વ કારીમા, તેનું કંઈ નન્દ ચાલે ॥ એક૦ ॥ ૨ ॥  
 સાવ સોનાનાંરે સાંકળાં પહેરણ નન્દનન વાધા ॥  
 ઘોણુંરે વસ્તર એના કર્મનું, તે તો શોધવા લાજ્યાં ॥ એક૦ ॥ ૩ ॥  
 ચર્ચ કઠાઈ અતિધારું, બીજાનું નહીં કોણું ॥  
 આખરી હુંઢી એના કર્મની, રે તો આગળ હેણું ॥ એક૦ ॥ ૪ ॥  
 કેનાં છાર ને કેનાં વાછર, કેનાં ભા ને ભાપ ॥  
 અંતકાળે જાણું જીવને એકલાં,, સાથે પુણ્ય ને પાપ ॥ એક૦ ॥ ૫ ॥  
 સંગીરે નારી એની કામિની, ઉલ્લી દગ્ધમળ જુઓ ॥  
 તેનું પણ કંઈ ચાલે નહીં, એડી હુસે રૂએ ॥ એક૦ ॥ ૬ ॥  
 વહુલાં તે વહુલાં શું કરો, વહુલાં વોળાવી વાગશે ॥  
 વહુલાં તે વનનાં લાકડાં, તે તો સાથેજ ઘગશે ॥ એક૦ ॥ ૭ ॥  
 નહીં તાણી નહીં તુંબડી, નથી તરવાનો આરો ॥  
 ઉદ્યરતન પ્રભુ ધરું ભણે, મને પાર ઉતારો ॥ એક૦ ॥ ૮ ॥

( ૨ )

॥ માનની સન્જાય ॥

રે જીવ માન ન દીજુએ, માને વિનય ન આવે રે,

વિનય વિના વિદા નહીં, તો કિમ સમકિત પાવેરે ॥ રેણુવ૦ ॥૧॥  
 સમકિત વિષુ ચારિન નહીં, ચારિન વિષુ નહીં મુક્તિરે ॥  
 મુક્તિના સુખ છે શાખ્યતાં, તે કેમ લહીએ જુક્તિરે ॥ રેણુવ૦ ॥૨॥  
 વિનય વડો સંસારમાં, ગુણમાં અવિકારીરે ॥  
 માને ગુણ જાણી, પ્રાણી જોજે વિચારીરે ॥ રેણુવ૦ ॥૩॥  
 માન કર્યું જે રાવણે, તે તો રામે માર્યેરે ॥  
 દુર્ઘટન ગર્વે કરી, અંતે સવિ હુએરે ॥ રેણુવ૦ ॥૪॥  
 સૂકાં લાકડાં સારિએા, દુઃખદાચી એ ઘોટેરે ॥  
 ઉદ્યરતન કહે માનને, હેજે દેશ વધારે ॥ રેણુવ૦ ॥૫॥

### હોરી.

રંગ મચ્યો જિન દ્વાર રે, ચાલો ઐલીએ હોરી ॥ પાસળકે  
 દરખાર રે ॥ ચાલોઠ ॥ ઝાગનકે દિન ચાર રે ॥ ચાલોઠ આંકણી ॥  
 કનક કચ્ચાળી કેસર ઘાળી, પુજે વિવિધ પ્રકાર રે ॥ ચાલોઠ ॥૧॥  
 કૃષ્ણાગરકે ધુપ ઘરત હૈ, પરિમળ બહેકે અપાર રે ॥ ચાલોઠ ॥  
 ૨ ॥ લાલ ગુલાલ અણીલ ઉડાવત, પાસળકે દરખાર રે ॥ ચાલોઠ  
 ॥ ૩ ॥ ભરી પીચકારી ગુલાલકી છીરકે, વામાદેવી કુમાર રે  
 ॥ ચાલોઠ ॥ ૪ ॥ તાલ મૃદુંગ વેણુડે બાજે, ભરી જુંગળ રણકાર  
 રે ॥ ચાલોઠ ॥ ૫ ॥ સખ સખીયન મીલી ધુંવાર સુનાવત, ગાવત  
 મંગળ સાર રે ॥ ચાલોઠ ॥ ૬ ॥ રતનસાગર પ્રલુ ભાવના લાવે,  
 મુખ જોલે જ્યકાર રે ॥ ચાલો ઐલીએ હોરી ॥ ૭ ॥

## લાવણીઓ.

( ૨ )

## ॥ વસંત ॥

વસંત પંચમીને નૌતમ ક્ષેત્ર, લગ્ન લીધો નિરધાર લલના ॥  
સર્જ સાજન ભળો તોરણે આયે, પશુડે માંડ્યો પોકાર ॥  
વસંત વિવાહ આદર્યો હો ॥ ૧ ॥

લીલા પીળા વાંસ રંગાવો, ચોરી ચિતરાવો ચાર લલના  
ભાવે તે દેવતા વેદ ભજે છે, મંગળ ગાને સખીયાં ચાર ॥  
વસંત વિવાહ આદર્યો હો ॥ ૨ ॥

આહ લલની હું નારી તમારી, સ્થોરે હમારો વંડ લલના ॥  
ભવો ભવની હું દાસી તમારી, કાળો છે કામણુગારો ॥  
વસંત વિવાહ આદર્યો હો ॥ ૩ ॥

નેમજ હૈયામાં કોધે ભરાણું, સંસારમાં નહિં સાર લલના ॥  
રથ વાળો નેમ ગિરનારે ચાલ્યા, રોતી રહે રાજુલ નાર ॥  
વસંત વિવાહ આદર્યો હો ॥ ૪ ॥

રાજુલ ચાલ્યાં સંજમ લેવા, જઈ ચટ્યાં ગઠ ગિરનાર લલના ॥  
કર નેડી ગૌતમ પાયે લાગું, સાચો છે દીન દ્વાળ ॥  
વસંત વિવાહ આદર્યો હો ॥ ૫ ॥

( ૨ )

## ॥ શાંતિનાથની લાવણી. ॥

સુણ શાંતિ શાંતિ દાતાર, જગત આધાર, અચળ જિનવરણ, અચળ  
જિનવરણ, કિંકર શિર નામી તને સુણુંને અરણ ॥ એ આંકણી ॥ કૈવચદ  
જિન તુજ નામ, સુણી ગુણું ધામ, દરામ ધરી મનમાં, દરામ ધરી મનમાં

આવ્યો હું તારે શરણુભાઈ ભવબતમાં ॥ કોધાદિક વૈરી ચાર દિને બહુ માર,  
પડ્યા મુજ કેડે, પડ્યા મુજ કેડે વળી અર્નિર્ત પુન્ય કહંખકેને ઇઝેરે ॥  
મુજ હુઃખદારનો અંત, લાની ભગવાંત, તુમ સમ કરજી, તુમ સમ કરજી, કિંકર  
શિર નામી તને સુણાવે અરજી ॥ ૧ ॥ મુજ અવગુણુને જિનરાજ, માઝ કર  
આજ, કહું કર જોડી કહું કર જોડી, ભવકુપથી તાર કર્મને તોડી ॥ મેં  
પૂરણુ કર્યાં કુર્મ, ધર્યો નહીં ધર્મ, અર્થ ભવ પામી, અર્થ ભવ પામી;  
વળી અમર તણે અવતાર થયો બહુ કામી ॥ હવે તુજ વિના જિનનાથ, જોહું  
નહીં હાથ, હરીને હરજી, હરીને હરજી; કિંકર શિર નામી તને સુણાવે અરજી  
॥૨॥ વાસવ સેવિત ભગવાનુ, કરે ગુણમાન, દર્શ હો જિનજી, દર્શ હો જિનજી;  
તુજ દરિસણુમાં જગદીશ, મુજ મન લીનજી ॥ તુમ ચરણ જલજની સેવ,  
આપને હેવ, જગત ઉપગારી, જગત ઉપગારી; પદ પંજ સેવી, તુર્ત વહું  
શિવનારી ॥ માણિક વહે તુમ પાય, વિસુ જિનરાય, પાપચય હરજી, પાપ  
ચય હરજી, કિંકર શિરનામી તને સુણાવે અરજી ॥૩॥

### મહાવીરસ્વામીનું પારણું:

માતા નિશદ્ધા કુલાવે પુત્ર પારણે, ॥ ગાવો હાદો હાદો હાલદ્વાંતાં  
ગીત ॥ સોના રૂપાને વળી રતે જાયું પારણું રેશમ દોરી ધુધરી વાગે હુમ  
હુમ રીત ॥ હાદો હાદો હાદો હાદો મારા નંદને ॥ ૧ ॥ જિનજી પાસ  
પ્રભુથી વરસ અઠાસેં અંતરે, હોશે ચોવિશમે તીર્થંકર જિન પરિમાણ ॥  
કેશીસ્વામી મુખથી એહાવી વાણી સાંભળી, સાચી સાચી હુદ્ધ તે મારે અમૃત  
વાણ ॥ હાદો ॥ ૨ ॥ ચૌહે સ્વપ્ને હોનો ચક્રી કે જિનરાજજી, વીત્યા આરે  
ચક્રી નહીં હવે ચક્રી રાજ ॥ જિનજી પાસ પ્રભુના શ્રીકેર્ણા ગણુધાર, તેહને  
વચને જાણ્યા ચોવિશમા જિનરાજ ॥ મારી કુષે આવ્યા ત્રણ લુવન શિરતાજ,  
મારી કુષે આવ્યા તરણુ તારણુ જિનરાજ ॥ હું તો પુન્ય પનોતી ઈદ્રાણી  
થઈ આજ ॥ હાદો ॥ ૩ ॥ મુજને હોહાદો ઉપન્યો એસું ગજચ્યાંબાઈઓ,  
સિંહાસનપર એસું ચામર છત્ર ધરાય ॥ એ સહુ લક્ષ્મણ મુજને નંદન તારા  
તેજનાં, તે હિન સંભાડું ને આનંદ અંગ ન માય ॥ હાદો ॥ ૪ ॥ કરતથ

પગતલ લક્ષ્મણ એક હળરને આડ છે, તેણું નિશ્ચય જાણ્યા નિરનવર શ્રી જગહીશ || નંદન જમણી જથે લાંઘન સિહ બિરાજતો, મેતો પહેલે સ્વખે દ્વારા વિશવાવિશ || હાંદો ૦ || ૫ || નંદન નવલા અંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છો સુકુમાળ || હસરો ભોજાઈઓ કહી લાડકા દીપર માહરા, હસરો રમશો ને વળી ચુંટી ખણું ગાલ || હસરો રમશો ને વળી હુંસા દેશી ગાલ || હાંદો ૦ || ૬ || નંદન નવલા ચેડા રાજના ભાણેજ છો, નંદન નવલી પાંચસે માભીના ભાણેજ છો || નંદન માભતીયાના ભાણેજન સુકુમાળ, હસરો હાથે ઉછાળી કહીને નાના ભાણેજન, આંઝને વળી દ્યપું કરરો ગાલ || હાંદો ૦ || ૭ || નંદન માભા માભી લાવરો ટોપી આંગલાં, રતને જડીયાં જુલડો મોતી કસરી કેર || નીજાં પીઠાં ને વળી રાતાં સરવે જાતનાં, પહેરાવરો માભી મારા નંદ કિશોર || હાંદો ૦ || ૮ || નંદન માભા માભી સુખહલી બહુ લાવરો, નંદન ગજવે ભરરો લાહુ મોતીચુર || નંદન સુખડા જોઈને દેશે માભી ભાણું, નંદન માભી કહેરો જીવો સુખ ભરપૂર || હાંદો ૦ || ૯ || નંદન નવલા ચેડા માભીના સાતે સતી, મારી ભત્તીજુને ઐન તમારી નંદ || તે પણ ચુંને ભરવા લાખણ સાઉ લાવરો, તુમને જેઠ જેઠ હેઠે અધિકો પરમાનંદ || હાંદો ૦ || ૧૦ || રમવા કાને લાવરો લાખ દ્યકાનો હુંધરો, વળી સ્કા મેના પોપટને ગજરાજ || સારસ હંસ કોયલ તીતરને વળી મોરજુ, માભી લાવરો નંદ તમારે કાજ || હાંદો ૦ || ૧૧ || છેપન કુમરી અમરી જળ કળરો નવરાતીયા, નંદન તમને અમને કેલીધરની માંહે || મુલની વૃદ્ધિ કોધી યોજન એકને માંડલે, બહુ ચિરંજીવો આશાપ દીધી તુમને લાંદ || હાંદો ૦ || ૧૨ || તમને મેઢગિરિપર સુરપતિએ નવરાતીયા, નિરખી નિરખી હરખી સુકૃત લાલ કમાય || સુખડા ઉપર વાડ કોડી કોડી ચંદ્રમા, વળી તનપર વાડ ગોરી ચુણુસમુદ્દાય || હાંદો ૦ || ૧૩ || નંદન નવલા ભણુયા નિશાળે પણ મૂકશું, ગજપરે અંબાડી એસાડી મેટો સાજ || પસલી ભરશું શ્રીકૃષ્ણ દ્વારા નાગર વેલશું, સુખલડી લેશું નિશાળીયાને કાજ || હાંદો ૦ || ૧૪ || નંદન નવલા મોટા થારો ને પરણુાનશું, બહુ વર સરખી જેડી લાવશું રાજકુમાર ||

સરખા વેવાઈ વેવાણો પદ્મરાવથું, વર વહુ પોંખી લેણું જોઈ જોઈને દેદાર  
 ॥ હાલોં ॥ ૧૫ ॥ સાસે પીયર મારાં મેહુ પદ્મ નંદન ઉજળા, મારી  
 કુપે આવ્યા તાત પનોતા નંદ ॥ માહરે આંગણુ વુહ્યા અમૃત દુધે મેહુલા,  
 માહરે આંગણુ ઇણીયા સુરતર સુખના કંદ ॥ હાલોં ॥ ૧૬ ॥ એણી પરે  
 ગાયું માતા નિશલા સુતનું પારથું, ને કોઈ ગારો દેશે પુત્ર તણું સમાજ  
 ॥ અદીમોરા વરણું વીરનું લાલદર, જ્યે જ્યે મંગળ હોને દિપવિજય  
 કવિરાજ ॥ હાલોં ॥

## ॥ ગુરૂવંદન ॥

ગુરુની સન્મુખ ઉભા રહી એ અમાસમણુ દેવા, પઢી ધર્માકારનો  
 પાડ એલાનો.

ધર્માકાર સુહરાઈ સુહદેવમિ ॥

સુઅ તપ શરીર નિરાખાય ॥

સુઅ સંજમ જત્રા નિર્બંધોછોય ॥

સ્વામી શાતા છેણ ॥

ભાત પાણીનો લાલ દેનેણ ॥

પઢી જમણો હાથ લો ઉપર સ્થાપા ને તે ઉપર મસ્તક રાખી અ-  
 મુહુર્દીઓનો પાડ એલાનો.

ધર્માકારેણ સંહિસહ ભગવન् ॥ અપ્લુદુચ્ચોમિ, અર્દેલતર દેવસિય

( અપોર પહેલાં ગુરને વંદન કરતી વખતે રાધાં એલાનું અને  
 અપોર પઢી વંદન કરતી વખતે દેવસિયાં એલાનું.)

જર્દિયિ અપતિયાં પરપતિયાં ॥

ભતે પાણે વિણુએ વેઆવચે ॥

આલાને સંભાવે ઉન્નામણે ॥

સમાસણે અંતર ભાસાએ ॥

ઉવરિ આસાએ જર્દિયિ ॥

મજ વિષુય પરિ હીણું ॥

સુહુમં વા આયાર વા ॥

તુંને જાણુહ, આહ ન યાણુભિ ॥

તસ્સ ભિચાભિ દુકું ॥

છેવટ એક ખમાસમણો દેવું.

ધર્માભિ ખમાસમણો, વંદિં જવણિજનાએ; નિસીહિચાએ, મધ્યએણું  
વંદાભિ.



### અથ સામાયક લેવાની વીધી.

પ્રથમ ઉંચે આસને પુસ્તક પ્રમુખ મુકું; આવક આવિકાએ કટાસણું;  
મુહુપતિ, ચરવળો લઈ શુદ્ધ વલે જગ્યા પુંજ કટાસણો ઉપર ઐસનું, મુહુપતિ,  
ડાખા હાથમાં મુખ પાસે રાખી જમણો હાથ ચાપનાજ સન્મુખ રાખી એક  
નનકાર ગળુંવો, પણી પંચિંહિયનો પાડ ભણુંવો.

### અથ પંચિંહિય.

પંચિંહિય સંવરણો,, તહ નવ વિહ અંભચેર ગુતિ ધરો; ચડવિહ કસાય  
મુકો, ધાય અડારસ શુણેહિં સંનુતો ૧. પંચ મહાય જુતો, પંચવિહાયાર  
પાલણું સમયો; પંચ સમિઓ તિનુતો, છતીસુ શુણો ગુરુ મજજ—૨૦  
( તાર પણી ખમાસમણું દેવું )

ધર્માભિ ખમાસમણો વંદિં જવણિજનાએ નિસીહિચાએ મધ્યએણું વંદાભિ  
( તાર પણી ધરેયા વહિઅનો પાડ ભણુંવો )

### અથ દરિયા વહિયા.

ધર્મજાકરેણ સંહિતાઃ ભગવન्, ધરિયા વહિયા પડિકુમાનિ, ધર્મ  
ધર્માનિ પડિકુમિહિ ધરિયા વહિયાએ વિરાહણાએ ગમણાગમણે પાણુકુમણે  
બિયકુમણે હરિયકુમણે ઉસાઉતિંગ પણુગહગ મફી મક્કડા સંતાણા સંકુમણે  
જે મે શ્વા વિરાહિયા, એગિંહિયા એઈહિયા તેઈહિયા ચહરિહિયા પંચિહિયા,  
અલિહિયા વતિયા કેસિયા, સંધાઠાયા સંઘટિયા પરિયાવિયા કિલામિયા ઉદ્વિયા  
કાણાએડાણું સંકામિયા, શુયિયાએ વવરોવિયા તરસ મિચ્છામિ દુકું.

( ત્યાર પણી તરસ ઉત્તરીનો પાઠ ભણુંબો. )

### અથ તરસ ઉત્તરી

તરસ ઉત્તરી કરણેણું, પાયચિંત કરણેણું વિસોલી કરણેણું વિસહિ-  
કરણેણું ખાવાણું કર્માણું નિગધયણ ફૂઅએ હામિ કાઉસરગં.

( ત્યાર પણી અનત્થ ઉસસિએણુનો પાઠ ભણુંબો. )

### અથ અનત્થ ઉસસિએણું

અનત્થ ઉસસિએણું નીસસિએણું ખાસિએણું ધીએણું જંભાદીએણું  
ઉડુએણું વાયનિસરગેણું ભમલિએ પિતમુચ્છાએ સુહુમેહિ અંગ સંચાલેહિ  
સુહુમેહિ ઐલ સંચાલેહિ સુહુમેહિ દિહિ સંચાલેહિ, એવ માઈએહિ આગા-  
રેહિ અભગ્રો અવિરાહિએ, હુજીજ મે કાઉસરગો જાવ અરિહંતાણું ભગવંતાણું  
નમુક્કારેણું ન પારેમિ, તાવકાયં હાણેણું મોણેણું ઝાણેણું અપાણું વોસિરામિ.

( ત્યાર બાદ એક લોગસનો અથવા ચાર નવકારનો કાઉસર કરી  
પારી પ્રગટ લોગસ કહેણો. )

### અથ લોગસ.

લોગસ ઉજનોઅગરે, ધ્રમ તિથયરે નિષે, અરિહતે કિતાદીસં ચક-  
વિસપિ ડેવલી, ઉસલુ મનિયાં ચ વહે સંભવ મલિણદાણું ચ સુમાઈ ચ,

ઘડુમપહેં સુપાસં નિષ્ઠાં ચ ચંદ્રપહેં વહેં. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજનજંસ વાસુપુજાં ચ, વિમલ મણુંતં ચ નિષ્ઠાં ધર્મં સંતિં ચ વંદામિ, કુંથું અરં ચ મહિં વહેં મુણિસુષ્વયં નમિ નિષ્ઠાં ચ, વંદામિ રિદેનેમિં પાસં તહે વદ્ધમાણું ચ. એવં મચે અભિયુચ્ચા વિહૃય રૂપમલા પહીણુ જરમરણા, ચંડીસિપિ નિષ્ઠાવરા તિથ્યયરા મે પરીયંતું કિત્તિય બંધિ મહિયા ને એ લોગરસ ઉત્તમા સિદ્ધા, આઇગ્ર ઐહિલાલં સમાહિનર મુત્તમં દિંતું ચંદેસુ નિમ્ભલયરા આધ્યાત્મિક અહિયં પથાસયરા સાગર વર ગંભિરા, સિદ્ધા સિદ્ધિં મમ હિસંતુ.

( પછી ખમાસમણુ દૈધ, ધર્યાકારેણુ સંહિસહ ભગવનુ સામાયિક મુહુ-પતિ પદિલેહું ધર્યાં ” એમ કહેતું પછી મુહુપતિ તથા અંગની પદિલેહણના પચાશ બોલ કહી મુહુપતિ પદિલેહણી. પછી ખમાસમણુ દૈધ “ ધર્યાકારેણુ સંહિસહ ભગવનુ સામાયિક સંહિસહ ધર્યાં ” વળી ખમાસમણુ દૈધ “ ધર્યાકારેણુ સંહિસહ ભગવનુ સામાયિક હાઉ ધર્યાં ” એમ કહી એ હાથ જેડી એક નવકાર ગણી પછી “ ધર્યાકારી ભગવનુ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચયરાવોળ ” તે વારે વડીલ કરેમિલતે કહે. વડીલ ન હોય તો જાને પાડ ભણુવો )

### અથ કરેમિલતે.

કરેમિલતે સામાધ્યં, સાવજન્યં જોગં પચ્ચાખામિ, જાવનિયમં પજાતુ-વાસામિ, દુવિહિં તિવિહેણું મણેણું વાયાએ કાએણું, ન કરેમિ ન કારનેમિ તસ્સ ભંતે પડિકુમામિ નિંદામિ ગરિહામિ, અપ્પાણું વોસિરામિ.

(પછી ખમાસમણુ દૈધ “ધર્યાકારેણુ સંહિસહ ભગવનુ સજજાય સંહિસહ ધર્યાં ” વળી પાણું ખમાસમણુ દૈધ “ ધર્યાકારેણુ સંહિસહ ભગવનુ સજજાય કરું ધર્યાં ” એમ કહી ત્રણ નવકાર ગણુવા પછી એ વડી ધર્મ ધ્યાન કરું.

### મુહુર્પત્તિના પર્ચીશ બોલ.

સુત્ર અર્થ તત્વ કરી સદ્ગું ૧, સમકિન મોહની ૨, મીશ મોહની ૩, મિથ્યાત્વ મોહની પરીહરે ૪, કામરાગ ૫, સ્નેહરાગ ૬, દાદ્ધિરાગ પરીહરે ૭, સુહેવ ૮, સુગુરુ ૯, સુધર્મ આદરે ૧૦, કુહેવ ૧૧, કુગુરુ ૧૨ કુધર્મ પરીહરે ૧૩, રાન ૧૪, દર્શન ૧૫, ચારિત આદરે ૧૬, રાન ૧૭, દર્શન ૧૮, ચારિત વિરાધના પરીહરે ૧૯, મનગુરુમિ ૨૦, વચનગુરુમિ ૨૧, કામગુરુમિ આદરે ૨૨, મનહંડ ૨૩, વચનહંડ ૨૪, કાયહંડ પરીહરે ૨૫.

### અંગના પર્ચીશ બોલ.

હાસ્ય ૧ રતી ૨ અરતી ૩ પરીહરે, ડાએ હાથે પડીલેવા, ભય ૪ સોગ ૫ દુગંચા ૬ પરીહરે, જરમણે હાથે પડીલેવા, કૃષ્ણ લેસ્યા ૭, નીલ લેસ્યા ૮ કાપોત લેસ્યા ૯ પરીહરે, માથા ઉપર પડીલેવા, રસગારવ ૧૦, રિદ્ધિગારવ ૧૧, સાતા ગારવ ૧૨ પરીહરે, મોઢે, પડીલેવા, માયા શલ્ય ૧૩, નીયાણુ શલ્ય ૧૪, મિથ્યાત્વ શલ્ય ૧૫ પરીહરે, છાતી આગળ પડીલેવા, છોધ ૧૬ માન ૧૭ પરીહરે, પુંઠુ ડાએ ખબે પડીલેવા. માયા ૧૮ લોલ ૧૯, જરમણે ખબે પડી લેવા, પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેજકાય ૨૨ ની જયણા કરે, ડાએ ખબે પડીલેવા વાઉકાય ૨૩ વનસ્પતીકાય ૨૪ ત્રસ્કાય ની રક્ષા કરે, જરમણે પગે પડીલેવા. ( તે મધ્યે સાહુ શ્રાવકને બોલ ૫૦ કહેવા અને લેસ્યા ૩ શલ્ય ૩ કૃપાય ૪, એ દશ શિવાય ૪૦ બોલ સાધ્વી આવીકાને કહેવા.

### સામાચિક પારવાની વિધિ.

૧ ખમાસમણ દેહું, ૨ છરિયાવહીઓ, ૩ તસ્સડિતરી ૪ અન્તર્થ ઉસ-  
સિઅણું, કણી પણી એક લોગસસનો અથવા ચાર નવકારનો કાઉસ્સસગ્ગ કરી  
લોગસસ પ્રગટ કહેવો. પણી ખમાસમણ દઈ છંછાકારેણું સંહિતાદુઃ ભગવનું  
મુહુર્પતિ પડી લેહું ” એમ કણી મુહુર્પતિ પડી લેહી, ખમાસમણ દઈ, છંછા,

કારેણું સંહિતાં ભગવનું સામાયક પાંડ યથા શક્તિ ” વતી અમાસમણું દ્વારા “ છચ્છા કારેણું સંહિતાં ભગવનું સામાયક પાંડ તહુતિ ” કહી પણી જમણું હાથ ચરવળા ઉપર અથવા કટાસણું ઉપર સ્થાપી એક નવકાર ગણી સામાયક વય જુતો કહીએ.

### અથ સામાધિયવયનૃતો.

સામાધિય વયનૃતો, જન મણે હોઢ નિયમ સંનુતો છિન્દ અસુહં કુમં સામાધિય જતિચાલારા. સામાધિયાં ભિંડિકાએ, સમણો ધવ સાવાઓ હવદ જમણા, એચેણું કારણેણું, અહુસે! સામાધિયાં કુનજા. સામાયક વિધિ લીધું વિધિ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુચ્ચો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ હુક્કડ. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવાં બત્તીશ હેઠમાં જે કોઈ હેપ લાગ્યો હોય તે સાવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ હુક્કડ.

( ત્યાર પણી જમણું હાથ થાપના સંસુખ સવળો રાખીને  
એક નવકાર ગણીએ. )



### અથ પચાખાણ વિધિ.

પ્રભાતના પચાખાણ.

### ॥ અથ નમુક્કાર અહિયં મુહુ સહિયં ॥

ઉગગચેસુરે નમુક્કાર અહિયં મુહુ સહિયં, પચાખાણ, ચડિવિલંપિ આહાર, અસણું, પાણું ખાખમં, સાધમં અનથણું ભોગેણું, સહસા ગારેણું મહતરા ગારેણું સવ્વ સમાહિય વત્તિયા ગારેણું વોસિરે.

### અથ પોરસિં સાઠ પેઃ સિંનું

ઉગગચેસુરે નમુક્કાર સહિયં, પોરસિં, સાઠુપોરસિં મુહુ સહિયં,

પદ્યભાઈ, ઉગ્ગાંશેસરે, ચલવિહંપિ આદારં અસણું પાણું ખાઈમં સાધમં  
અનથણું ભોગેણું, સહસા ગારેણું પદ્ધતકલેણું, દિસમોહેણું સાહુવયણેણું  
મહતરાગારેણું, સવ્ય સમાહિ વત્તિયાગારેણું, વોસિરે. (ઇતિ)

### અથ બેઆસણું તથા એકાસણું

ઉગ્ગાંશેસરે નમુક્કારસહિંયાં પોરસિં સાહુપોરસિં પુરીમહું મુક્કસહિંયાં  
પદ્યભાઈ ઉગ્ગાંશેસરે ચલવિહંપિ આદારં અસણું પાણું ખાઈમં સાધમં  
અનથણું ભોગેણું સહસાગારેણું પદ્ધતકલેણું દિસમોહેણું સાહુવયણેણું  
મહતરાગારેણું સવ્યસમાહિવતિઅં ગારેણું એકાસણું એ આસણું પદ્યભાઈ  
તિવિહંપિ આદારં અસણું ખાઈમં સાધમં અનથણું ભોગેણું સહસાગારેણું  
સાગરિઅં ગારેણું આઉટણું પસારેણું ગુડ આદુડાણેણું પારિદ્વાણિયાગારેણું  
મહતરાગારેણું સવ્યસમાહિવતિઅં ગારેણું પાણુસ્સ કેવેણુવા અદેવેણુવા અ-  
છેણુવા બહુલેવેણુવા સાસિદ્ધેણુવા અસિદ્ધેણુવા વોસિરે. (ઇતિ)

### અથ ર્યાય ભિલનું

ઉગ્ગાંશેસરે નમુક્કાર સહિંયાં પોરસિ સાહુપોરસિ મુક્કસહિંયાં પદ્યભાઈ  
ઉગ્ગાંશેસરે ચલવિહંપિ આદારં અસણું પાણું ખાઈમં સાધમં અનથણું  
ભોગેણું સહસાગારેણું પદ્ધતકલેણું દિસમોહેણું સાહુવયણેણું મહતરાગારેણું  
સવ્યસમાહિ વત્તિયાગારેણું એકાસણું પર્યાધ તિવિહંપિ આદારં અસણું  
ખાઈમં સાધમં અનથણું ભોગેણું સહસાગારેણું સાગરિઅં ગારેણું આ-  
ઉટણું પસારેણું ગુડ આપદુઢાણેણું પરિદ્વાણિયાગારેણું મહતરાગારેણું સવ્ય-  
સમાહિવતિઅં ગારેણું પાણુસ્સ કેવેણુવા અદેવેણુવા અથેણુવા બહુલેવેણુવા  
સાસિદ્ધેણુવા અસિદ્ધેણુવા વોસિરે.

### અથ ચલવિહાર ઉપવાસનું

સરે ઉગ્ગાંશે અસત્તાનું પદ્યભાઈ ચલવિહંપિ આદારં અસણું પાણું  
ખાઈમં સાધમં અનથણું ભોગેણું સહુસાગારેણું પારિદ્વાણિયાગારેણું  
મહતરાગારેણું સવ્યસમાહિવતિઅં ગારેણું વોસિરે.

### અથ તિવિહાર ઉપવાસનું.

સ્તરેછુગાએ અભતારું પચ્યખાઈ તિવિહંપિ આહાર અસણું પાણું  
ખાઈમં સાઠમં અનથણ્યા ભોગેણું સહસાગારેણું પારિદૂવણિા ગારેણું  
મહતરાગારેણું સંવસમાહિવત્તિઆગારેણું પાણુહાર પેરસિં સાફુપોરસિં મુક્  
સહિઅં ઘરસહિઅં પચ્યખાઈ ઉગાએસરે પુરિમંડું અવહું પચ્યખાઈ  
અનથણ્યા ભોગેણું સહસાગારેણું પચ્યનકાણેણું દિસામોહેણું સાહુવણેણેણું  
મહતરાગારેણું સંવ સમાહિવત્તિઆ ગારેણું પાણુરસ કેવેણુવા અકેનેણુવા  
અથણેણુવા અહુદેવેણુવા સસિથેણુવા અસિથેણુવા વોસિરે.



### સાંજના પચ્યખાણ.

### અથ પાણુહાર દ્દિવસ ચારિત્રનું.

પાણુહાર દ્દિવસ ચરિત્રમં પચ્યખાઈ અનથણ્યાભોગેણું સહસાગારેણું  
સંવ સમાહિ વત્તિઆ ગારેણું વોસિરે.

### અથ ચંડિવિહારનું

દ્દિવસ ચરિત્રમં પચ્યખાઈ ચંડિવિહંપિ આહાર અસણું પાણું ખાઈમં  
સાઠમં અનથણ્યા ભોગેણું સહસાગારેણું મહતરાગારેણું સંવસમાહિ  
વત્તિઆગારેણું વોસિરે.

### અથ તિવિહારનું

દ્દિવસ ચરિત્રયં પચ્યખાઈ તિવિહંપિ આહાર અસણું ખાઈમં સાઠમં  
અનથણ્યાલોનેણું સહસાગારાઙ્ક નહારાનારાંક સંબન્ધિવત્તિઆગારેણું નોંધારાં.

### અથ દુવિહારનું

દ્દિવસ ચરિત્રયં પચ્યખાઈ દુવિહંપિ આહાર અસણું ખાઈમં અન-  
ધ્યાણું ભોગેણું સહસાગારેણું મહતરાગારેણું સંવસમાહિવત્તિઆગારેણું વોસિરે.

## આરતીઓ.

( ૧ )

અપ્સરા કરતી આરતી જિન આગે, હારે જિન આગેરે જિન આગે ॥  
 હારે એતો અવિયળ સુખાં માગે, હારે નાલિનાંદ્ન પાસ ॥ અપ્સરા કરતી  
 આરતી જિન આગે ॥ ૧ ॥ તાયેદ નાટક નાચતી પાય ઠમકે, હારે દોય  
 ચરણે આંજર ડમકે ॥ હારે સોવન ધુઘરડી ધમકે, હારે લેતી કુદડી આળ ॥  
 અપ્સરા૦ ॥ ૨ ॥ તાલ મૃહંગને વાંસળી ઉદ્વેષાં, હારે ઝડ ગાવંતી સ્વર  
 અણા ॥ હારે મધુર સુરાસુર નથણાં, હારે નેતી મુખડું તીણા ॥ અપ્સરા૦ ॥  
 ॥ ૩ ॥ ધન્ય મદ્હેવા ભાતને પ્રભુ જન્યા હારે તોરી કંચન વરણી કાયા ॥  
 હારે મેતો પૂરવ પુન્યે પાયા, હારે દેખ્યો તોરો દેદાર ॥ અપ્સરા ॥ ૪ ॥  
 પ્રાણુલુલન પરમેશ્વર પ્રભુ ખારો, હારે પ્રભુ સેવક હું છું તારો ॥ હારે  
 ભવોભવના હુઃખાં વારો, હારે તુમે દીન દ્યાળ ॥ અપ્સરા૦ ॥ ૫ ॥  
 સેવક જણી આપણો ચિત્ત ધરજે, હારે મોરી આપદા સધળી હરજે ॥  
 હારે મુનિ માણોક સુખાંઓ કરજે, હારે જણી પોતાનો આળ ॥ અપ્સરા ॥ ૬ ॥

( ૨ )

ને ને આરતી આહિ જિણણાંદ્ન, નાલિરાયા મહદેવીડા નંદા ॥ ને ને  
 ॥ આરતી૦ ॥ ૧ ॥ પહેલી આરતી પુન કીજે, નરભવ પાનીને લહાવો  
 કીજે ॥ ને ને આરતી૦ ॥ ૨ ॥ દુસરી આરતી દીન દ્યાળા, ધુળેવ  
 મંદન પ્રભુ જગ અજવાલ્યાં ॥ ને ને આરતી ॥ ૩ ॥ તીસરી આરતી  
 જિલ્લુવન દેવા, સુર નર ઈદ્ર કરે તોરી સેવા ॥ ને ને આરતી ॥ ૪ ॥  
 ચોથી આરતી ચંગતિ ચૂરે, મનવંછિત ઝળ શિવસુખ પૂરે ॥ ને ને આરતી  
 ॥ ૫ ॥ પંચમી આરતી પુજ્ય ઉપાયા, મૂળયંદ રિપલ ગુણ ગાયા ॥ ને ને  
 આરતી૦ ॥ ૬ ॥

( ૩ )

## મહાવીર સ્વામીની આરતી.

જ્યે દેવ, જ્યે દેવ, જ્યે સુખના સ્વામી ॥ ( પ્રભુ. ) તુજે વંદન

કરીયો, (૨) લય ભાવના ભાગી ॥ જ્યદેવો ॥ ૧ ॥ સિદ્ધારથના સુત  
ત્રિશલાના જ્યા ॥ પ્રભુ ॥ જ્યસોહાના છો કંથળ (૨) ત્રિલુલન જગરાયા  
॥ જ્યદેવો ॥ ૨ ॥ બાળપણું માં આપ, ગયા રમવા કાને ॥ પ્રભુ ॥  
હેવતાએ દીવો પડળાયો, (૨) ભીવરલવા કાને ॥ જ્યદેવો ॥ ૩ ॥  
એક વારનું રૂપ લીધું છે નાગનું ॥ પ્રભુ ॥ ભીજુ વરનું રૂપ, (૨)  
લીધું અણકનું ॥ જ્યદેવો ॥ ૪ ॥ બાળક પીના રોં પોતે નથી ભીતા ॥  
॥ પ્રભુ ॥ દેવતાનું કાંઈ ન ચાલ્યું (૨) હારી જતા રહેતા ॥ જ્યદેવ ॥  
॥ ૫ ॥ એવા છે ભગવાન, મહાવીર તમે જણો ॥ (પ્રભુ) વહે છે  
સહુ તેને (૨) નમે રાય રાણો ॥ જ્યદેવો ॥ ૬ ॥

( ૪ )

### શાંતિનાથની આરતી.

જ્યન જ્યન આરતી શાંતિ તુમારી, તોરા ચરણ ક્રમદકી જાઉ બદીન  
હારી ॥ જ્યો ॥ ૧ ॥ વિશ્વસેન અચિરાળ ડો નંદા, શાંતિનાથ સુખ પુત્રમ  
ચંદા ॥ જ્ય ॥ ૨ ॥ ચાલીશ ધનુઃ સેવનમય કાયા, મુગ લંઘન પ્રભુ  
ચરણ સુહાયા ॥ ૩ ॥ જ્યો ॥ ચક્રવર્તી પ્રભુ પાંચમા સોહે, સોલમા જિનન  
વર જગ સહુ મોહે ॥ જ્યો ॥ ૪ ॥ મંગલ આરતી તોરી કીને, જરૂર  
જનમનો લાલો લીને ॥ જ્યો ॥ ૫ ॥ કર જેડી સેવક ગુણ ગાવે, સો  
નર નારી અમરપદ પાવે ॥ જ્યો ॥ ૬ ॥

( ૫ )

શ્રી સરસ્વતી માટી, ઝીપા કરો આટી, સરસ વચન સુખદાટી, દો  
મુજ ચતુરાટી, જ્ય દેવ જ્ય દેવ ૧ વરધમાન દેવા જુગમાં નહી એવા,  
પાતીક દુર કરવા કરે દ્યુર સેવા જ્યદેવ. ૨. રતન ત્રયી રાયા ત્રિશલાના  
જ્યા સીદ્ધારથ કુળ આયા, કચેનવરણી કાયા. જ્યદેવ. ૩ શાસન બાંડ  
સારો લાગે મુજ ખારો, સંકટ દુર નિવારો, ભવ જગથી તારો જ્યદેવ  
૪. તું ત્રિલુલન સ્વામી કરમ મેદા વામી કેવલરાન સુપાભ્યા, શિવપુરના સ્વામી

જ્યેષ્ઠ ૫ અવ આરત ટાગો, નેડ નંદે આગો મયા કરી મુજ તારો મુજ  
૪૨ તુમ આલો. જ્યેષ્ઠ. ૬

( ૬ )

સકલ મંગલકારી, શ્રીલુલન ઉપગારી દુરગતી દુર નીબારી, વરીઆ  
શીવનારી, જ્યેષ્ઠ જ્યેષ્ઠ. ૧ પારસનાથ નામી, ચીંતામણુ સ્વામી કરું આ-  
રતી શીરનામી, મુજ અંતર જાગી જ્યેષ્ઠ ૨ નણુ જ્યગત રાયા વામાંએ  
નાયા અશ્વસેન કુલ આયા, નીલ વરણુ કાયા જ્યેષ્ઠ. ૩ કુમઠડો હઠ વામી  
શાન કેવલ પામી. ભક્તાને મન વિશામી, ભયે સિદ્ધ સ્વામી જ્યેષ્ઠ. ૪.  
તુજ શુણ હું રસિએ, મુજ મન તું વસિએ મયા કરી ઉલસીએ, શુણ  
ગાવા ધસીએ. જ્યેષ્ઠ જ્યેષ્ઠ.

### મંગળ દીવો।

દીવો રે દીવો મંગળિક દીવો આરતી ઉતારક ખડુ ચિરંભુબો ॥  
॥ દીવોં ॥ ૧ ॥ સોહામણુ ધર પર્વ દીવાળી અંભર જેસે અયળા આગી  
॥ દીવોં ॥ ૨ ॥ દેપાળ ભણે ધણે ધેર અજવાળી, ભાવે ભક્તે વિદ્ધ નિ-  
વારી ॥ દીવોં ॥ ૩ ॥ દેપાળ ભણે ધણે આ કળિ કળે, આરતી ઉતારી  
રાજ કુમારપણે ॥ દીવોં ॥ ૪ ॥ અમદ્વાર મંગળિક તમ ધર મંગળિક,  
મંગળિક ચતુર્વિધ સંધ ધર હોણે ॥ ૫ ॥

### અથ મંગળ ચાર.

ચારો મંગળ ચાર, આજ મહારે ચારો મંગળ ચાર ॥ દેખ્યો દરસ  
સરસ જિનજીડો, શોલા સુંદર સાર ॥ આજો ॥ ૧ ॥ છિનું છિનું છિનું  
મન મોહન અરણો, ધરી કેસર ધનસાર ॥ આજો ॥ ૨ ॥ વિવિધ જાતિકે  
પુણ્ય મંગાવો, મોધર લાલ શુલાલ ॥ આજો ॥ ૩ ॥ ધૂપ ઉમેવોને કરો  
આરતી મુખ બેલો જ્યકાર । આજ ॥ ૪ ॥ હર્ષ ધરી આદીશ્વર પૂને  
ચૌમુખ પ્રતિમા ચાર ॥ આજ ॥ પાંચ હૈયે ધરી ભાવના લાવ ભાવો જીમ પામો  
ભવપાર ॥ આજો ॥ ૫ ॥ સકળાયંદ સેવક જિનજીડો, આનંદધન ઉપકાર  
આજો ॥ ૬ ॥

## વર્તમાન ચોવીસ તીર્થંકરનો કોડો.

તીર્થંકરનું નામ	ચ્યવન, જન્મ દિક્ષા, ક્રેવત	મોક્ષ	લંઘન
૧ રીખવહેવ	વનીતા	અધાપદ	વૃષભ
૨ અજુતનાથ	વનીતા	સીખરજ	હાથી
૩ સંભવનાથ	સાવચ્છીનગરી	"	અચ્ય
૪ અલિનંદન	વનીતા	"	વાંદર
૫ સુમતીનાથ	વનીતા	"	કોંચ્યપક્ષી
૬ પદ્મપ્રભુ	કેસંધી	"	કમલ
૭ સુપાદ્મનાથ	વણુદ્વસી	"	સાથીયો
૮ ચંદ્રપ્રભુ	ચંદ્રપુરી	"	ચંદ્ર
૯ સુવીધીનાથ	કાકંદી	"	મગર
૧૦ શીતલનાથ	ભાહિલપુર	"	શ્રીવત્સ
૧૧ ગૈયાંસનાથ	સીંહપુરી	"	ગેડાનું
૧૨ વાસુપુજ્ય	ચંપાપુરી	ચંપાપુરી	પાડાનું
૧૩ વિમલનાથ	કંપિલાપુરી	સીખરજ	વરાહ
૧૪ અનંતનાથ	વનીતા	"	સીચાણુ
૧૫ ધર્મનાથ	રલપુરી	"	વળ
૧૬ શાંતીનાથ	હસ્તીનાપુરી	"	હરિણ
૧૭ કુંથુનાથ	હસ્તીનપુરી	"	ખડરો
૧૮ અરનાથ	હસ્તીનાપુરી	"	નંદાવર્ત
૧૯ મહિનાથ	મથુરા	"	કલશ
૨૦ સુનસુત્રતસ્વામી	રાજગૃહી	"	કાચ્યબો
૨૧ નેમાનાથ	મથુરા	ગીરનાર	કમલ
૨૨ નમનાથ	સોરીપુરી	"	શાંખ
૨૩ પાદ્મનાથ	અનારસ	સીખરજ	સર્પ
૨૪ મહાવીર	ક્ષત્રોકુંડ	પાવાપુરી	સિંહ

ચોવીશ તીર્થંકરનું ગાયન.

( વારેધા વીઠલા વેલોરે )

જિનપતી અરજુ અમારી, દીલમાં પ્રીતે લે તું ધારીરે,  
નમે તુને પ્રણ તમારીરે—૨

રીખવદૈવ રોતુંન વાસી, કરને લીલા લહેર,  
મહીમા સુણુને શરણે આવ્યો, તારો કરીને મહેર,  
મહેરયાની કરને સારી. દીલમાં—૧

અજુતસ્વામી તારંગાવાળા, સંભવ સુખના ધામ;  
અભીનંદન અભે વચન આપો આવો અમારે ગામ,  
ગામડી હેણો અમારી દીલમાં—૨

સુમતિ પદ્મ સુપ્રાર્થ જિનેશ્વર ચંદ્ર આઠમા હેવ,  
સુવિધિ શિતલ દશમે જણ્યા ચેયાંસની કરં સેવ,  
સેવા તો કાગે ઘારી. દીલમાં—૩

વાસુપુન્ય પઢી વિમલ થયા, વલી અનંત ધર્મ ધશ,  
શાંતિ કુંધુ અર ભક્તિ જિનેશ્વર, મુનિસુષ્ટત જિન વીશ,  
વાશેને વંદના મારી દીલમાં—૪

નમીનાથ ને બાવીશમા નેમળ, રાજુલ કેરા કંથ  
પરણું ગ્રેમે પડું મુકી લીધે ગીરનારનો પંથ,  
રાજુલ કરે તરવા તૈથારી. દીલમાં—૫

પાર્થીપ્રલુ શાંખેશ્વર રાજન પરહુઃખભંજન પ્રાણ,  
નાગ નેડી બળતી ઉગારી, કમઠે માની આણ,  
આણ માનું ગ્રેમથી તારી. દીલમાં—૬

વર્ષીમાન જિન ચોનીસમા વંદુ વાર હળર,

જિન પ્રતિમા વંદેને હરહમ ઉત્તરવા ભવપાર,

પાર કરે કહું પોકારી.

દીલમાં—૭

વડા ગણુધર વર્ષીમાનના ગૌતમ ગુણુની આણુ

ખીજન દશ એક એકથી ચહતા, માનીએ તેલની આણુ,

આણુ કરે પ્રેમથી પ્યારા.

દીલમાં—૮

ભવજળ તરવા પાર ઉત્તરવા ધરવું જિનનું ધ્યાન,

ચોનીશ જિન એકદશ ગણુધર વધારણે બહું માન,

માન હેણે પોતાના ધારી

દીલમાં—૯

દોશી કસ્તુર વાલજુ હું, લીંઘડી મારો મુકામ

એકલો ઉભો ભવ દરીઅયામાં અવણે પહું તુજ નામ

નામના જાણી તમારી.

દીલમાં—૧૦



મહાત્મા

ગાંધીજિની



## આશા.

**સ્વહેરી માલનો વપરાસ**  
કરો અને ઉતેજન આપો. તથા સ્વહેરીને નામે ચાલતી  
દગલ ખાણી ચેતને અને ભીજને ચેતાવને.

**સ્વહેરી**— સુતર, હાથ વણાઈની સાળ, તેને  
લગતો સામાન, ચરખા, જુદીજુદી  
જાતનું કાપડ, તરેહ તરેહની ખાદી,  
ધોતર, સાડી, ચારસા, ચાદર, ફુલાલ વીજેરેને માટે લખો યા મલો.  
સ્વહેરી સુતર અને સાળ વણાઈની

**પાકી ગોરન્ટી**  
શરનની વીરદ્ધ વર્તન કર્યાનું સાણીત કરનારને

**રૂ. ५०० ઈનામ**

**ભાલીકઃ—ને. ભગનલાલની કું.**

શ્રી સ્વહેરી ઉદ્યોગ ગૃહ  
અમલસાડ સ્ટેશન બી. બી. રેલ્વે.

**એઝન્ટ—અંડુભાઈ શંકરલુ દેશાઈ**

મળવાનું છેકાણું—અળવંતરાવ કે. દેશાઈ એમ. એ. એલ. એલ. બી,  
ગીરગામ પોસ્ટ ઓફિસ મુંબાદ નાં. ૪

# જાહેર ખાયર.

---

અમારા સુપ્રસિદ્ધ પુસ્તકાત્યમાં જૈન ધર્મને લગતાં સંસ્કૃત ભાગથી હીંદી તેમજ ગુજરાતી ભાષામાં છપાવેલાં તમામ પુસ્તકો મળે છે.

તેમજ સ્તવનાવલીએ, રાસાએ, તથા જૈન નોવેલો, તથા કથાના દરેક પ્રકારના પુસ્તકો અમારે ત્યાં મળે છે.

બલી સુરત, ભાવનગર, અમદાવાદ, જામનગર, વિગેરે સ્થળોએ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પણ અમારે ત્યાંથી મલી શકેછે.

આ ઉપરાંત પણુસણુની તથા નવાં વર્ષની ફેન્સી કંડેન્ટીએ, કાર્ડી, ચેકો, વિગેરે મોટા જથ્થામાં તૈયાર રાખવામાં આવે છે.

તેમજ કાર્ટિકી તથા ઐત્રી પંચાંગ તથા અનેક તીર્થિના રંગ બેરંગી નકશાએ પણ મળી શકે છે.

માઈસલીસ્ટ તફન મફત મેઅલવામાં આવે છે.

લખો—

## શ્રાવણ ભીમસિંહ માણેક.

માંડવી શાકગલી—મુંબઈ નાં. ૩

